૨૦૩ વર્ષ
દૈનિક
મુંબઈ સમાચાર
સૌરાષ્ટ્ર આવૃત્તિ
મુંબઈથી પ્રસિદ્ધ થતું ■ સ્થાપના: ૧ જુલાઈ ૧૮૨૨ ■ પુસ્તક: ૨૦૪ ■ Volume 68 ■ Issue 148 ■ વિક્રમ સંવત ૨૦૮૧
■ જયેષ્ઠ વદ - ૧૪ ■ મુંબઈ ■ MUMBAI SAMACHAR ■ www.bombaysamachar.com ■ 24 June 2025, Tuesday ■ REGD.No. MCS/058/2018-20
R.N.I. No. GUJ GUJ /2013/58486 ★
મંગળવાર, ૨૪ જૂન ૨૦૨૫ (૧૨ પાનાં), કિંમત ₹ ૧૦.૦૦ | તરોતાજા પૂર્તિ | LIKE & FOLLOW: /Mumbaisamachar4u

સુરત પર આભ ફાટ્યું: ૧૨ કલાકમાં ૯.૫૩ ઈંચ વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા બાદ મેઘરાજાએ સુરતને બાનમાં લીધું હતું. સુરત જિલ્લામાં પર મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં ૯.૫૩ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. વરસાદના પગલે માત્ર સુરત જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં સવારે છ કલાકથી સાંજે છ કલાક સુધી ૧૩૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં સૌથી વધુ ૯.૫૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. કામરેજમાં ૭.૩૬ ઇંચ, પલસાણામાં ૬.૩ ઇંચ, બારડોલીમાં ૪.૮ ઇંચ, ડોલવણમાં ૪.૨૯ ઇંચ, ઓલપાડમાં ૪.૨૧ ઇંચ વરસાદ પડ્યો હતો.

આ સિવાય બોરસદમાં ૩.૬૨ ઇંચ, ચોર્યાસીમાં ૩.૫૪ ઇંચ, સુરતના માંગરોળમાં ૩.૧૫ ઇંચ, સુરતના માંડવીમાં ૩.૦૩ ઇંચ, ખંભાતમાં ૨.૮૭ ઇંચ, નવસારીમાં ૨.૭૨ ઇંચ, જેતપુર પાવીમાં ૨.૪ ઇંચ, વ્યારામાં ૨.૩૬ ઇંચ, વાડોલમાં ૨.૨૮ ઇંચ, જલાલપોરમાં ૨.૨ ઇંચ, વાંકાનેરમાં ૨.૦૯ ઇંચ, નડીયાદમાં ૨.૦૫ ઇંચ, સુરતના મહુવામાં ૨.૦૧ ઇંચ વરસાદ પડ્યો હતો.

આ સિવાયના ૧૧૬ તાલુકામાં ૧.૯૭ ઇંચથી લઈ ૦.૦૪ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. ૯૩ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. ■

જળબંબાકાર: ગુજરાતના સુરતમાં સોમવારે ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં. પાણીમાં ડૂબેલી સાઈકલો પાસેથી પસાર થઈ રહેલા રાહદારીઓ. (એજન્સી)

ગુજરાતનાં ૧૦ જળાશય છલોછલ, ૨૯ ડેમ ૭૦ ટકા ભરાતા ઍલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સૂરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-૧ અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ ૧૦ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાયા છે. જેથી હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી. ગત વર્ષે તેમ જ ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના (જુઓ પાનું ૨) ▸▸

કતરના અમેરિકન એરબેઝ પર ઈરાનનો હુમલો

કતર, બેહરીન, યુએઈ એરસ્પેસ બંધ

દુબઈ: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સોમવારે મોટો વળાંક આવ્યો હતો જ્યારે ઈરાને કતર ખાતેના અલ-ઉદેત એરબેઝ પર જે મીડલ-ઈસ્ટનું અમેરિકાનું સૌથી મોટું મીલીટરી થાણું છે તેના પર મીસાઈલોનો વરસાદ વરસાવ્યો હતો. ઈરાનના આ હુમલાના ધમાકાઓ દોહા સુધી સંભળાયા હતા. ઈરાનના હુમલા બાદ કતરે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. કતરના રાજકીય પ્રવકતાએ જણાવ્યું હતું કે ઈરાનની ઘણી મિસાઈલોને તોડી પાડવામાં આવી હતી. ઈરાનની ટીવી ચેનલોએ પણ આ હુમલાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે ઈરાને બદલો લઈ લીધો છે.

અગાઉ અમેરિકાએ રવિવારે ફોર્ડો અણુમથકને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. સોમવારે ફરી આ અણુમથક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કોણે કર્યો અને નવેસરથી કરવામાં આવેલા (જુઓ પાનું ૨) ▸▸

વિધાનસભા પેટાચૂંટણી: ‘આપ’એ પંજાબ, ગુજરાતની બેઠક જાળવી, કેરળમાં કૉંગ્રેસનો વિજય

નવી દિલ્હી: વિધાનસભાની પેટાચૂંટણીમાં ‘આપ’ના ગોપાલ ઈટાલિયાએ ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. ‘આપ’એ પંજાબ વિધાનસભાની લુધિયાણા વેસ્ટ બેઠક પણ જાળવી રાખી હતી. કેરળમાં કોંગ્રેસના વડપણ હેઠળના યુડીએફના ઉમેદવારે નિલાંબર બેઠક પર શાસક એલડીએફના ઉમેદવારને ૧૧,૦૭૭ મતથી પરાજય આપ્યો હતો, એમ ચાર રાજ્યના પેટાચૂંટણીના જાહેર કરવામાં આવેલા પરિણામમાં જણાવવામાં આવ્યું હતું.

શાસક ભાજપે ગુજરાતની કડી બેઠક જાળવી રાખી હતી તો તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની કાલિગંજ બેઠક પર વિજય મેળવ્યો હતો.

વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી ૧૯મી જૂને યોજવામાં આવી હતી. ‘આપ’ના ગુજરાત એકમના ભૂતપૂર્વ પ્રમુખ ઈટાલિયાએ નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર કિરીટ (જુઓ પાનું ૨) ▸▸

કેએલ રાહુલ અને પંતની સદી, ઈંગ્લેન્ડને જીતવા ૩૭૧ રનનો લક્ષ્યાંક

લીડ્સ: લીડ્સમાં રમાઇ રહેલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં ૩૬૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેએલ રાહુલ અને ઋષભ પંતની સદીથી ભારતે ૩૭૦ રનની લીડ મેળવી હતી અને ઇંગ્લેન્ડને જીતવા માટે ૩૭૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે બીજા દાવમાં કોઈ નુકસાન વિના ૨૧ રન કર્યા હતા. હજુ તેને જીતવા વધુ ૩૫૦ રનની જરૂર છે. ભારત માટે બીજી ઇનિંગમાં પંત અને રાહુલે ચોથી વિકેટ માટે ૧૯૫ રનની ભાગીદારી કરી હતી. ભારતે ચોથા દિવસે બે વિકેટે ૯૦ રનથી રમવાનું શરૂ કર્યું, પરંતુ ટીમે કેપ્ટન શુભમન ગિલની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. આ પછી પંત અને રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. પંત ૧૧૮ રન અને રાહુલ ૧૩૭ રન કરીને આઉટ થયા હતા. ■

કાશીપુરમાં આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીનું કૌભાંડ પકડાયું, ૩૨ નેપાળી યુવાનોને બચાવવામાં આવ્યા

કાશીપુર (ઉત્તરાખંડ) : ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના કાશીપુરમાં એક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. નેપાળના ૩૨ છોકરાને લલચાવીને અને ફોસલાવીને એક ઘરમાં બંધ કરીને જબરદસ્તીથી કંપનીના ઉત્પાદકો વેચવાની ફરજ પાડવામાં આવી. પોલીસે આ બધાને બચાવીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. દિલ્હીસ્થિત કંપની પર પણ ગાળિયો મજબૂત કરવામાં આવી રહ્યો છે.

નેપાળ દૂતાવાસની ફરિયાદને આધારે શનિવારે ઉત્તરાખંડ પોલીસે આ આખા ઑપરેશનને અંજામ આપ્યો. પોલીસની ટીમનું નેતૃત્વ એસએસપી મણિકાંત મિશ્રા અને દૂતાવાસથી જોડાયેલા એક અધિકારી નવીન જોશી કરતા હતા. તેમના જણાવ્યા પ્રમાણે નેપાળના યુવાનોને સોશિયલ મીડિયા મારફતે નોકરી દેવાની લાલચ આપીને ભારત લાવવામાં આવ્યા. ત્યાર બાદ તેમને કાશીપુરમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા. આની સૂચના એસએસપીને આપવામાં આવી

ઉધમ સિંહ નગરના એસએસપી મણિકાંત મિશ્રાએ કાશીપુરના ક્ષેત્રાધિકારી દીપક સિંહની આગેવાનીમાં એક ખાસ ટીમની રચના કરી. પોલીસ ટીમે નેપાળી અધિકારી નવીન જોશી સાથે મળીને ઓમ વિહાર કૉલોનીસ્થિત એક મકાનમાં છાપો માર્યો. આ મકાનમાં મહારાજ સિંહ ઉર્ફે પપ્પુ નામની વ્યક્તિ રહેતી હતી. પોલીસના દરોડા દરમિયાન નેપાળના ૩૨ યુવાનો મકાનની અંદરથી મળી આવ્યા હતા. આમાં ત્રણ સગીર વયના છોકરા હતા. આ યુવાનોને નોકરીની લાલચ આપીને ભારત લાવવામાં આવ્યા. અહીં આવ્યા બાદ તેમને લીડ વિઝન ટ્રેડિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના પ્રોડક્ટ વેચવાની ફરજ પડાઈ. યુવાનોને બહાર જવાની પરવાનગી પણ અપાતી નહોતી.

નેપાળી યુવાનો સાથે માનસિક અને શારીરિક રીતે અત્યાચાર કરવામાં આવતો હતો. આરોપી તેમની પાસેથી બળજબરીથી નાણાં પડાવતા હતા. આ રકમ કંપનીના ખાતામાં જમા કરાવાતી હતી. પોલીસે મકાનમાંથી ત્રણ આરોપી બિરેન્દ્ર શાહી, સચિન કુમાર અને મનીષ તીવારીની ધરપકડ કરી હતી. આરોપીએ ખુલાસો કર્યો હતો કે તેઓ લીડ વિઝન ટ્રેડિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપની સાથે જોડાયેલા છે જેની હેડ ઑફિસ દિલ્હીના જનકપુરીમાં છે.

તેમણે એવી કબૂલાત કરી કે આ પૂરી યોજના કંપનીના ડિરેક્ટર ચેતન હાંડાની હતી. તે જ આરોપીને શીખવાડતા કે યુવાનોને કઈ રીતે ફસાવવા, નોકરીની લાલચ દેખાડીને તેમની પાસેથી નાણાં પડાવવા અને પછી તેમને બંધક બનાવવા.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ કેસ ફક્ત બાળશ્રમ અને માનવ તસ્કરીની કલમો લગાડવામાં આવી છે. જોકે આરોપી પાસે કાયદેસર દસ્તાવેજ નહોતા.

પોલીસે બધા આરોપી સામે બાળશ્રમ નિષેધ અધિનિયમની ધારા ૧૪(૧૦), કિશોર ન્યાય અધિનિયમ ધારા ૭૯ અને ભારતીય ન્યાય સંહિતાની ધારા ૧૨૭(૪), ૧૩૭(૨),૧૧૧(૨), ૬૧(૨), ૧૧૫, ૩૫૧(૨), ૩૧૮(૪) હેઠળ એફઆઈઆર નોંધાવામાં આવી છે. તદુપરાંત નવી દિલ્હીસ્થિત લીડ વિઝન ટ્રેડિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર ચેતન હાંડા અને કંપની સાથે જોડાયેલા બીજા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ■

વિરોધ: ન્યૂ યૉર્કવાસીઓએ હાથમાં પૉસ્ટરો અને બેનરો લઈને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાનો રવિવારે વિરોધ કર્યો હતો. (એજન્સી)

પટનામાં આરજેડી ધારાસભ્યના સાથીઓ સાથે જોડાયેલાં અનેક સ્થળોએ દરોડા

પટના: બિહાર પોલીસે સોમવારે પટનામાં ખંડણી કેસની તપાસના ભાગરૂપે દાનાપુર મતવિસ્તારના આરજેડી ધારાસભ્ય રિતલાલ યાદવના સહયોગીઓ અને લાલુ પ્રસાદ પરિવારના નજીકના સહયોગી સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.

દાનાપુરના કોઠવા ગામમાં આરજેડી ધારાસભ્યના ચાર ફરાર સાથીઓની ધરપકડ કરવા માટે રવિવાર અને સોમવારની રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં આરજેડી ધારાસભ્ય પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં છે.

શહેર પોલીસ અધિક્ષક(પશ્ચિમ) ભાનુ પ્રતાપ સિંહે જણાવ્યું કે એક વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે રિતલાલ યાદવના સહયોગીઓ ચાર ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા. ■

એક્સ્ટ્રા અફેર

ભરત ભારદ્વાજ
feedback@bombaysamachar.com

વિસાવદરમાં પૂરી તાકાત લગાવવા છતાં ભાજપને નિરાશા મળી

ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. ૨૦૨૨ની ચૂંટણીમાં કડી વિધાનસભા બેઠક ભાજપના કરશન સોલંકીએ જીતી હતી પણ સોલંકીનું નિધન થતાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ૩૯,૪૫૨ મતે જીત થતાં આ બેઠક ભાજપે જાળવી છે. ૨૦૨૨માં વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ જીતી હતી પણ ભૂપેન્દ્ર ભાયાણી પક્ષપલટો કરીને ભાજપમાં જતા રહેતાં ખાલી પડેલી બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઊભા રાખેલા. ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને ૧૭,૫૫૪ મતે હરાવીને જીત મેળવતાં વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી છે.

ભાજપ અને આપ બંનેએ પોતપોતાની બેઠકો જાળવતાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છતાં ભાજપ માટે આ પરિણામ નિરાશાજનક ચોક્કસ છે. તેનું કારણ એ કે, વિસાવદર બેઠક જીતવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી. ભાજપ ૨૦૧૭માં જીતનારા કૉંગ્રેસના હર્ષદ રીબડિયા અને ૨૦૨૨માં જીતનારા આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણી એમ બબ્બે ધુરંધરોને તોડીને લઈ આવેલો. ભાજપે પોતાનું આખું તંત્ર ઈટાલિયાને હરાવવા કામે લગાડી દીધેલું છતાં ગોપાલ ઈટાલિયાને હરાવી શક્યો નથી.

૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક ૧૫૬ બેઠકો જીતી હતી પણ જે બેઠકો ભાજપ જીતી નહોતો શક્યો તેમાં એક વિસાવદરની પણ હતી. પહેલી જ વાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ ૫ બેઠકો જીતીને ખાતું ખોલાવ્યું તેમાં એક બેઠક વિસાવદરની પણ હતી. ભાજપે એ પછી કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેમાં તોડફોડ કરીને રાજીનામાં અપાવવા મથામણ કરી તેમાં આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો અડીખમ રહ્યા પણ ભૂપેન્દ્ર ભાયાણી ફસકી ગયેલા.

ભૂપેન્દ્ર ભાયાણી ફસકી ગયા ને આપ છોડીને ભાજપના શરણે ગયા તેનું કારણ સુરતનો સેક્સકાંડ મનાતો હતો. ભાયાણી ધારાસભ્ય બન્યા પછી ૨૦૨૩માં ભૂપેન્દ્ર ભાયાણીનો એક વીડિયો વાયરલ થયો હતો. હોટલના સીસીટીવીના વીડિયોમાં ભૂપેન્દ્ર ભાયાણી સુરતની એક હોટલમાં અજાણી યુવતી સાથે દેખાયા હતા. ભાયાણી યુવતી સાથે હોટેલમાં રંગરેલિયાં મનાવવા ગયા હતા ત્યારે યુવતીના પતિએ રંગેહાથે પકડતાં મોઢે રૂમાલ રાખીને ભાગ્યા હોવાની વાતો પણ વહેતી થઈ હતી.

ભાયાણીએ વાયરલ થયેલા સીસીટીવી અંગે એવી ચોખવટ કરેલી કે, આ વીડિયો મોર્ફ કરેલો અને ખોટો છે. આ રાજકીય ષડયંત્ર છે અને મને ખોટી રીતે ફસાવવા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ભાયાણીએ એવો દાવો પણ કરેલો કે, આ વીડિયો જૂનો છે અને ક્યારનો છે એ પણ મને યાદ નથી. જો કે સીસીટીવીના ફૂટેજ પ્રમાણે ભૂપેન્દ્ર ભાયાણી જેવી લાગતી વ્યક્તિ મોંઢે દુપટ્ટો બાંધેલી યુવતી સાથે ૮ જૂન ૨૦૨૩ના રોજ સવારે ૧૦.૨૫ વાગે ગેસ્ટ હાઉસમાં પ્રવેશી હતી. યુવતી પોતાની મરજીથી આવી હોય તે રીતે તેણે રજિસ્ટરમાં સહી કરી હતી અને ૧૧.૧૨ વાગે ભાયાણી જેવી લાગતી વ્યક્તિ હોટલમાંથી ભાગતી દેખાતી હતી એ જોતાં આ વીડિયો જૂનો નહોતો જ. આમ છતાં દરેક રાજકારણીની જેમ ભાયાણીએ દૂધે ધોયેલા હોય એવા દાવા કરેલા.

ભાયાણીની વાત સાચી હતી કે સોશિયલ મીડિયા પર વહેતી થયેલી વાતો સાચી હતી એ રામ જાણે પણ વીડિયો વાયરલ થયાના થોડા મહિનામાં ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દીધેલું અને ભાજપમાં જોડાઈ ગયેલા. તેના કારણે સૌને એવું જ લાગ્યું કે, સેક્સકાંડથી બચવા માટે ભાયાણી ભાજપની પંગતમાં બેસી ગયા છે.

ભાજપે પેટાચૂંટણીમાં ભાયાણીને ટિકિટ ના આપી ત્યારે જ સ્પષ્ટ થઈ ગયેલું કે, ભાજપ કોઈ ચાન્સ લેવા માગતો નથી. સેક્સકાંડમાં ખરડાયેલા ભાયાણીને ઉમેદવાર બનાવીને ભાજપ ચૂંટણી લડાય એ પહેલાં જ ઈટાલિયાની સ્થિતિ મજબૂત કરવા નથી માગતો. ભાજપે કિરીટ પટેલ જેવા ઓછા જાણીતા ચહેરાને ટિકિટ આપીને છાપેલાં કાટલાં સામેનો રોષ મતદાન વખતે ના દેખાય એવી ગણતરી માંડેલી પણ એ ફળી નથી.

વિસાવદર બેઠક લાંબા સમયથી ભાજપના હાથમાં આવતી નથી ને છેલ્લાં ૧૮ વર્ષથી ભાજપ આ બેઠક જીત્યો નથી. છેલ્લે ૨૦૦૭માં ભાજપની ટિકિટ પર કનુભાઈ ભલાળા વિસાવદરથી ચૂંટાઈ આવ્યા પછી સતત વિપક્ષી ઉમેદવાર જ જીતે છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક કેશુભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં કેશુભાઈએ તેમનો પક્ષ ભાજપમાં ભેળવી દીધો હતો તેથી યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસના હર્ષદ રીબડિયા ચૂંટાઈ આવ્યા હતા. રીબડિયા ૨૦૧૭ની ચૂંટણીમાં પાછા જીત્યા હતા પણ ૨૦૨૨માં ભાજપમાંથી લડ્યા ત્યારે હારી ગયેલા.

વિસાવદરમાં ભલે આમ આદમી પાર્ટી જીતી પણ આ જીત ગોપાલ ઈટાલિયાની વધારે છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ એ પહેલાં જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધેલા. ઈટાલિયા તાત્કાલિક પ્રચારમાં લાગી ગયેલા ને ભાજપ હજુ ઉમેદવાર નક્કી કરવાની ભાંજગડમાં પડેલો ત્યાં તો ઈટાલિયા વિસાવદરના ગામેગામ ફરી વળેલા. ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા પછી ગોપાલ ઈટાલિયાએ કિરીટ પટેલના સહકારી ક્ષેત્રમાં કહેવાતા ભ્રષ્ટાચારના મુદ્દાને ચગાવેલો. કિરીટ પટેલ આહિર જ્ઞાતિનાં લોકોને પરેશાન કરતા હોવાના મુદ્દાને પણ ચગાવાયેલો. ગોપાલ ઈટાલિયાએ જબરદસ્ત પ્રચાર તંત્ર ગોઠવીને દારૂ પકડવા સહિતના દાવ પણ અજમાવ્યા ને એ બધું તેમને ફળ્યું છે.

ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય બનતાં વિધાનસભામાં થોડીક રંગત જામશે કેમ કે ઈટાલિયા આક્રમક નેતા છે. કોન્સ્ટેબલની નોકરી છોડીને રાજકારણમાં આવેલા ગોપાલ ઈટાલિયા વિદ્યાર્થીઓ, ખેડૂતો વગેરેના પ્રશ્ને સતત બોલતા રહે છે. વાસ્તવમાં ગુજરાતમાં અત્યારે વિપક્ષમાંથી ગોપાલ ઈટાલિયા અને કૉંગ્રેસના જીજ્ઞેશ મેવાણી એ બે જ લડાયકતા બતાવે છે, વિપક્ષના બાકીના નેતા ભાજપની બી ટીમ જેવા છે. ધારાસભ્ય બનતાં ઈટાલિયાનો આત્મવિશ્વાસ વધશે. આમ આદમી પાર્ટી માટે પણ આ પરિણામો આત્મવિશ્વાસ વધારનારાં છે, ગુજરાતમાં આપની રાજકીય હાજરી હજુ છે એ આ પરિણામોએ સાબિત કર્યું છે.

આ બંને બેઠકોની પેટાચૂંટણીએ ફરી સાબિત કર્યું છે કે, કૉંગ્રેસ ગુજરાતમાં મરણપથારીએ પડેલી છે. કડીમાં કૉંગ્રેસના ઉમેદવારની લગભગ ૪૦ હજાર મતે હાર થઈ જ્યારે વિસાવદરમાં તો કૉંગ્રેસના ઉમેદવારને માંડ ૫૫૦૦ની આસપાસ મતો મળ્યા છે એ જોતાં કશું કહેવા જેવું પણ રહ્યું નથી.

ગુજરાતની કડી અને વિસાવદરની સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ, પંજાબમાં આમ આદમી પાર્ટી અને કેરળમાં કૉંગ્રેસ જીતી છે. આ પરિણામો ધારણા પ્રમાણેનાં છે તેથી તેનું એનાલિસિસ કરવાનો મતલબ નથી. ■

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

દક્ષિણાયન – સૌર વર્ષાઋતુ પ્રારંભ,
મંગળવાર, તા. ૨૪-૬-૨૦૨૫, ભદ્રા સમાપ્તિ

- ભારતીય દિનાંક ૩, માહે અષાઢ, શકે ૧૯૪૭
- વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૭, જયેષ્ઠ વદ-૧૪
- જૈન વીર સંવત ૨૫૫૧, માહે જયેષ્ઠ, તિથિ વદ-૧૪
- પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૪
- પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૪
- પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૪
- મુસ્લિમ રોજ ૨૭મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૬
- મીસરી રોજ ૨૮મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૬
- નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૨-૫૩ સુધી, પછી મૃગશીર્ષ.
- ચંદ્ર વૃષભમાં રાત્રે ક. ૨૩-૪૫ સુધી, પછી મિથુનમાં.
- ચંદ્ર રાશિ નામાક્ષરઃ વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
- સૂર્યોદયઃ મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૭, સ્ટા.ટા.,
- સૂર્યાસ્તઃ મુંબઈ ક. ૧૯ મિ. ૧૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૬, સ્ટા. ટા.
- મુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ • ઙ્ઘ
- ભરતીઃ સવારે ક. ૧૧-૧૯, સાંજે ક. ૨૨-૪૯
- ઓટઃ સાંજે ક. ૧૭-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૦ (તા. ૨૫)
- વ્રત પર્વાદિઃ વિક્રમ સંવત ૨૦૮૧, 'અનલ' નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૭, 'વિશ્વાવસુ'નામ સંવત્સર, જયેષ્ઠ કૃષ્ણ-ચતુર્દશી. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૩૫, સૂર્ય મહાનક્ષત્ર આર્દ્રામાં સવારે ક. ૦૬-૨૦. વાહન ઉંદર. • શુભાશુભ દિનશુદ્ધિઃ શુભ કાર્ય વર્જ્ય છે.
- મુહૂર્ત વિશેષઃ ચંદ્ર-મંગળ ગ્રહદેવતાનું પૂજન, બ્રાહ્મજીનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો, શ્રીસત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ પાઠ વાંચન, તુલસીપૂજા, મુંડન કરાવવું નહિ, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, મહાબલિ હનુમાનજીનું પૂજન, હનુમાનચાલીસા પાઠ, સુંદરકાંડ, કીર્તન, ભક્તિ, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, મુંડન કરાવવું નહિ, ધજા-કળશ પતાકા ચઢાવવી, બી વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિનાયક પૂજા.
- આચમનઃ ચંદ્ર-રાહુ ચતુષ્કોણ નિષ્ફળતાનો ભય, સૂર્ય-ગુરુ યુતિ દાનપ્રિય. • ખગોળ જ્યોતિષઃ ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, સૂર્ય-ગુરુ યુતિ.
- ગ્રહગોચરઃ સૂર્ય- મિથુન, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરુ-મિથુન, શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, માર્ગી હર્ષલ-વૃષભ, માર્ગી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ■

પ્રજામત

સ્કૂલમાં રાખો યોગનો પીરિયડ

સમગ્ર દેશમાં ૨૧ જૂન યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદેશોમાં પણ ભારતીયો યોગ કરીને સ્વસ્થ રહેવાનો સંદેશ આપે છે. એવામાં આપણી સરકાર દરેક શાળામાં યોગને ફરજિયાત કરે એ મહત્ત્વનું છે. શાળામાં યોગનો પણ એક પીરિયડ રાખવામાં આવે. વિદ્યાર્થીઓને દરરોજ શાળામાં યોગ કરાવીને તંદુરસ્ત બનાવી શકાશે. એથી કહેવાય છે કે યોગ મટાડે રોગ.

આજની આધુનિક લાઇફસ્ટાઇલમાં દરેકે યોગને અપનાવવાની જરૂર છે. સાથે જ ભોજનમાં પણ સુધારો કરવાની જરૂર છે. જમ્યા બાદ તરત પાણી ના પીવું. ૩૦ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ. સાથે જ રાત્રે દૂધ, દહીં અને છાશ ન લેવી. રાત્રે તીખું, તળેલું અને મીઠાઈ ન ખાવી. પેટ ચાળીસ ટકા ખાલી રાખવું.

- ખેતસી વી. મૈઠીયા

મિસ વર્લ્ડ સ્પર્ધામાં હોબાળો

આ વર્ષે મિસ વર્લ્ડ સ્પર્ધા હૈદરાબાદમાં યોજાઈ હતી. એમાં કેટલાંક રાઉન્ડ હોય છે. શારીરિક સૌંદર્યની સાથે બુદ્ધિમતાની પણ કસોટી કરવામાં આવે છે. એ પ્રતિયોગિતા દરમિયાન મીસ ઈંગ્લેન્ડ અધવચ્ચેથી રાઉન્ડ છોડીને પાછી જતી રહી હતી. તેણે આક્ષેપ કર્યો કે તેને વેશ્યા માનવામાં આવે છે. એવામાં સવાલ એ ઊભા થાય છે કે વર્ષોથી આ સ્પર્ધા થતી આવી છે. તેણે જ્યારે એમાં આવેદન કર્યું તો તેને આ પ્રતિયોગિતા વિશે પૂરી માહિતી હોવી જોઈએ. એથી સ્પર્ધા વચ્ચેથી છોડવાનું તેણે જે કારણ આપ્યું એ યોગ્ય નથી. સાથે જ એવું લાગે છે કે ભારતની છબીને ખરડાવવાનો આ પ્રયાસ છે. કહેવાનું એટલું જ કે વ્યક્તિગત કારણોથી આયોજક કે જજને બદનામ કરવા એ યોગ્ય નથી.

- જિતેન્દ્ર શાહ

ધારાવીનું ડેવલપમેન્ટ શું કામ?

એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર એવા ધારાવીના ડેવલપમેન્ટનો પ્લાન અજાણીને આપવામાં આવ્યો છે.

ધારાવીમાં અંદાજે ૧૨ લાખ લોકો રહે છે, જેમાં ૨૦ હજારી નાની-મોટી ફેક્ટરીઓ છે. જેનાથી ૧૦ લાખ માણસો આજીવિકા રળે છે. એનાથી દર વર્ષે ૧ બિલિયન ડૉલરનું યોગદાન ભારતીય અર્થતંત્રમાં આપવામાં આવે છે.

ચામડાની ચીજ-વસ્તુઓ, માટલા બનાવવા જેવા કામમાં કુશળ છે. આ વિસ્તારમાં બનાવવામાં આવેલા માલની નિકાસ કરવામાં આવે છે. અહીં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નોંધાઈ નથી. હિંસા ફેલાઈ નથી. એવામાં અહીંથી લોકોને ખસેડીને શું વિકાસ કરવામાં આવશે? ભૂતકાળના અનુભવો મુજબ એસઆરએમાં ફાળવવામાં આવેલા મકાનોને લોકોએ વેચી દીધા છે અને પાછા અન્ય વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે.

ધારાવીના લોકો આમ જુઓ તો બધી રીતે સુખી છે. એથી અહીં જ મૂળભૂત સુવિધા જેવી કે લાઈટ અને પાણીની વ્યવસ્થા કરી આપવી જોઈએ.

- મહેશ વેદાંત (વાપી)

પત્ર મિત્રોને ખાસ સૂચના પ્રજામત માટે પત્ર મોકલનારા વાચક મિત્રોને ખાસ વિનંતી કે તમારી લાગણીને વાચા આપતા કે કોઇ સમસ્યા અંગે ધ્યાન દોરતાં તમારા મંતવ્યો, લેખિત પત્રો દ્વારા અથવા અમારા નીચેના ઈ-મેઈલ આઈડી પર પણ મોકલી શકો છો.
E-mail: prajamat@bombaysamachar.com ચર્ચાપત્રના અંતે નામ સાથે પૂરું એડ્રેસ, ટેલિફોન અને મોબાઈલ નંબર તથા ઈ-મેલ આઈડી અચૂક લખવો. એડ્રેસ, ટેલિફોન અથવા મોબાઈલ નંબર નહીં લખ્યો હોય એવાં ચર્ચાપત્રોનો સ્વીકાર કરવામાં આવશે નહીં. - તંત્રી

મિઝોરમ અને ગોવા પછી, ત્રિપુરા દેશનું ત્રીજું સંપૂર્ણ અક્ષરજ્ઞાન ધરાવતું રાજ્ય બન્યું

અગરતલાઃ ત્રિપુરા સોમવારે સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું, જે મિઝોરમ અને ગોવા પછી આ સીમાચિહ્ન હાંસલ કરનાર દેશનું ત્રીજું રાજ્ય છે.

મુખ્ય પ્રધાન માણિક સાહાની હાજરીમાં રવિન્દ્ર ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બોલતા, સાહાએ આ સિદ્ધિને ત્રિપુરા માટે ઐતિહાસિક અને ગર્વની ક્ષણ ગણાવી હતી.

''મિઝોરમ અને ગોવા પછી, ત્રિપુરા હવે ભારત સંઘમાં ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય છે. આ મિશનમાં યોગદાન આપનારા તમામ લોકોને હું અભિનંદન આપું છું,'' એમ તેમણે ઉમેર્યું હતું. ૨૦૪૭ સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સાક્ષરતા એક મુખ્ય પરિબળ છે તે વાત ભારપૂર્વક જણાવતા, સાહાએ કહ્યું કે નિરક્ષરતાથી મુક્તિ મેળવનારા વ્યક્તિઓએ દેશના હિત માટે તેમની કુશળતાને અપગ્રેડ કરવા માટે ''વાંચન અને લેખન'' ચાલુ રાખવું જોઈએ.

શિક્ષણ મંત્રાલયના પુખ્ત સાક્ષરતા વિભાગના નિયામક, પ્રીતિ મીણાએ રાજ્યના મજબૂત પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ''ત્રિપુરા આજે સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું. કેન્દ્રએ ૨૦૩૦ સુધીમાં ભારતને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ત્રિપુરામાં, અમે ૨૩,૧૮૪ નિરક્ષર પુખ્ત વયના લોકોની ઓળખ કરી હતી અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે તેમને સહાય પૂરી પાડી.''

એમણે રાજ્ય સરકારને ધ્યાન કેન્દ્રિત કરવા માટે આહ્વાન કર્યું હતું. જેઓ સંપૂર્ણ સાક્ષર બન્યા છે તેમને વાંચવા અને લખવા માટે પ્રોત્સાહિત કરીને અને કૌશલ્ય વિકાસ અને ડિજિટલ શિક્ષણ માટે પણ પ્રોત્સાહન આપીને સતત શિક્ષણ પર ભાર મૂક્યો હતો.

ત્રિપુરાના શિક્ષણ વિભાગના વિશેષ સચિવ રાવલ એચ. કુમારે કેન્દ્ર સરકારનો તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો, ખાસ કરીને લોજિસ્ટિક્સ અને ભંડોળના સંદર્ભમાં, જેણે રાજ્યને આ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. ■

આરએસએસનું આગામી માસમાં દિલ્હીમાં ત્રણ દિવસીય પ્રાંત પ્રચારક બેઠકનું આયોજન

નવી દિલ્હીઃ દેશના ૪૬ પ્રાંતોના વરિષ્ઠ આરએસએસ પ્રચારકો આવતા મહિને દિલ્હીમાં તેના કાર્યાલયમાં ત્રણ દિવસીય વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે એકઠા થશે. આ બેઠકમાં દેશના વિવિધ ભાગોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સંગઠનની તાલીમ શિબિરોના પરિણામોનું રિપોર્ટિંગ અને સમીક્ષા કરવામાં આવશે.

આ બેઠકમાં આરએસએસના વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે પણ હાજરી આપશે. જેમાં આ વર્ષે વિજયાદશમીથી શરૂ થતા તેના શતાબ્દી વર્ષની ઉજવણી માટે આયોજિત વર્ષભરના કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવશે. સંગઠનના રાષ્ટ્રીય પ્રચાર અને મીડિયા વિભાગના વડા સુનીલ આંબેકરે એક નિવેદનમાં જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની વાર્ષિક રાષ્ટ્રીય કક્ષાની પ્રાંત પ્રચારક(પ્રાંત પ્રભારી પ્રચારક) બેઠક ૪ થી ૬ જુલાઇ સુધી દિલ્હીમાં આરએસએસ કાર્યાલય કેશવ કુંજ ખાતે યોજાશે.

આંબેકરે જણાવ્યું કે આ બેઠકમાં તમામ પ્રાંત પ્રચારક, સહ પ્રાંત પ્રચારકો, ક્ષેત્ર પ્રચારકો અને સહ ક્ષેત્ર પ્રચારકો હાજરી આપશે. આ બેઠકમાં આરએસએસ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનોના રાષ્ટ્રીય સંગઠન સચિવો પણ હાજર રહેશે. તેમણે કહ્યું કે આ બેઠકમાં મુખ્યત્વે સરસંઘચાલક ડો. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે, બધા સહ સરકાર્યવાહ(સંયુક્ત મહાસચિવો), જેમાં ડૉ. કૃષ્ણગોપાલ, સીઆર મુકુંદ, અરુણ કુમાર, રામદત્ત, અતુલ લિમયે અને અલોક કુમાર, તમામ રાષ્ટ્રીય કક્ષાના કાર્યકારી વિભાગના વડાઓ (એક્ઝિક્યુટિવ ઇન્ચાર્જ) અને અન્ય કારોબારી પરિષદના સભ્યો હાજરી આપશે. આંબેકરે વધુમાં જણાવ્યું કે આગામી બેઠકના એજન્ડામાં મુખ્યત્વે તાજેતરમાં પૂર્ણ થયેલી આરએસએસ તાલીમ શિબિરોનો અહેવાલ અને સમીક્ષા, આગામી વર્ષભરના આરએસએસ શતાબ્દી વર્ષના કાર્યક્રમોના અમલીકરણની વિગતો, વર્ષ ૨૦૨૫-૨૬ માટે આરએસએસ વડાની યાત્રા યોજના અને અન્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ■

કોલકાતામાં બૉમ્બ વિસ્ફોટઃ ૧૩ વર્ષની તરુણીનું મોત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કાલિગંજ વિસ્તારમાં સોમવારે બપોરે થયેલા બૉમ્બ વિસ્ફોટમાં ૧૩ વર્ષની એક તરુણીનું મોત થયું હતું. મૃત્યુ પામેલી તરુણીને તમન્ના ખાતુન તરીકે ઓળખી કાઢવામાં આવી હતી અને મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હોવાનું પોલીસે કહ્યું હતું. બૉમ્બ વિસ્ફોટનું કારણ બે સ્થાનિક જૂથ વચ્ચેની દુશ્મનાવટ હોવાનું જાણવા મળ્યું હતું. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો. કાલિગંજ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ આ ઘટના બની હતી.

ઘટનામાં કથિત સંડોવણી ધરાવવાને મામલે અખ્તર શેખ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. (એજન્સી) ■

સપાના ત્રણ ધારાસભ્યની હકાલપટ્ટી

લખનઊઃ સમાજવાદી પાર્ટીએ સોમવારે તેના ત્રણ ધારાસભ્યોની પક્ષનાં મૂળ મૂલ્યોથી વિપરીત વિચારધારાઓને સમર્થન આપવા અને જાહેર હિત વિરુદ્ધ કામ કરવાના આરોપસર પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. સપાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે પાર્ટીએ હાંકી કાઢેલા લોકોમાં અભય સિંહ(ગોસાઇગંજના ધારાસભ્ય), રાકેશ પ્રતાપ સિંહ(ગૌરીગંજ) અને મનોજ કુમાર પાંડે(ઉંચાહાર)નો સમાવેશ થાય છે. પાર્ટીએ જણાવ્યું કે ધારાસભ્યોને 'સાંપ્રદાયિક, વિભાજનકારી અને નકારાત્મક વિચારધારાઓ'ને સમર્થન આપવા બદલ હાંકી કાઢવામાં આવ્યા હતા. ■

પહેલા પાનાનું ચાલુ

ઈરાનનો

આ હુમલામાં અણુમથકને વધુ કેટલું નુકસાન થયું એ અંગે કોઈ જાણકારી મળી શકી નહોતી.

જોકે વિયેનાસ્થિત યુનાઈટેડ નેશન્સ ન્યૂક્લિઅર વૉચડૉગના વડાએ કહ્યું હતું કે રવિવારે અમેરિકાએ બન્કર બસ્ટર બૉમ્બથી કરેલા હુમલા બાદ સોમવારે ફરી કરવામાં આવેલા હુમલામાં ફૉર્ડો અણુમથકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે.

વિસ્ફોટકોનો જથ્થો અને વિસ્ફોટની તીવ્રતાને ધ્યાન પર લેતાં ફોર્ડો અણુમથકને અતિભારે નુકસાન થયું હોવાની ધારણા છે, એમ ઈન્ટરનેશનલ ઍટોમિક ઍનર્જી એજન્સીના વડા રફાલ ગ્રોસીએ કહ્યું હતું.

ફોર્ડો અણુમથકને કેટલું નુકસાન થયું છે એ અંગે હાલને તબક્કે આઈએઈએ સહિત કોઈ જાણકારી આપી શકે એમ ન હોવાનું તેમણે કહ્યું હતું.

ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ સીધું ઝંપલાવ્યા બાદ પરિસ્થિતિ અતિગંભીર વળાંક લે તેમ જ યુદ્ધ વધુ વ્યાપક અને વિનાશકારી બને તેવી પૂરી શક્યતા છે.

ઈરાનના ત્રણ અણુ સમૃદ્ધિકરણ પ્લાન્ટનો નાશ કરવા અમેરિકાએ ૩૦,૦૦૦ પાઉન્ડના બન્કર બસ્ટર બૉમ્બનો ઉપયોગ કર્યો હતો.

ઈરાને સોમવારે ઈઝરાયલના ઉત્તર અને મધ્ય વિસ્તારને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા.

ઈરાને આ હુમલાને 'ઑપરેશન ટ્રૂ પ્રોમિસ ૩' લેખાવ્યા હતા અને કહ્યું હતું કે અમે ઈઝરાયલના હાઈફા અને તેલઅવીવ શહેરને નિશાન બનાવી રહ્યા છીએ. જેરુસલેમમાં પણ વિસ્ફોટો સાંભળવા મળ્યા હતા. જોકે, જાનમાલની હાનિ થઈ હોવાની કોઈ જાણકારી મળી શકી નહોતી.

ઈઝરાયલે સોમવારે કહ્યું હતું કે ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાનો સામનો કરવા અમારી ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે સજ્જ છે.

ઈઝરાયલે સોમવારે ઈરાનની રાજધાની તહેરાન અને તેની આસપાસના વિસ્તારને નિશાન બનાવીને હુમલા કર્યા હતા.

હૉર્મઝની સામુદ્રધુની બંધ કરવાનું ઈરાનનું પગલું અતિજોખમી પુરવાર થશે અને તે કોઈના પણ માટે સારું નહીં હોય.

રવિવારે અમેરિકાએ ઈરાનના અણુ સંસ્થાનોને નિશાન બનાવી કરેલા હુમલાને પગલે હવે ઈરાન વેપાર માટે ચાવીરૂપ ગણાતી હૉર્મઝની સામુદ્રધુની બંધ કરવાનું પગલું લે તેવી પૂરી શક્યતા છે. (એજન્સી) ■

ગુજરાતના

૪૫.૦૧ ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહશક્તિના ૫૦.૧૫ ટકા પાણી સંગ્રહાયેલું છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં ૧૮ હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં ૧૬ હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં ૧૩ હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં ૧૩ હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

વધુમાં સૌરાષ્ટ્રનાં ૧૪૧ જળાશયોમાં સૌથી વધુ ૪૮.૧૫ ટકા જળ સંગ્રહ, મધ્ય ગુજરાતનાં ૧૭ જળાશયોમાં ૪૩.૮૦ ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતનાં ૧૩ જળાશયોમાં ૪૨.૦૩ ટકા, ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયોમાં ૩૩.૧૦ ટકા તેમજ કચ્છનાં ૨૦ જળાશયોમાં ૨૮.૭૨ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યનાં પચીસ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૬૧ જળાશયો પચીસ થી ૫૦ ટકા વચ્ચે જ્યારે ૮૨ જળાશયો પચીસ ટકાથી ઓછાં ભરાયાં છે. ગત વર્ષ કરતા હાલની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જળ સંગ્રહ થયો છે. ■

વિધાનસભા પેટાચૂંટણી

પટેલને વિસાવદર બેઠક પર ૧૭,૫૫૪ મતથી પરાજય આપ્યો હતો. રાજ્યમાં લગભગ સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતો હોવા છતાં ભાજપ વર્ષ ૨૦૦૭થી વિસાવદર બેઠક પર વિજય નથી મેળવી શક્યો. વર્ષ ૨૦૨૩માં 'આપ'ના વિધાનસભ્ય ભુપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને શાસક ભાજપમાં જોડાયા ત્યારથી આ બેઠક ખાલી પડી હતી. પંજાબમાં 'આપ' લુધિયાણા વેસ્ટ બેઠક પણ જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. 'આપ'ના ઉમેદવાર સંજીવ અરોરાએ તેમના નિકટના પ્રતિસ્પર્ધી કૉંગ્રેસના ઉમેદવાર ભારતભૂષણ આશુને ૧૦,૬૩૭ મતથી પરાજય આપ્યો હતો. અરોરાને ૩૫,૧૭૯ તો આશુને ૨૪,૫૪૨ મત મળ્યા હતા. જાન્યુઆરી મહિનામાં 'આપ'ના વિધાસભ્ય ગુરુપ્રીત બસ્સી ગોગીના નિધન બાદ આ બેઠક પર ચૂંટણી યોજવી જરૂરી બની ગઈ હતી. મતદાતાઓનો આભાર માનતા 'આપ'ના વડા અરવિંદ કેજરીવાલે પેટાચૂંટણીના પરિણામને વર્ષ ૨૦૨૭ની ચૂંટણીની સેમિફાઈનલ લેખાવ્યા હતા. વર્ષ ૨૦૨૭માં ગુજરાત અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું હતું કે પેટાચૂંટણીના પરિણામ સ્પષ્ટ સંકેત આપે છે કે રાજ્યના લોકો સરકારના કામથી ખૂબ જ ખુશ છે. ગુજરાતના મહેસાણા જિલ્લાની કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને ૩૯,૪૫૨ મતથી પરાજય આપ્યો હતો. ભાજપના વિધાનસભ્ય કરસન સોલંકીના નિધનને પગલે ફેબ્રુઆરીમાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. પશ્ચિમ બંગાળમાં ટીએમસીનાં ઉમેદવાર અલિફા અહમદે કાલિગંજ વિધાનસભા બેઠક પર પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર આશિષ ઘોષ સામે ૫૦,૦૪૯ મતથી વિજય મેળવ્યો હતો. (એજન્સી) ■

પેટાચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જો કે આ બંને બેઠકની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. કારમા પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારતા શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખપદેથી આપી દીધું હતું. હવે જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ના થાય ત્યાં સુધી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પ્રમુખપદની જવાબદારી સંભાળશે. કૉંગ્રેસની હારની અંગે શક્તિસિંહે જણાવ્યું હતું કે, ૩૦ વર્ષથી સત્તા ના હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. પરિણામો નથી આવ્યા એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.

શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે કહ્યું હતું કે, જિલ્લા કક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી. એઆઈસીસીએ તમામ સારા ઉમેદવારને સાંભળ્યા છે. જે બાદ જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હતી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યા છે. પક્ષ કે પરિવારમાં નિર્ણયો સમયે અમુક લોકોને સમસ્યા હોય શકે છે. ત્રણ મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જે બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે. પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા પ્રમુખો નહીં પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે. ભાવનગરમાં પણ જે નામ આવ્યા તે પણ કાર્યકરોની સર્વસંમતિથી આવ્યા હતા. તેમના રાજીનામા અંગે શક્તિસિંહે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, હું નહોતો ઇચ્છતો કે રાજીનામું આપું અને મને મનાવવામાં આવે. મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કૉંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કૉંગ્રેસનો સિપાહી તરીકે હંમેશાં કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડા ધોરણો સાથે રાજનીતિ કરી નથી. બેમાંથી એક સીટ પણ મળી હોત તો પણ સારું લાગત.

રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલા જૂન ૨૦૨૩માં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ગુજરાત પેટાચૂંટણીનાં પરિણામ જાહેરઃ વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યુંઃ કડીમાં ભગવો લહેરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાતની બે વિધાનસભા બેઠક વિસાવદર અને કડી માટે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયા હતા. ગુરુવારે (૧૯ જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જ્યારે કડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો.

વિસાવદરમાં સતત આગળ ચાલી રહેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો હતો. ૨૧ રાઉન્ડની મતગણતરીના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ૧૭,૫૫૪ મતથી ભવ્ય જીત મેળવી હતી. આપને કુલ ૭૫૯૪૨ વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને ૫૮,૩૮૮ અને કૉંગ્રેસને ૫૫૦૧ મળ્યા હતા. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ૩૯,૪૫૨ મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો હતો. ભાજપને ૯૯,૭૪૨ વોટ મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસને ૬૦,૨૯૦ અને આપને ૩,૦૯૦ વોટ મળ્યા હતા. કડીમાં ભાજપની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્યાપી જવા પામી હતી.

વિસાવદરની પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન અને બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો દીકરીઓના કુમળા હાથે લીધેલાં દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.

કડી અને વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાના પક્ષને નોટાથી પણ ઓછા મત મળ્યા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર પેટા ચૂંટણીનાં સોમવારે પરિણામો જાહેર થયાં હતાં. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો હતો. તેમણે કૉંગ્રેસના રમેશ ચાવડાને ૩૯,૪૫૨ મતથી હાર આપી હતી. કડી સીટ પર ભાજપના ઉમેદવાદ રાજેન્દ્રકુમાર ચાવડાને ૯૯,૭૪૨ મત, કૉંગ્રેસના રમેશભાઈ ચાવડાને ૬૦,૨૯૦ મત મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાને ૩૦૯૦ મત મળ્યા હતા. કડી બેઠક પર શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ચોથા ક્રમે રહી હતી. અહીં તેમના ઉમેદવાર ડૉ. ગિરિશભાઈ કાપડીયાને માત્ર ૧૩૩૫ મત મળ્યા હતા. જ્યારે નોટાને પણ શંકરસિંહની પાર્ટી કરતાં વધારે મત મળ્યા હતા. કડીમાં ૧૭૦૧ ઉમેદવારોએ નોટાનું બટન દબાવ્યું હતું.

વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી રાખી હતી. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને ૧૭૫૫૪ મતથી હરાવ્યા હતા. આપના ગોપાલ ઈટાલિયાને ૭૫૯૪૨ મત મળ્યા હતા, જ્યારે ભાજપના કિરીટ પટેલને ૫૮૨૮૮ મત મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેતા કૉંગ્રેસના નીતિન રાણપરીયાને ૫૫૦૧ મત મળ્યા હતા. વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવાર આઠમા ક્રમે રહ્યા હતા. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કિશોરભાઈ કાનકડને ૪૭૯ મત મળ્યા હતા. જ્યારે નોટાને પણ અહીં તેનાથી વધારે મત મળ્યા હતા. વિસાવદરમાં ૧૭૧૬ લોકોએ નોટાને મત આપ્યો હતો. આમ બંને બેઠક પર નોટાને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીથી વધારે મત મળ્યા હતા.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો ત્રીજો અહેવાલ સોંપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો ત્રીજો અહેવાલ સોંપવામાં આવ્યો હતો. જીએઆરસી રચના માટે આ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતના ગણતરીના દિવસોમાં જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી હતી. આ પંચે અત્યારસુધીમાં અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના માર્ગદર્શનમાં જીએઆરસીના બે ભલામણ અહેવાલો રાજ્ય સરકારને સુપ્રત કર્યા છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરાયેલા પંચના ત્રીજા અહેવાલમાં મુખ્ય પ્રધાનના નાનામાં નાના માનવીને કેન્દ્ર સ્થાને રાખીને તેને સરકારી સેવાઓનો લાભ સરળતાએ મળી રહે તે માટે સિટિઝન ફર્સ્ટનો જે અભિગમ અપનાવ્યો છે તે ભલિભાંતિ પ્રતિબિંબિત થાય છે. ડૉ.હસમુખ અઢિયાના સતત માર્ગદર્શનથી તૈયાર થયેલા ત્રીજા અહેવાલમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી નાગરિકો માટે વધુ પારદર્શક, ઝડપી અને સિટીઝન સેંટ્રિક શાસન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.

શિષ્યવૃત્તિ યોજનાઓનું એકત્રીકરણ કરીને એક પ્લેટફોર્મ પર શિષ્યવૃત્તિઓનુ વિતરણ અને સરકારી બસોમાં ક્યૂઆર કોડ અને યુપીઆઈના માધ્યમથી ટિકિટ બુકિંગ તથા સરકારી બસોનું રિયલ ટાઇમ બેઝિસ પર ટ્રેકિંગ જેવા સુધારા ઉપરાંત ડિજિલોકર આધારિત દસ્તાવેજ સેવાઓ, એસએમએસ/વોટ્સએપ દ્વારા સરકારી અરજીની સ્થિતિની જાણકારી જેવી ભલામણો નાગરિકો માટે સરળતા, સમયની બચત અને સરકારી સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ સુદૃઢ કરશે. પેન્શનની આપમેળે ચુકવણી, ડિજિટલ સર્વિસ બુક અને કર્મચારી સંતોષ સર્વે જેવા પગલાંઓથી સરકારી તંત્રની કાર્યક્ષમતા પણ વધશે.

આ ભલામણો ગુજરાતને એક પ્રગતિશીલ, ડિજિટલી સશક્ત રાજ્ય બનાવવાની દિશામાં મજબૂત પગલું બની રહેશે.

દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ અહેવાલ સુપ્રત કરતા જીએઆરસીના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ જણાવ્યું કે, ''સશક્ત નાગરિકો માટે ટેકનોલોજીયુક્ત શાસન'' તેમ જ ગુજરાતના વિકાસમાં જનતા માત્ર સહભાગી નહીં, સહયાત્રી બનશે'' ના ધ્યેય પરની ભલામણો સાથે આ ત્રીજો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી માટે આજે મતગણતરીઃ અમદાવાદ જિલ્લામાં તૈયારીઓ પૂર્ણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ પછી આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી યોજવામાં આવશે. આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લામાં મતગણતરી માટેની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે એટલે ૨૪મી જૂનના આ મતગણતરી યોજાનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી આયોજન પૂર્ણ કર્યું છે.

મતગણતરી અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બાવળા તાલુકામાં ચાર ગ્રામ પંચાયત, દસકોઈ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયત, ધોલેરા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયત, ધંધુકા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયત, વિરમગામ તાલુકામાં ૯ ગ્રામ પંચાયત, માંડલ તાલુકામાં ૪ ગ્રામ પંચાયત, ધોળકા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયત, દેત્રોજ-રામપુરા તાલુકામાં સૌથી વધુ ૧૨ ગ્રામ પંચાયત, અને સાણંદ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. તાલુકાદીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ ૯ મતગણતરી સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

આ તમામ મતગણતરી સ્થળોએ કુલ ૨૮ મતગણતરી હોલ અને ૪૨ મતગણતરી ટેબલોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતગણતરીની આ જટિલ અને મહત્ત્વપૂર્ણ કામગીરી સુપેરે પાર પડે તે માટે ૨૨૯ મતગણતરી સ્ટાફને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૨૯૭ પોલીસ સ્ટાફ પણ કાર્યરત રહેશે, જે સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરશે.

ગુજરાત સહિત ૧૧ રાજ્યમાં બૉમ્બની ધમકી આપનારી 'ટેકનોક્રેટ' યુવતીને પોલીસે ઝડપી

(અમારા પ્રતિનિધિ તરફથી)

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાત સહિત દેશનાં ૧૧ રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ચેન્નઈમાંથી ધરપકડ થઈ હતી. અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી એક યુવતીની ચેન્નઈમાંથી ધરપકડ કરી હતી. જેની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની તપાસ માધ્યમથી આરોપી રેની જોસિલ્ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેની રોબોટિક્સમાં ક્વોલિફાઇડ છે અને ૨૦૨૨થી ડેલોયટ ચેન્નઈમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. એક તરફી પ્રેમમાં રેનીએ દેશભરમાં ખોટી બોમ્બ ધમકીઓનું જાળ બિછાવી હતી. જોસિલ્ડાએ પોતાની ઓળખ અને સ્થાન છુપાવવા માટે મલ્ટીપલ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ (વીપીએન), નકલી ઇમેઇલ આઈડી અને ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો. તેણે કથિત રીતે સરખેજમાં જિનિવા લિબરલ સ્કૂલ, બોપલમાં દિવ્ય જ્યોત સ્કૂલ, અસારવામાં બીજે મેડિકલ કોલેજ અને મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અગ્રણી સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતા અનામી એકાઉન્ટ્સમાંથી ૨૧ થી વધુ ઇ-મેઇલ મોકલ્યા હતા.

આ ઈમેઈલની તપાસ દરમિયાન સાયબર સેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને કોમ્યુનિકેશન પેટર્નનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં જોસિલ્ડાની ઈન્ટરનેટ એક્ટિવિટી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાતા નકલી એકાઉન્ટ્સની ઓળખ થતાં મહત્ત્વની કડી મળી હતી. ૩ જૂન, ૨૦૨૫ના રોજ તેણે સવારે ૧૦.૫૮ વાગ્યે જિનિવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ કર્યો હતો. તેણે ફેક ઈમેઈલ આઈડી પરથી મેઈલ કર્યો હતો કે, પોલીસ ઊંઘી રહી છે. તે કંઈ જ કરી રહી નથી. તેણે કેવી રીતે તપાસ કરવી જોઈએ તેની પણ જાણ નથી. જો બાળકો મરશે તો જ પોલીસ સક્રિય બનશે. આ સમગ્ર મામલે જેસીપી ક્રાઈમ બ્રાન્ચ શરદ સિંઘલે જણાવ્યું હતું કે મૂળ તમિલનાડુની એન્જિનિયર યુવતી રેનીને દિવિજ પ્રભાકર નામના વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ યુવક તેની સાથે લગ્ન કરવા માગતો ન હતો. ફેબ્રુઆરી ૨૦૨૫માં દિવિજે બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. જેથી તેણે પ્રેમમાં પાગલ બની દિવિજના નામે અનેક નકલી ઈમેલ આઈડી બનાવી અને ધમકીભર્યા મેઈલ મોકલ્યા હતા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૭૫નાં મોતની ઍર ઈન્ડિયાએ કબૂલાત કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૧૨ જૂનના રોજ બપોરે એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર ૨૪૨ લોકો પૈકી ૨૪૧નાં મૃત્યુ થયાં હતાં. જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.

એર ઇન્ડિયાના સીઈઓ દ્વારા આ દુર્ઘટનામાં ૨૭૫ લોકોનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાંથી ૨૪૧ ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો છે, જ્યારે ૩૪ ગ્રાઉન્ડ પરના અન્ય લોકો છે.

એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને એર ઈન્ડિયા મહારાજા ક્લબના સભ્યોને ઇ-મેઇલ કર્યો હતો, જેમાં પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે લોકોને જાણ કરી હતી. આ ઇમેલમાં તેમણે કબૂલાત કરી છે કે, પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પ્લેનમાં બેઠેલા ૨૪૧ લોકો અને ઓન ગ્રાઉન્ડ એટલે કે સ્થળ પરના ૩૪ લોકોનાં મોત થયાં છે. આ ઘટનામાં કુલ ૨૭૫ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં હજુ પણ ડીએનએ મેચ કરીને પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. હજુ પણ કેટલાક ઇજાગ્રસ્ત દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. તમામના મૃતદેહ આપ્યા બાદ તથા તમામની સારવાર પૂર્ણ થયા બાદ સ્પષ્ટ મૃત્યુઆંક જાણી શકાશે. હજુ આ આંકડો વધે તેવી પણ શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગરમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રવિવાર સુધીમાં ૨૫૧ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૫ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે ૬ પરિવાર નજીકના સમયમાં સ્વજનોના મૃતદેહ સ્વીકારશે એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું.

વડોદરા ઍરપોર્ટ પર ફ્લાઇટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદઃ વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ૫૧ વર્ષીય આધેડે એરપોર્ટ પર ચેકિંગમાં કહ્યું હતું કે, મારી પાસે બોમ્બ છે. મુસાફરની આ ધમકીથી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. વડોદરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવાનો હતો તે મુસાફરને અટકાયતમાં લઈ પોલીસ પૂછપરછ હાથ ધરી છે.

વડોદરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સહિત તપાસ એજન્સીઓ કામે લાગી હતી. મળતી માહિતી મુજબ, વડોદરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ૫૧ વર્ષીય આધેડે એરપોર્ટ પર ચેકિંગમાં કહ્યું હતુ કે, મારી પાસે બોમ્બ છે. આ વાત સાંભળતા જ પોલીસ સહિત તપાસ એજન્સીઓએ લોકોને એલર્ટ કર્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ મુસાફરની ધમકીથી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ શખ્સ પાસે બોમ્બ હોવાની વાતથી ચેકિંગ કરવાની સાથે અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મુસાફર વડોદરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવાનો હતો. જોકે પોલીસે મુસાફરને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. પોલીસ સહિતની તપાસ એજન્સીઓનું વડોદરા એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરા એરપોર્ટ પર ફ્લાઈટમાં એક કલાક સુધી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને આખરે ચેકિંગનાં અંતે ફ્લાઇટ તેમજ એરપોર્ટ પરથી કઇ ન મળ્યું. બોમ્બની ધમકી આપનાર શખ્સ માનસિક અસ્વસ્થ નિકળ્યો હતો. વડોદરાનાં રહીશ મુસાફરને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઇ જવાયો હતો.

સાબરકાંઠાના પ્રાંતિજમાં ગમખ્વાર અકસ્માત, બેનાં મોત, આઠ ઘાયલ; મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે સોમવારે વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા હતા જ્યારે ૮ થી વધુને ઈજાઓ થઈ હતી. ઘાયલોની હાલત ગંભીર હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસ, ૧૦૮, ફાયર, હાઈવે ટ્રાફિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બસ મુંબઈના બોરીવલીથી રાજસ્થાનના ઉદેપુર જતી હતી, આ દરમિયાર પ્રાંતિજમાં બસને અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા રસ્તા પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. સોમવારે વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે ૪૮ પર કાટવાડ ઓવરબ્રિજ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી બસ ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. મુંબઈ બોરીવલીથી ખાનગી બસ મુસાફરો સાથે રાજસ્થાનના ઉદેપુર જઈ રહી હતી. દરમિયાન અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે ૪૮ પર સોમવારે વહેલી સવારે ૪ કલાકની આસપાસ કાટવાડ ઓવરબ્રિજ નજીક આગળ જઈ રહેલ ટ્રકમાં ખાનગી બસ ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી બસની ડાબી સાઈડ ચિરાઈ ગઈ હતી.

અકસ્માત સર્જાતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. અડધો કલાકની જહેમત બાદ પતરાં કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન આઠથી વધુ ઘાયલ મુસાફરોને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા.

રાજ્યમાં મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અટકીઃ ૪૧ મેડિકલ કોલેજોને માન્યતા મળી નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં ૪૧ મેડિકલ કોલેજોને માન્યતા મળેલી ન હોવાથી મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા હાલમાં અટકી પડી છે. નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) દ્વારા કરવામાં આવેલી લાલીયાવાડીને કારણે, મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં અડચણ ઉભી થઈ છે. એનએમસીએ હજુ સુધી ગુજરાતની કોલેજોમાં ઇન્સ્પેકશન શરૂ કર્યું નથી. માત્ર મેડિકલ જ નહીં, પરંતુ ૧૩ ડેન્ટલ, ૪૪ આયુર્વેદ અને ૪૮ હોમિયોપેથી કોલેજોને પણ માન્યતા મળી નથી. હાલમાં નીટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, તેમ છતાંય પરિણામ જાહેર થયાના ૪૫ દિવસ બાદ પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. નીટના પરીણામમાં ૫૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ મેડિકલ-ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતમાં મેડીકલની ૪૧ કોલેજોમાં ૭૨૫૦, ડેન્ટલમાં ૧૨ કોલેજોમાં ૧૨૫૫, આયુર્વેદની ૪૪ કોલેજોમાં ૩૪૭૩ અને હોમીયોપેથીની ૪૮ કોલેજમાં ૪૫૬૦ મળી કુલ ૧૬૫૩૮ બેઠકો નીટ આધારિત પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એનએમસી સામે આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, એનએમસી પાસે પૂરતા સ્ટાફ કે ઇન્સ્પેક્ટરો ઉપલબ્ધ નથી. આ સાથે જ એજન્ટો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપિંડી કરી રહ્યાં હોવાના પણ દાવા કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે એનએમસી તાત્કાલિક કોલેજની માન્યતાની પ્રક્રિયા પૂર્ણ કરે તેવી માગ કરી હતી.

વડોદરાની નવરચના સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ, પોલીસ તંત્ર દોડતું થયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાતમાં બોમ્બની ધમકીના અનેક મેઈલ છેલ્લા ઘણાં સમયથી મળી રહ્યાં છે. જેના કારણે લોકો ખૂબ જ ભયભીત બને છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી આપતો મેઈલ ફરી એક વખત મળ્યો હતો. આ સમાચાર મળતા જ શાળામાં બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી કરવામાં આવેલી તપાસના અંતે, પોલીસને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસે ખાતરી આપી હતી કે શાળામાં કોઈ બોમ્બ મૂકવામાં આવ્યો નથી અને ચેકિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

બોમ્બની ધમકીનો મેઈલ આવતા વિદ્યાર્થીઓને શાળામાંથી છોડી મૂકવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ સ્કૂલને બોમ્બથી ઉડાવાની ધમકીનો મેઈલ મળ્યો હતો. સતત ૬ મહિનામાં બીજીવાર ધમકીભર્યો મેલ કરી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, સ્કૂલને અત્યાર સુધીમાં જેટલા બોમ્બની ધમકીના કોલ, મેસેજ કે ઈમેલ આવ્યાં છે તે ખોટા અને પોકળ હોવાનું પ્રમાણિત થયું હતું. પરંતુ આવી ધમકીને નજરઅંદાજ કરી શકાય નહીં. તેથી પોલીસ તંત્ર દ્વારા તેની પૂર્ણ તપાસ કરવામાં આવે છે.

હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વેપારીને દુકાન ખોલવા અંગે હાઈ કોર્ટે મોટો ચુકાદો આપ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વેપારીને દુકાન ખોલવા અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું, કાયદો અને વ્યવસ્થા જાળવવાની બંધારણીય જવાબદારી રાજ્ય સરકારની છે. વડોદરાના હિન્દુ બહુમતિવાળા વિસ્તારમાં એક મુસ્લિમ વેપારીને પોતાની દુકાનથી વ્યવસાય શરૂ કરવામાં આવી રહેલા અવરોધોને તાત્કાલિક દૂર કરવા કોર્ટે વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો.

ન્યાયાધીશ એચડી સુથારની સિંગલ બેન્ચ દ્વારા આપવામાં આવેલ આ નિર્ણય અરજદાર ઓનાલી ધોળકાવાલાને મોટી રાહત આપી હતી. મુસ્લિમ વેપારીઓ આ વિસ્તારમાં વ્યવસાય ન કરે તે માટે કેટલાક સ્થાનિક લોકો તેમને દુકાન ખોલતા અટકાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

ધોળકાવાલાએ ૨૦૧૬માં ચાંપાનેર ગેટ નજીક બે હિન્દુ ભાઈઓ પાસેથી કાયદેસર રીતે દુકાન ખરીદી હતી, પરંતુ આ વિસ્તાર ગુજરાત ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ, ૧૯૯૧ હેઠળ આવે છે. આ વિસ્તારમાં કોઈપણ મિલકત ખરીદવા માટે કલેક્ટરની પૂર્વ પરવાનગી મેળવવી ફરજિયાત છે. તેમણે ૨૦૨૦માં હાઇ કોર્ટની મદદથી વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યો હતો. આમ છતાં, વિસ્તારના કેટલાક લોકોએ મુસ્લિમને મિલકતના વેચાણનો વિરોધ કર્યો અને તેને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી. તેમણે દાવો કર્યો હતો કે મુસ્લિમોને મિલકત આપવાથી વિસ્તારમાં વસ્તી સંતુલન ખલેલ પહોંચશે અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ શકે છે.

જોકે, ફેબ્રુઆરી ૨૦૨૩માં, હાઇ કોર્ટે આ વાંધાઓને ફગાવી દીધા અને બંને અરજદારો પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે, તેઓ કાયદેસર માલિકને મિલકતના અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પછી પણ સ્થાનિક રહીશોએ ધોળકાવાલાને દુકાન ખોલવા દીધી ન હતી અને ગેટ પર કાટમાળ ફેંકીને દુકાનમાં અવરોધ ઉભો કર્યો હતો. આના પર ધોળકાવાલાને ફરી એકવાર હાઈ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમણે દુકાન ખોલીને વ્યવસાય શરૂ કરી શકે તે માટે પોલીસ સુરક્ષાની માગણી કરી હતી.

LIKE & FOLLOW: /Mumbaisamachar4u

સંસ્થા સમાચાર

પૂ. શ્રી. ધીરગુરુદેવનું આગામી ચાતુર્માસ એમ્બીવેલી સિટીમાં ઘોષિત કરાતા જયનાદ

ગોંડલ સંપ્રદાયના શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી. ધીરગુરુદેવના કરકમલોમાં છેલ્લાં ૧૦ વર્ષથી પ્રભુદાસ લીલાધર કેપિટલ ગ્રૂપના ડાયરેક્ટર અમીશા નીરજ વોરા પરિવારની આગ્રહ ભરી વિનંતીનો સ્વીકાર કરી લોનાવાલા નજીક એમ્બીવલી સહારા સિટીમાં પ્રથમવાર જૈનસંતોમાં પૂ. ધીરગુરુદેવનાં ચાતુર્માસની સ્વીકૃતિ મળતા સર્વશ્રી મુકેશ કામદાર, ઉર્વિશ વોરા, અભય શાહ, સમીર શાહ, મીતા શેઠ, શિલ્પા કે. ડી. કરસુર, સિદ્ધાર્થ વોરા વગેરેએ અનુમોદના કરી ઉત્સાહ વધાર્યો હતો.

અમીશા વોરાએ ગુરુદેવની અસીમ કૃપાનો સ્વીકાર કરી ધન્યતા અનુભવી હતી.

સુપર સે ઉપર-વ્યાખ્યાન સંગ્રહ પુસ્તક ઓપન બુક એક્ઝામના પેપર સહિત રવિવારથી વાલકેશ્વર, વિલેપાર્લે, ઘાટકોપર ઉપાશ્રયેથી અલ્પ મૂલ્યમાં મળશે.

રાજકોટમાં સરદારનગરમાં તા. ૨૩ના પૂ. વનિતબાઇ મ. સ. નો ચાતુર્માસ પ્રવેશ સવારે ૭.૦૦ કલાકે રાખેલ છે. પૂ. મીનાજી મ.સ.નો આરાધના ભવન અને પૂ. વિમલાજી મ.સ.નો ઇન્દોરમાં ચાતુર્માસ પ્રવેશ યોજાશે.

પાંચ દિવસીય યોગ શિબિર

કેવલ બાગ સેન્ટર છેલ્લાં ૩૯ વર્ષથી યોગાભ્યાસ કેન્દ્ર ચલાવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ દિવસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. સોમવાર ૨૩ જૂનથી માંડીને શુક્રવાર ૨૭ જૂન સુધી સવારે ૭ કલાકે ઓનલાઈન અને ઓફલાઇન યોગ કરાવવામાં આવશે. એ દરમિયાન પ્રાણાયામ, આસન, પાવર યોગ અને ધ્યાન વિશે સરળ ભાષામાં લોકોને સમજાવવામાં આવશે.

યુથ ક્લબની કમિટીની શપથવિધિ સંપન્ન

રાજસ્થાનના સાંચોર વિસ્તારના મુંબઈમાં વસતા જૈન યુવકોએ ૪૦ વર્ષ પહેલા યુથ ક્લબની સ્થાપના કરી હતી. એમાં નિમાયેલા નવા કારોબારી સભ્યોની પરંપરા મુજબ શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ક્લબની સ્થાપના સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે થઈ હતી.

મહેંદી હરીફાઈ

કલાગુર્જરી (સ્થાપક સંસ્થા) દ્વારા ૨૬ જુલાઈના રોજ બપોરે અઢી કલાકે મહેંદી હરીફાઈ યોજવામાં આવી છે. આ સ્પર્ધા બે વિભાગમાં રાખવામાં આવી છે. એમાં ૭થી ૧૫ વર્ષનો એક વિભાગ અને બીજા વિભાગમાં ૧૬થી ઉપરની ઉંમરના સ્પર્ધકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દશરથલાલ જોશી પુસ્તકાલય, વિલેપાર્લે (વેસ્ટ)માં આયોજિત આ સ્પર્ધાના ફોર્મ ૨૨ જુલાઈ સુધી જમા કરવાના રહેશે.

ઈન્ક આર્ટ વર્કશોપ

કલાગુર્જરી (સ્થાપક સંસ્થા) દ્વારા ૫ જુલાઈના રોજ બપોરે ૩થી ૫ કલાકે ઈન્ક આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

દશરથલાલ જોશી પુસ્તકાલય, વિલેપાર્લે (વેસ્ટ)માં આયોજિત આ કાર્યશાળામાં સાધન સામગ્રી સંસ્થા તરફથી આપવામાં આવશે. એના માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

શ્રી રોહિદાસ મહારાજનો જન્મ જયંતી મહોત્સવ

સનાતન હિન્દુ ધર્મના સંત સમ્રાટ પરમપૂજ્ય સંત શિરોમણિ શ્રી રોહિદાસ મહારાજનો જન્મ જયંતી મહોત્સવ, બંધારણ પુસ્તિકાનું અનાવરણનો કાર્યક્રમ ૨૧ જૂને સંપન્ન થયો છે.

સાથે વિદ્યાર્થી ગુણગૌરવ સમારંભનું પણ આયોજન થયું હતું.

નિઃશુલ્ક એક્યુપ્રેશર સેવા

પ્રગતિ મિત્ર મંડળ (બોરીવલી-કાંદીવલી) અને જય ભગવાન એક્યુપ્રેશરના સંયુક્ત પ્રયાસથી બીજી જૂનથી ૭ જૂન સુધી એક્યુપ્રેશર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નિઃશુલ્ક શિબિરનો લાભ ૬૫ ભાઈ-બહેનોએ લીધો હતો.

દારૂ માટે પત્નીનું ગળું દબાવી દેનારો પતિ બે કલાકમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ દારૂ પીવા રૂપિયા ન આપનારી પત્નીની ગળું દબાવીને પતિએ કથિત હત્યા કરી હોવાની ઘટના ગોરેગામમમાં બની હતી. હત્યા બાદ ફરાર થઈ ગયેલા પતિને પોલીસે બે કલાકમાં જ પકડી પાડ્યો હતો.

બાંગુર નગર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વસીમ રફીક શેખ (૨૫) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગોરેગામ પશ્ચિમમાં લિંક રોડ પરના ભગત સિંહ નગર નંબર-૨ ખાતે બની હતી. ગૌશિયા વસીમ શેખ (૨૫)ની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ગૌશિયાની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

સોમવાની સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ ગૌશિયાનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો. કહેવાય છે કે સંતાનની સામે જ આરોપી વસીમે પત્નીની હત્યા કરી હતી. પત્નીએ દારૂ પીવા માટે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં આરોપી રોષે ભરાયો હતો. હત્યા બાદ આરોપી તેના વતન ફરાર થવાની તૈયારીમાં હતો. જોકે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસની ટીમે તેને રામ મંદિર સ્ટેશનેથી પકડી પાડ્યો હતો.

વૈશ્વિક સંઘર્ષનું કારણ બની છે બેલગામ મહત્ત્વકાંક્ષાઓઃ ગડકરી

પુણેઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું કે ‘બેલગામ મહત્વાકાંક્ષાઓએ’ વૈશ્વિક સ્તરે સંઘર્ષ પેદા કર્યો છે.

અહીં એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ કહ્યું હતું કે ભારતે વિશ્વ શાંતિ અને માનવતાવાદનો સંદેશ મોકલવાની જરૂર છે.

‘આપણો સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ એટલો સમૃદ્ધ છે કે આપણો દેશ ક્યારેય સરમુખત્યારશાહી અને વિસ્તારવાદી નહોતો. જોકે, એક પ્રકારની બેલગામ મહત્વાકાંક્ષા છે જે આજે વિશ્વમાં સંઘર્ષ તરફ દોરી રહી છે, અને વિશ્વમાં વિશ્વ શાંતિ અને માનવતાવાદનો સંદેશ મોકલવાની જરૂર ઊભી થઈ છે,’ એમ તેમણે કહ્યું હતું.

એમઆઈટી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા બનાવવામાં આવેલી શ્રી સરસ્વતી કરાડ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય પ્રધાન બોલી રહ્યા હતા.

ભારતે ‘વિશ્વગુરુ’ બનવું જોઈએ તેવું ભારપૂર્વક જણાવતા, ગડકરીએ કહ્યું હતું કે, આપણા સિદ્ધાંતો મારો કે મારા પરિવારનો લાભ એટલો જ ઉપદેશ આપતા નથી પરંતુ તે જગતના કલ્યાણની વાત કરે છે. (પીટીઆઈ)

મરાઠી રાજ્યનો આત્મા, તેને હાનિ નહીં પહોંચાડે સરકારઃ એનસીપી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા ‘‘લાદવા’’ અંગેના વિવાદ વચ્ચે અજિત પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસે (એનસીપી)એ સોમવારે કહ્યું હતું કે મરાઠી ભાષા રાજ્યનો આત્મા છે અને સરકાર ક્યારેય મરાઠી ભાષાના દરજ્જાને નુકસાન પહોંચાડે તેવો નિર્ણય લેશે નહીં.

અહીં પત્રકારોને સંબોધતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા આનંદ પરાંજપેએ કહ્યું હતું કે સરકાર મરાઠી ભાષાના મહત્ત્વને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે કહ્યું કે મોદી સરકારે મરાઠીને અભિજાત ભાષા તરીકે માન્યતા આપી છે. મરાઠી એકમાત્ર ભાષા અને મહારાષ્ટ્રનો આત્મા છે. મહાયુતિ સરકાર ક્યારેય એવો કોઈ નિર્ણય લેશે નહીં જે તેની સ્થિતિને નુકસાન પહોંચાડે, એમ તેમણે કહ્યું હતું. નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારના ઘટકોમાંની એક છે.

પાંચમા પાનાનું ચાલુ

આજથી દરિયામાં પાંચ

માટે યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બુધવારના મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં મંગળવાર અને ગુરુવારે ભારે વરસાદ તો બુધવાર માટે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદની ચેતવણી વચ્ચે મંગળવાર ૨૪ જૂનથી ૨૮ જૂન સુધી પાંચ દિવસ દરિયામાં મોટી ભરતી હોવાને કારણે ભરતીના સમય દરમ્યાન જો વરસાદનું જોર રહ્યું તો મુંબઈમાં પાણી ભરાઈ શકે છે, તેથી પાલિકા પ્રશાસન એલર્ટ થઈ ગઈ છે. મંગળવાર, ૨૪ જૂનથી સળંગ ૨૮ જૂન, ૨૦૨૫ સુધી દરિયામાં મોટી ભરતી છે, જે ચોમાસાના ચાર મહિના દરમ્યાન સૌથી ભરતી છે. ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન કુલ ૧૯ વખત દરિયામાં મોટી ભરતી છે. મોટી ભરતી દરમ્યાન દરિયામાં મોજા સાડાચાર મીટર કરતા પણ વધુ ઊંચા ઉછળશે, જેમાં ચોમાસાની સૌથી મોટી ભરતી ગુરુવાર ૨૬ જૂનના બપોરના ૧૨.૫૫ વાગે રહેશે. એ સમયે દરિયામાં મોજા ૪.૭૫ મીટરથી પણ ઊંચા ઉછળશે. ભરતી દરમ્યાન નાગરિકોને પણ દરિયા કિનારે જવાથી દૂર રહેવાની ચેતવણી પાલિકા પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. મંગળવારે ૨૪ જૂનના સવારના ૧૧.૧૫ વાગે દરિયામાં ભરતી હશે એ સમયે મોજા ૪.૫૯ મીટર જેટલા ઊંચા ઉછળશે. બુધવાર ૨૫ જૂનના બપોરના ૧૨.૦૫ વાગે દરિયામાં ૪.૭૧ મીટર ઊંચા મોજા ઉછળશે. ગુરુવાર ૨૬ જૂનના બપોરના ૧૨.૫૫ વ વાગે દરિયામાં ૪.૭૫ મીટર ઊંચા મોજા ઉછળશે અને શુક્રવાર ૨૭ જૂનના બપોરના ૧.૪૦ વાગે ૪.૭૩ મીટર ઊંચા મોજા ઉછળશે અને શનિવાર ૨૮ જૂનના બપોરના ૨.૨૬ વાગે દરિયામાં ભરતી સમયે ૪.૬૪ મીટર ઊંચા મોજા ઉછળશે.

કરોડો રૂપિયાનું વીઆઇપીએસ

એફઆઇઆરના આધારે એજન્સીએ વિનોદ ખુટે, સંતોષ ખુટે, મંગેશ ખુટે, કિરણ પિતાંબર અનારસે, અજિંક્ય બદાધે અને અન્યો વિરુદ્ધ પોન્ઝી/મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમ્સ અને ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મના નામે સામાન્ય લોકો સાથે કથિત છેતરપિંડી આચરવા બદલ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. એજન્સીએ દાવો કર્યો છે કે દુબઇમાં રહેતો વિનોદ ખુટે આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે. વિનોદ ખુટેએ વીઆઇપીએસ ગ્રૂપ ઓફ કંપનીઝ, મેસર્સ ગ્લોબલ એફિલિયેટ બિઝનેસ, મેસર્સ કાના કેપિટ, રિયલ ગોલ્ડ કેપિટલ વિગેરે થતી વિવિધ ગેરકાયદે મલ્ટિલેવલ માર્કેટિંગ અને છેતરામણી યોજનાઓ, ગેરકાયદે ટ્રેડિંગ, ક્રિપ્ટો એક્સચેન્જ, વોલેટ સેવાઓને નામે ઠગાઇ કરી છે. વિવિધ યોજનાઓ થકી ભેગું કરવામાં આવેલું ભંડોળ કાગળ પર બનાવેલી કંપનીઓમાં વળવામાં આવ્યું હતું, જે બાદમાં ઉપાડી લેવાયું હતું અને ક્રિપ્ટો/વર્ચ્યુઅલ એસેટ્સમાં રૂપાંતર કરી કર્યા બાદ હવાલા ચેનલ દ્વારા દુબઇ મોકલવામાં આવતું હતું. ઇડી દ્વારા ભારત અને દુબઇમાં ખુટે, તેના સંબંધીનું વિવિધ બેન્કમાં જમા ભંડોળ, સ્થાવર મિલકતો સહિત ૭૫.૪૨ કરોડની મતા જપ્ત અથવા સ્થગિત કરવામાં આવી છે.

મરીન લાઇન્સમાં

બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલી એક ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડના છ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ ઓફિસની અંદર આવેલી હોવાથી ત્યાં રહેલા ઓફિસ ફર્નિચર સહિત દસ્તાવેજો, ઈલેક્ટ્રિક વાયરિંગ સહિતનું માલસામાન બળીને ખાક થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ દૂર દૂર સુધી તેના ધુમાડા નીકળી રહ્યા હતા. સદ્નસીબે આગ લાગ્યા બાદ ત્યાં હાજર રહેલા લોકો સહિત આજુબાજુના લોકો તરત સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. તેથી કોઈ જખમી થયું નહોતું. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાઈ આવ્યું હતું.

દાણચોરીના સોનાને

કરાયેલા સોના સંબંધી યોગ્ય દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. તેમની પૂછપરછમાં વધુ બે આરોપી રાજકુમાર પવાર અને રવીન્દ્ર સાળુંખેની ધરપકડ કરાઈ હતી. પવાર કારનાનો માલિક હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

પકડાયેલા આરોપી સોનાની દાણચોરીમાં સંડોવાયેલી ઈન્ટરનૅશનલ સિન્ડિકેટના સભ્યો હોવાની શક્યતા ડીઆરઆઈએ વ્યક્ત કરી હતી. આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા અન્ય સભ્યો અને આર્થિક લેવડદેવડની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

પાંચ વર્ષમાં એમએસઆરટીસીની

શ્વેતપત્ર મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના અંત સુધીમાં એમએસઆરટીસીનું નુકસાન વધીને ૧૦,૩૨૪ કરોડ રૂપિયા થયું હતું.

એમએસઆરટીસી અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમણે શ્વેતપત્ર તૈયાર કરવા માટે ૪૫ વર્ષના નાણાકીય ડેટાને ધ્યાનમાં લીધા છે અને આ સમયગાળા દરમિયાન, કોર્પોરેશન ફક્ત આઠ વર્ષ - ૧૯૮૭-૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯૪-૯૫, ૧૯૯૫-૯૬, ૨૦૦૬-૦૭, ૨૦૦૭-૦૮, ૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦ માં નફામાં હતું. સરનાઈકે જણાવ્યું હતું કે કોર્પોરેશન આઠ વર્ષ સુધી નફામાં રહ્યું હતું, અને તેમાંથી ચાર વર્ષ, રાજ્યના વર્તમાન નાણાં સચિવ, ઓ પી ગુપ્તા, એમએસઆરટીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેશન પાસે પહેલા એક લાખથી વધુ કર્મચારીઓ અને ૧૮,૫૦૦ બસો હતી. હવે, કર્મચારીઓની સંખ્યા ઘટીને ૮૭,૦૦૦ અને બસો ૧૪,૫૦૦ થઈ ગઈ છે.

ગોરેગામમમાં

સેટ બનાવવામાં આવ્યો છે. લગભગ પાંચ હજાર સ્કેવર ફૂટના વિસ્તારમાં સેટ ફેલાયેલો છે. સોમવારના વહેલી સવારના લગભગ છ વાગીને દસ મિનિટની આસપાસ સેટ પરના ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, પ્લાસ્ટિક મટિરિયલ, લોખંડની સામગ્રી, કેમેરા, આર્ટિસ્ટના કોસ્ચ્યુમ, લાઈટિંગ સિસ્ટમ, સ્ટુડિયોના સાધનોમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના ફાયર એન્જિન, છ જંબો ટેન્કરે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ ૧૦.૧૫ વાગે આગ બુઝાવવામાં સફળતા મળી હતી. જોકે કૂલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું. ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગમાં કોઈ જખમી થયું નહોતું પણ આગમાં આખો સેટ સહિત લાખો રૂપિયાના કિંમતી કેમેરા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સવારના સિરિયલનું શૂટિંગ ચાલુ થવાનું હતું એ પહેલા જ આગ લાગી હતી. તેથી એ સમયે ગણ્યાંગાંઠ્યા લોકો સેટ પર હાજર હોવાથી આગની જાણ થતા જ તેઓ તરત બહાર દોડી આવ્યા હતા. સદ્નસીબે આગને ફેલાતી રોકવામાં સફળતા મળી હતી અન્યથા આગ જો બાજુમાં આવેલા સેટ સુધી ફેલાઈ ગઈ હોત તો વધુ નુકસાન થવાની શક્યતા હતી.

ફાયરબ્રિગેડના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગની દુર્ઘટના બાદ સેટના માલિકે તમામ પ્રકારની મંજૂરીઓ મેળવી હતી કે તેની તપાસ કરવામાં આવશે.

પહેલી જુલાઈથી કચરો

કરવા માટેનો કૉન્ટ્રેક્ટર પણ આપવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. અત્યાર સુધી કચરો ભેગો કરવાનું કામ અમુક ઠેકાણ પાલિકાના વાહનો અને પાલિકાના કર્મચારીઓ કરી રહ્યા છે. અમુક ઠેકાણે કૉન્ટ્રેક્ટરોના વાહનો અને પાલિકાના મોટર લોડર એવી પદ્ધતિ ચાલી રહી છે પણ પાલિકા પ્રશાસને હવે મુંબઈના પચીસ વોર્ડમાંથી બાવીસ વોર્ડમાં કૉન્ટ્રેક્ટરના વાહનોની સાથે જ તેમની પાસેથી મનુષ્યબળની સેવા લેવા માટે કૉન્ટ્રેક્ટ આપ્યો છે. પ્રશાસનના આ નિર્ણય સામે પાલિકાના કર્મચારીઓના યુનિયને વિરોધ નોંધાવ્યો છે. યુનિયનના વિરોધને નહીં ગણકારતા પ્રશાસને ટેન્ડર બહાર પાડ્યા છે. સાત વર્ષના કૉન્ટ્રેક્ટ માટે ૪,૧૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ ટેન્ડર પ્રક્રિયા સામે તમામ કર્મચારી યુનિયને વિરોધ નોંધાવ્યો છે અને તેની વિરોધમાં ગયા અઠવાડિયે દાદરમાં કર્મચારીઓની બેઠક લીધી હતી. એ બાદ મંગળવારે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ૨૩ જૂનથી વોર્ડ સ્તરે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો. તે મુજબ સોમવારે પાલિકાની ભાયખલા ઓફિસમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પ્રશાસને આ ટેન્ડર રદ નહીં કર્યા તો પહેલી જુલાઈથી આંદોનલ કરવાની ચીમકી યુનિયને આપી છે. તેથી ભરચોમાસામાં રસ્તા પર કચરો ઉપાડયા વગર પડી રહેવાની શક્યતા છે.

જૈન મરણ

ઘોઘારી વિશ્રા શ્રીમાણી જૈન

પાલિતાણા નિવાસી હાલ મુંબઈ, સ્વ અંજવાળીબેન પ્રેમચંદ છગનલાલ શાહના સુપુત્ર હર્ષદભાઈ શાહ (ઉં. વ. ૮૨) તા. ૨૨/૬/૨૫ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. જે અરુણાબેનના પતિ. સ્વ. મનસુખભાઈ, સ્વ. મણીભાઈ, સ્વ. ભોગીભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. છોટુભાઈ, સ્વ. ધીરુભાઈ, સ્વ. ચંદુભાઈ, ધનવંતભાઈના ભાઈ. પારસભાઈ અને સ્વ. વિરાગભાઈના પિતાશ્રી. હેતલબેનના સસરા. સસુરપક્ષે સ્વ. નવનીતલાલ રતનશી શાહ (પાલીતાણાવાળા)ના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, ૨૮-૬-૨૫ના ૪ - ૬. યશવંતરાવ ચૌહાન સેન્ટર, જનરલ જગન્નાથરાવ ભોસલે માર્ગ, નરીમન પોઈન્ટ, મુંબઈ - ૨૧.

ઝાલાવાડી દશાશ્રીમાળી દેરાવાસી જૈન

સુદામડા નિવાસી હાલ મલાડ, સ્વ. હિરાલાલ વીરચંદ મસ્કારીયા (શાહ)ના પુત્ર સ્વ. નરેન્દ્રભાઈનાં ધર્મપત્ની સ્મિતાબેન (ઉં. વ. ૬૫) તા. ૨૨-૬-૨૫ના અરિહંતશરણ પામ્યા છે. તે મૌલિક, નિરાલી રાજેશભાઈ, શિવાની જયેશભાઈનાં માતા. રસીલાબેન દીપકભાઈ, પ્રફુલાબેન ભાનુભાઈનાં ભાભી. વિછીયા નિવાસી સ્વ. મનસુખલાલ મથુરદાસ તુરખિયાનાં પુત્રી. નીતાબેન, નયનાબેન, ભાવનાબેન, નૂતનબેન, સ્વ. દેવાંગભાઈનાં બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખી છે. ૨૦૨, મિલન રેસિડેન્સી, રામચંદ્ર લેન, મલાડ-૫.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

કરિયાણા જિલ્લો અમરેલી હાલ ડોમ્બિવલી, દીપ્તિબેન શાહ (ઉં. વ. ૪૭) તે સુરેશભાઈ શાહના ધર્મપત્ની સ્વ. હીરાબેન પ્રભુદાસ અમૃતલાલ શાહના પુત્રવધૂ. દિશાના મમ્મી. હસમુખભાઈ જયસુખભાઈ ભૂપેન્દ્રભાઈ જીતુભાઈના ભાઈના ધર્મપત્ની. સ્વ. જયંતીલાલ સોમચંદ શાહ તથા ઊર્મિલાબેન શાહના પુત્રી (ગામહોદ જિલ્લો લીમડી) ૨૨-૬-૨૫ના ડોમ્બિવલી અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન

ગુંદાલાના દર્શન (સિદ્ધાર્થ) ભાવના ગાલા (ઉં. વ. ૧૯) તા. ૨૧-૬-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. ભાવનાના સુપુત્ર. સ્વ. મંજુલા નવિનચંદ્ર દેઢીયાના દોહીત્ર. પરી, આરવ, વત્સલના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હસમુખ ગાંગજી દેઢીયા, ૧૫૬, કેશવ સદન, સ્વદેશી મિલ રોડ, પોસ્ટ ઓફિસની બાજુમાં, (સાયન), ચુનાભટ્ટી (ઇસ્ટ).

વડાલાના અ. સૌ. પાયલ રિતેશ નિસર (ઉં. વ. ૩૬) તા.૨૨-૬-૨૫ના અવસાન પામેલ છે. નિર્મળા લખમશી (બબ્બો)ના પુત્રવધૂ. રિતેશના ધર્મપત્ની. રાજીના મમ્મી. વલસાડના ગીતા નવીન પટેલના પુત્રી. રીના, મેઘના, વિનય, જ્યોતિ મયુર ધનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. લખમશી નિસર, બી-૪, ચિરાગ બિ., છેડા પાર્ક, નાલાસોપારા (ઈ).

ભુજપુરના ડો. મુકેશ ખીમજી દેઢિયા (ઉં. વ. ૬૫) તા. ૨૧-૬-૨૫ના અવસાન પામ્યા છે. પ્રભાવતીબેન ડો. ખીમજી ગોસરના સુપુત્ર. પ્રતિભાના પતિ. ઈશિતાના પિતાશ્રી. નિર્મળાબેન જયંતિલાલ કેશવજી છેડા, નીલમબેન નરેશ ગાંગજી ગંગરના ભાઈ. રાયણના ચંપાબેન દેવચંદ ઘેલાભાઈ ગડાના જમાઈ. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈન શ્રા. સં. : કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૪ થી ૫.૩૦.

વિઢ હાલે મેરાઉના કેસરબેન કંચનલાલ નાગડા (શાહ) (ઉં. વ. ૭૪) તા. ૨૨-૬-૨૫ના અવસાન પામેલ છે. શાંતીબેન વલ્લભજીના પુત્રવધૂ. સ્વ. કંચનલાલના પત્ની. સંજય, કેતન, બીજલના માતુશ્રી. મણીબેન કલ્યાણજીના સુપુત્રી. પ્રા. યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફલોર, દાદર (ઈ). ટા.: બપોર ૪ થી ૫.૩૦.

વાગડ વિ.ઓ. જૈન

ગામ ભચાઉ હાલે બોરીવલીના સ્વ. આસઈબેન હિરજી ખુથિયા (ઉં.વ. ૮૫) શુક્રવાર, તા. ૨૦-૬-૨૫ના અવસાન પામેલ છે. સ્વ. જમનાબેન નારણ વાલજીના પુત્રવધૂ. સ્વ. હિરજીના ધર્મપત્ની. ધનશ્યામના માતુશ્રી. પુષ્પાના સાસુ. કિશોર, વિરેનના દાદી. સામખીયારીના સ્વ. મૂરઈ ભાણજી ગોવર ગાલાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૪-૬-૨૫, મંગળવારના ૨.૦૦થી ૩.૦૦. શ્રી કરશન લધુ નિસર હોલ, પહેલા માળે, દાદર-વેસ્ટ.

દશા શ્રીમાળી દિગંબર મુમુક્ષુ જૈન

મોરબી નિવાસી હાલ મુંબઈ, પ્રકાશભાઈ જેચંદભાઈ વાઘજીભાઈ મહેતા (ઉં.વ. ૮૭) તા. ૨૩-૬-૨૫ના દેહપરિવર્તન થયેલ છે, તે ઈન્દુબેનના પતિ. દિવ્યેનભાઈ તથા દર્શનભાઈના પિતાશ્રી. નિનાબેન અને બોસ્કીબેનના સસરા. ઋષભ, રેચલ અને હર્ષના દાદા. સાવરકુંડલાવાળા અનુપચંદ બાવચંદ દોશીના જમાઈ. નવીનચંદ્ર કરણમલ ભુતા તથા દીપકભાઈ હેમચંદભાઈ શ્રોફના વેવાઈ. નિવાસઃ ઈ-૧/૮૦૪, રુતુ ટાવર, પાટલીપાડા, થાણા (વેસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

સાવરકુંડલા નિવાસી હાલ મલાડ સ્વ. જયંતીલાલ વિઠ્ઠલદાસ મહેતાના સુપુત્ર શશીકાંતભાઇ (ઉં. વ. ૭૧) તા. ૨૨-૬-૨૫ને રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે રીટાબેનના પતિ. શૈલેષભાઇ અને દિલીપભાઇના મોટાભાઇ. પ્રશાંતના પિતાશ્રી. બીનાબેનના સસરા. તે પાલિતાણાવાળા પ્રભુદાસ ચુનીલાલ સંઘવીના જમાઇ. બન્ને પક્ષની સાદડી તા. ૨૬-૬-૨૫ને ગુરુવારે ૫થી ૮. ઠે. શીતલનાથ એનકલેવ એ. વિંગ, પહેલે માળે, બેન્કવેટ હોલ, રિદ્ધિ વિનાયક હોસ્પિટલ પાસે, એસ. વી. રોડ, મલાડ (વેસ્ટ).

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન

રાણપુર નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. કાંતાબેન મોહનલાલ નાગરદાસ કામદારના સુપુત્ર ભૂપેન્દ્રભાઇ (ઉં. વ. ૭૯) તા. ૨૨-૬-૨૫ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેન કામદારના પતિ. યોગીન તથા પ્રિયંકાના પપ્પા. પરેશકુમાર કુવાડિયા તથા દર્શનાબેનના સસરા. સ્વ.કુમુદબેન, સ્વ. મધુસુદનભાઇ, વિનયભાઇ, અનીલભાઇ, સ્વ. ચંદ્રિકાબેન, કિરણબેન, સરોજબેન, શોભાબેનના ભાઇ. સ્વ. મોહનલાલ તુલસીદાસ ઠક્કરના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૧૦૩ રઘુ લક્ષ્મી સુદામા, ડો. મુખર્જી ક્રોસ રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ).

ક. દ. ઓ. જૈન

સાંધવના સ્વ. મુલજી રાઘવજી લોડાયાના ધર્મપત્ની કાન્તાબેન (ઉં. વ. ૮૪) તા. ૨૨-૬-૨૫ રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે જીવરાજ લખમશી નાગડાના સુપુત્રી. જયશ્રી-કાંતિલાલ, આશા-નરેશ, મનિષા-બકુલના માતુશ્રી. તે સ્વ. ચંદ્રકાન્ત, નવલ, શાંતીલાલના બહેન. સ્વ. ચંપાબાઇ, કસ્તુરીબેન, પ્રેમાબાઇ, કાંતાબાઇ, ભવાનજીભાઇના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૪-૬-૨૫ મંગળવારના ૩-૩૦થી ૫.૩૦. ઠે. માટુંગા કચ્છી મૂર્તિપૂજક જૈન શ્વેતાંબર સંઘની શ્રી નારણજી શામજી મહાજન વાડી, ૪૫૨/૪૫૩, ભાઉદાજી રોડ, મહેશ્વરી ઉદ્યાન, માટુંગા-મુંબઇ-૪૦૦૦૧૯.

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન

ગોદાવરી નિવાસી હાલ બોરીવલી સ્વ. છબલબેન હરીલાલ ડગલીના સુપુત્ર પ્રવીણચંદ્ર ડગલી (ઉં. વ. ૭૫) તા. ૨૧-૬-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ધીરજલાલ, સ્વ. પાનાચંદભાઇ, ચંપકભાઇ, સ્વ. લલિતાબેન, સરોજબેન, પ્રભાબેન, શર્મિષ્ઠાબેનના ભાઇ. સ્વ. બકુલાબેનના પતિ. રિદ્ધિ-મૌલીક કુમાર શાહના પિતા. ધાંધલપુર નિવાસી હાલ મલાડ કાંતાબેન ધીરજલાલ તુરખીયાના જમાઇ. ખંભાત નિવાસી હાલ બોરીવલી રાજેન્દ્રભાઇ જયંતીલાલ શાહના વેવાણ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પારસી મરણ

કેટી કાવસ પુનાવાલા, તે મરહૂમ કાવસના ધન્યાની. તે મરહૂમો હીરાબાઈ એરચશા ભાનજાના દીકરી. તે ફરોખ ને મોનાઝના માતાજી. તે પોરસ ને શીરીનના સાસુજી. તે રોશન, બેપસી તથા મરહૂમ ફ્રેનીના બહેન. તે ફરઝાન ને ફ્રિયાનના બપઈજી. (ઉં.વ. ૮૨) રે. ઠે. ટી ૪, ગોદરેજ બાગ, શિમલા હાઉસ, નેપીયન્સી રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયાઃ તા. ૨૫-૬-૨૦૨૫ને દિને બપોરે ૩.૪૦ વાગે ઉપરની બેનેટ નં.૬માં.

હિન્દુ મરણ

કચ્છી ભાટીયા

સ્વ. સરલાબેન સ્વાલી (ઉં. વ. ૮૪) તે સ્વ. મુલરાજ દામોદર સ્વાલીના ધર્મપત્ની. હમીર, નિખિલ, માધવી ભરત દલાલના માતુશ્રી. સ્વ.કાનજી માધવજી ધામણીના પુત્રી. તે આશા હમીર તથા લુસિન્દા નીખીલના સાસુજી. ધવલ, મેધાવી હાર્દિક ભાટીયા, રીતુ પંકજ, ડિમ્પલ ગેવિનના દાદી. તથા ખુશી દિશિત ખારાના નાની. રવિવાર, તા. ૨૨-૬-૨૫ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનસભા મંગળવાર તા. ૨૪-૬-૨૫ના બાલભવન બાલ્કનજી બારી રોડ, ઘાટકોપર (ઇસ્ટ), રાજાવાડી સાંજે ૪.૩૦થી ૬.

હાલાઇ લોહાણા

મૂળ ગામ પોરબંદર ડોમ્બિવલી હાલ વિરાર, ગં.સ્વ. મીનાબેન (ઉં. વ. ૮૨) તે સ્વ. શાંતિલાલ મથુરાદાસ લાખાણીના ધર્મપત્ની. હિતેશ તથા કલ્પેશના માતુશ્રી. દીપા તથા કામિનીના સાસુ. રાજ તથા રીયાના દાદી. સ્વ. રવજી વાલજી કારિયા રાજકોટવાળાના દીકરી ૨૧/૬/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ

ડોળિયાવાળા હાલ બોરીવલી ગં. સ્વ. જશવંતીબેન (ઉં. વ. ૮૦) તે સ્વ. મહેન્દ્રભાઇ ગાંધીના ધર્મપત્ની સ્વ. શાંતાબેન વેણીલાલ ગાંધીના પુત્રવધૂ તા. ૨૧-૬-૨૫ શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે નાગેશ્રીવાળા સ્વ. રૂક્ષમણીબેન ધનજીભાઇ ગોરડીયાની પુત્રી. તે કિરણ તથા ધર્મેશના માતુશ્રી. અ. સૌ. પાયલ તથા અ. સૌ. વૈશાખીના સાસુ. સ્વ. રસિકભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. કનુભાઇ, ભૂપેન્દ્રભાઇ, સ્વ. શશીબેન કાંતિલાલ મહેતા, સ્વ. રંજનબેન દિપકકુમાર મરચન્ટના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ

રાજુલાવાળા હાલ કાંદિવલી સ્વ. મુકતાબેન વલ્લભદાસ સંઘવીના સુપુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૮૨) તે જયશ્રીબેનના પતિ. ગ્રીષ્મા વિરલ દેસાઇ, ગાર્ગી સુદેશ જાલાન, ગુંજનના પિતા. તે સ્વ. ધીરજલાલ, સ્વ. જીતેન્દ્રભાઇ, ગં. સ્વ. ભાનુબેન મુકુંદભાઇ વોરા, સ્વ. ધનલક્ષ્મીબેન નિરંજનભાઇ મહેતા, ગં. સ્વ. હેમલતાબેન રવિન્દ્રભાઇ વાલિયા, ગં. સ્વ. મૃદુલાબેન મુકુંદભાઇ ચિતલિયા, સ્વ. અરુણાબેન અશોકભાઇ ગોરડિયાના ભાઇ. સ્વ. જયંતીલાલ શામળદાસ મોદી (ગ્લાલિયરવાળા)ના જમાઇ. મનન, શ્રેય, મહેક, ખુશી, સાચીના નાના. તા. ૨૧-૬-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

કોડીનાર મોઢ વણિક

મૂળ કોડીનાર હાલ મુંબઇ સ્વ. પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૮૬) તા. ૨૧-૬-૨૫ શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. દુલ્લભદાસ શાહ અને સ્વ. કેસરબેનના સુપુત્ર. સ્વ. ચંદનબેનના પતિ. કેતન, સ્વ. જયેશ, હંસાબેન, કલ્પનાબેન, નિહારિકાબેન, અલકાબેનના પિતાશ્રી. મુકેશભાઇ અને સમીરભાઇના સસરા. મયંક, અમીષી, ધ્રુવી અને વિહાનના નાના. પારેખ કુટુંબના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મરણ ખબર માટેની સૂચના | મૃત્યુનોંધ સાંજે ૭-૩૦ સુધી જ સ્વીકારવામાં આવશે | (૧) મરનારનું નામ (૨) તારીખ (૩) ઉંમર (૪) ક્યાં ગુજરી ગયા છે એ જગ્યા (૫) માતાનું નામ (૬) પિતાનું નામ (૭) ગમે તે ત્રણ સગાઈ (૮) પ્રાર્થનાસભા સ્થળ, તારીખ, સમય. મૃત્યુનોંધ આપનારે ઉપર જણાવ્યા મુજબની વિગતો જ પોતાના લેટરહેડ પર લખીને આપવાની રહેશે. સગાઈરૂપે લખાયેલાં વધારાના નામોની કાપકૂપ થાય તો એ માટે કોઈ સંવાદને સ્થાન રહેશે નહીં. (૫૦ શબ્દથી વધારે નહીં). - વ્યવસ્થાપક

સાવધાન!

ચોમાસાની સૌથી મોટી ભરતી માટે અત્યારે તો યલો અલર્ટ જાહેર

આજથી દરિયામાં પાંચ દિવસ મોટી ભરતી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આજથી દરિયામાં પાંચ દિવસ મોટી ભરતી રહેવાની છે. ચોમાસાના ચાર મહિના દરમ્યાન ૨૪ જૂનથી ૨૮ જૂન સુધી આ પાંચ દિવસની ભરતી સૌથી મોટી રહેવાની છે. ભરતી દરમ્યાન દરિયામાં મોજાં ૪.૭૫ મીટર સુધી ઊંચા ઉછળશે. દરિયામાં મોટી ભરતીની શક્યતા વચ્ચે જ હવામાન વિભાગે સોમવારથી ગુરુવાર સુધીમાં મુંબઈ સહિત થાણે માટે યલો અલર્ટની ચેતવણી આપી હોઈ આ સમય દરમ્યાન ભારે વરસાદ પડયો તો મામૂલી વરસાદમાં પણ પાણી ભરાઈને મુંબઈ જળબંબાકાર થવાની શક્યતા છે.

આગામી બેથી ત્રણ દિવસ દક્ષિણ કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મુંબઈ સહિત થાણે માટે મંગળવાર અને ગુરુવાર (જુઓ પાનું ૪)

ખતરાની ઘંટડી: નરીમાન પોઇન્ટ પર અરબી સમુદ્રમાં ઊંચા મોજાં ઊછળ્યાં હતાં. (જયપ્રકાશ કેળકર)

દાણચોરીનાં સોનાને ઓગાળવાના મસ્જિદ બંદરના કારખાના પર રેઈડ

દાણચોરીની ઈન્ટરનૅશનલ સિન્ડિકેટ સાથે સંકળાયેલા સાતની ડીઆરઆઈ દ્વારા ધરપકડ: ૮.૯૩ કરોડનું સોનું જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વિદેશથી દાણચોરીથી લવાયેલા સોનાને દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં આવેલા કારખાનામાં ઓગાળીને તેને ફરી લગડી બનાવી બજારમાં વેચવાના રૅકેટમાં સંડોવાયેલા આરોપીઓ પર ડિરક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) કાર્યવાહી કરી હતી. ડીઆરઆઈના અધિકારીઓએ કારખાના પર રેઇડ કરી સાત આરોપીની ધરપકડ કરી હતી અને ૮.૯૩ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશી નાગરિકોની મદદથી સોનાની દાણચોરીના અમુક કેસોની તપાસમાં ડીઆરઆઈ આ કારખાના સુધી પહોંચી હતી. વિદેશી નાગરિકોની મદદથી સોનું મુંબઈ ઍરપોર્ટ પહોંચાડવામાં આવતું હતું અને ઍરપોર્ટના કર્મચારીઓને આપવામાં આવતું. બાદમાં કર્મચારીઓ પાસેથી એ સોનું લઈને મસ્જિદ બંદરના કારખાનામાં લાવવામાં આવતું, જ્યાં સોનું ઓગાળીને તેની ફરી લગડી બનાવવામાં આવતી. બાદમાં મુંબઈની બજારમાં સોનું ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું.

મળેલી માહિતીને આધારે ડીઆરઆઈએ રવિવારે કાઝી સૈયદ સ્ટ્રીટ ખાતેની એક બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા કારખાના પર રેઇડ કરી હતી. કારખાનામાંથી પાંચ જણને પકડી પાડી ૮.૯૩ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીઓની ઓળખ મિનીનાથ ભુલે, વિશ્વાસ યાદવ ઉર્ફે અમોલ, ઉદય જનગામ, રોહિત મોહિતે અને વિક્રમ મોટે તરીકે થઈ હતી. આરોપીઓ જપ્ત (જુઓ પાનું ૪)

ગોરેગામમાં ‘અનુપમા’નો સેટ ભીષણ આગમાં ખાખ

વહેલી સવારે શૂટિંગ શરૂ થાય એ પહેલા આગ લાગતા કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગોરેગામ (પશ્ચિમ)માં આવેલા ફિલ્મ સિટીમાં ટીવી સિરિયલ ‘અનુપમા’ના સેટ પર સોમવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થવાના કે જાનહાનિ થવાના બનાવ નોંધાયા નહોતા. લગભગ ચાર કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કૂલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ ફિલ્મ સિટી કૉમ્પ્લેક્સમાં વ્હિસલિંગ વૂડ્સ કેમ્પસ અને બિગ બોસ (મરાઠી)ના સેટની નજીક હિંદી ટીવી સિરિયલ ‘અનુપમા’નો (જુઓ પાનું ૪)

ગોરગાવમાં ફિલ્મ સિટીમાં અનુપમા સિરિયલના સેટ પર સોમવારે ભીષણ આગ લાગી હતી. (અમય ખરાડે)

મરીન લાઈન્સના સાત માળના મકાનમાં છઠ્ઠા માળ પર આવેલી એક ઓફિસમાં ગઈ કાલે આગ લાગી હતી. (જયપ્રકાશ કેળકર)

મરીન લાઈન્સમાં છઠ્ઠા માળની ઓફિસમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દક્ષિણ મુંબઈના મરીન લાઈન્સમાં સાત માળની રહેણાંક ઈમારતના છઠ્ઠા માળે બપોરના આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

ડિઝાસ્ટર કન્ટ્રોલના જણાવ્યા મુજબ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ભગવાનદાસ તોલાની માર્ગ પર ફ્લાયઓવર નજીક ગ્રાઉન્ડ પ્લસ સાત માળની નિલકંઠ નિરંજન બિલ્ડિંગ આવેલી છે. સવારના લગભગ ૧૦.૫૫ વાગ્યાની આસપાસ (જુઓ પાનું ૪)

કરોડો રૂપિયાનું વીઆઇપીએસ ગ્રૂપ પોન્ઝી કૌભાંડ

ઇડીની સુરત, કોલ્હાપુર, અહમદનગર, પુણેમાં વિવિધ સ્થળે સર્ચ

મુંબઈ: વિનોદ ખુટે, તેના પરિવારના સભ્યો અને સહયોગીઓ દ્વારા સંચાલિત વીઆઇપીએસ ગ્રૂપ ઓફ કંપનીઝને નામે બોગસ પોન્ઝી/મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમ્સ/ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે સંબંધિત મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરક્ટરેટ (ઇડી)ની મુંબઈ ઝોનલ ઓફિસે શુક્રવારે સુરત, કોલ્હાપુર, અહમદનગર અને પુણેમાં વિવિધ સ્થળે સર્ચ હાથ ધરી હતી. આ સર્ચ દરમિયાન વિવિધ વાંધાજનક દસ્તાવેજો, કરોડોની સ્થાવર સંપત્તિની વિગતો, ડિજિટલ ડિવાઇસીસ અને બૅંક ફંડ જપ્ત/સ્થગિત કરવામાં આવ્યા હતા. પુણેના ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા (જુઓ પાનું ૪)

પહેલી જુલાઈથી કચરો ઉપાડવાનું બંધ કરવાની સુધરાઈ કર્મચારીઓની ધમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં કચરો ભેગો કરીને તેને લઈ જવા માટે કૉન્ટ્રેક્ટરો પાસેથી વાહનો અને સેવા લેવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગે લીધો હોઈ તેની માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, તેની વિરુદ્ધમાં તમામ કર્મચારીઓના યુનિયને વિરોધ નોંધાવ્યો છે. જો પ્રશાસને આ કૉન્ટ્રેક્ટ રદ નહીં કર્યો તો પહેલી જુલાઈથી રસ્તા પરથી કચરો ઉપાડવાનું બંધ કરીને આંદોલન કરવાની ચીમકી યુનિયને આપી છે. જો પહેલી જુલાઈથી સફાઈ કર્મચારીઓ આંદોલન પર ઊતરી જાય છે તો બરોબર ચોમાસાના સમયમાં મુંબઈના રસ્તા પર કચરાના ઢગલા જોવા મળી શકે છે.

પાલિકાએ કચરાની ગાડીઓ માટે નવો કૉન્ટ્રેક્ટ આપવાનો નિર્ણય લીધો છે, જેમાં ઘર ઘરથી કચરો ભેગો (જુઓ પાનું ૪)

પાંચ વર્ષમાં એમએસઆરટીસીની ખોટ બમણાથી પણ વધીને ૧૦,૩૨૪ કરોડ

પરિવહન નિગમની નાણાકીય સ્થિતિ પર બહાર પાડવામાં આવેલા શ્વેતપત્ર થયો ઘટસ્ફોટ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એમએસઆરટીસી)ની ખોટ ૨૦૧૮-૧૯માં ૪,૬૦૩ કરોડ હતી જે ૨૦૨૩-૨૪માં બમણાથી પણ વધીને ૧૦,૩૨૪ કરોડ પર પહોંચી ગઈ છે, એમ એમએસઆરટીસી દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા શ્વેતપત્રમાં જણાવવામાં આવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, દેશના સૌથી મોટા રાજ્ય સંચાલિત પરિવહન ઉપક્રમની ખોટ હજી વધવાની શક્યતા છે કારણ કે એમએસઆરટીસીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧,૨૧૭ કરોડની અનઓડિટેડ ખોટ નોંધાવી છે.

એમએસઆરટીસીના મુખ્યાલયમાં રાજ્ય પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકની હાજરીમાં નાણાકીય સ્થિતિ પર શ્વેતપત્ર બહાર પાડ્યું. (જુઓ પાનું ૪)

હવે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીના રાજકીય કેસો પાછા ખેંચાશે

મુંબઈ: રાજકીય અને સામાજિક મુદ્દાઓ પરના આંદોલનો અને વિરોધ સંબંધી ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીના ફોજદારી કેસ પાછા ખેંચી લેવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે. અગાઉના આદેશ પ્રમાણે ૩૦ ઑગસ્ટ, ૨૦૨૪ સુધીના આવા કેસ પાછા ખેંચાવાના હતા. મહારાષ્ટ્ર સરકારે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ સુધીમાં જે કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોય, તે પાછા ખેંચી લેવાનો આદેશ જારી કર્યો હતો. જોકે, પછી સરકારે આ સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લીધો.■

ટ્રેનમાં મહિલા પ્રવાસીના દાગીના-રોકડ સહિત ૩૫ લાખની મતા ચોરનારા આરોપીની ધરપકડ

થાણે: ઇન્દોર-દૌંડ એક્સપ્રેસમાં મહિલા પ્રવાસીના દાગીના અને રોકડ સહિત ૩૫ લાખ રૂપિયાની મતા ચોરનારા રીઢા આરોપીને રેલવે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જોઇન્ટ ઑપરેશન હાથ ધરીને પકડી પાડ્યો હતો.

આરોપીની ઓળખ મહેશ ઘાગ ઉર્ફે વિકી તરીકે થઇ હોઇ તેને ચિપલુણથી તાબામાં લેવાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઇન્દોર-દૌંડ એક્સપ્રેસમાં ગુરુવારે રાતે ચોરીની ઘટના બની હતી. ટ્રેન શુક્રવારે સવારના કલ્યાણ સ્ટેશન પહોંચ્યા બાદ મહિલા પ્રવાસીને તેની બેગ ચોરાઇ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેની બેગમાં નેકલેસ, હીરાજડિત બંગડીઓ, સોનાની ઘડિયાળ, વીંટી, રોકડ તથા અન્ય મતા હતી અને બેગ તેણે તકીયા નીચે રાખી હતી.

બેગ ચોરાયા બાદ મહિલાએ રેલવે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આથી કલ્યાણ રેલવે પોલીસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ આદરી હતી.

પોલીસ ટીમે કલ્યાણ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક શખસ ઉતાવળમાં અને શંકાસ્પદ રીતે ટ્રેનમાંથી ઊતરતો નજરે પડ્યો હતો, જેને બાદમાં મહેશ ઘાગ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો. મહેશ ઘાગ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે. દરમિયાન પોલીસે મળેલી માહિતીને આધારે મહેશ ઘાગને ગુનો આચર્યાના ૧૨ કલાકમાં પકડી પાડ્યો હતો અને ચોરેલી મતા જપ્ત કરી હતી. (પીટીઆઇ)■

પાલિકાઓ અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ અલગ-અલગ યોજાશે

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં શું થશે તે અંગે કોઈ નિશ્ચિતતા નથી. પહેલા બનેલી ઘટનાઓએ આ વાત દર્શાવી છે. આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓની પૃષ્ઠભૂમિ સામે, દરેક મહત્વપૂર્ણ શહેર અને જિલ્લામાં પડદા પાછળ મોટી રાજકીય ઘટનાઓ આકાર લઈ રહી છે પછી ભલે એ મહાવિકાસ આઘાડી હોય કે હોય મહાયુતિ.

રાજ્યની ઘણી નગરપાલિકાઓમાં વહીવટદાર બે, ત્રણ અને કેટલીક જગ્યાએ પાંચ વર્ષથી કામકાજ ચલાવી રહ્યા છે. ચૂંટણી પંચ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યું છે. તે મુજબ, માહિતી બહાર આવી રહી છે કે ચૂંટણી પંચ મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ આ ચાર તબક્કામાં યોજશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાર તબક્કામાં યોજાશે તેવી ચર્ચા છે. ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં યોજાશે તેવી માહિતી મળી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે પાલિકઓ અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ અલગ-અલગ યોજાશે. હાલમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વોર્ડ રચનાનું કામ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કરે તેવી શક્યતા છે. ચૂંટણી પંચ તેની તૈયારી કરી રહ્યું છે. જોકે, ચૂંટણી પંચે ચાર તબક્કામાં ચૂંટણીઓ યોજાશે તેવી જાહેરાત કરી નથી. આ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ આ અંગે સત્તાવાર જાહેરાત કરે તે પછી પણ બધું સ્પષ્ટ થશે. પરંતુ હાલમાં આ અંગે ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી છે. ■

વસઈમાં દીકરાઓએ મારપીટ કરી વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર કાઢ્યાં

પાલઘર: વસઈ નજીક બનેલી શરમજનક ઘટનામાં બે દીકરાએ વૃદ્ધ માતા-પિતાની કથિત મારપીટ કર્યા પછી તેમને ઘરની બહાર કાઢી નાખ્યાં હતાં.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના ૧૬ જૂને વસઈના પાટીલ અલી વિસ્તારમાં બની હતી. આ પ્રકરણે અંદાજે ૭૦ વર્ષના વૃદ્ધ દંપતીના બન્ને દીકરા અને તેમની પત્નીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૩૫૧(૨) અને ૩૫૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર પાટીલ અલી વિસ્તારમાં રહેતાં દંપતીની તેમના જ દીકરાઓ દ્વારા વારંવાર મારઝૂડ કરવામાં આવતી હતી. ૧૬ જૂને તો મારઝૂડ કરીને દંપતીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ દંપતી પાસે રહેવાની બીજી કોઈ વ્યવસ્થા નહોતી. આખરે બિનસરકારી સંસ્થાના એક સ્વયંસેવકે તેમને કામચલાઉ આશ્રય આપ્યો હતો. આ પ્રકરણે પોલીસ તપાસ કરી રહી છે. સોમવારની મોડી સાંજ સુધી આ કેસમાં કોઈની પણ ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)■

વારકરી પર ઝેરી વિધાન

અબુ આઝમી સામે પગલાં લેવાની એનસીપીની માગણી

મુંબઈ: વારકરીઓને લીધે રસ્તો જેમ થાય છે એ વિશે અમે ક્યારેય ફરિયાદ નથી કરી પણ અમે રસ્તા પર નમાઝ પઢીએ છીએ તો એનો વિરોધ થાય છે એવા સમાજવાદી પક્ષના નેતા અબુ આઝમીના નિવેદન સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે અને અજિત પવારની નસીપી)એ આઢમી સામે પગલાં લેવાની માગણી કરી છે. એનસીપીના મુખ્ય પ્રવક્તા આનંદ પરાંજપેએ એસપીના નેતાની ટિપ્પણીની ટીકા કરતા કહ્યું કે આઝમી માત્ર ઝેર ઓકે છે. પત્રકારો સાથે વાત કરતા પરાંજપેએ કહ્યું હતું કે, અબુ આઝમી ઝેર ઓકતા રહે છે, જે વારંવાર સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે ઉશ્કેરણીજનક નિવેદનો આપે છે. સરકારે તેમની સામે નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ.''

''આઝમી વારંવાર લોકોને વિભાજીત કરવા માટે હિન્દુ-મુસ્લિમ રાજકારણનો ઉપયોગ કરે છે. તેમના શબ્દો તણાવ ઉશ્કેરે છે અને આવા વર્તનને સહન ન કરવું જોઈએ,'' એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)■

વિદેશી સંસદો સાથે મિત્ર જૂથો રચાશે

અંદાજ સમિતિઓની રાષ્ટ્રીય પરિષદ દરમ્યાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું

મુંબઈ: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે જણાવ્યું હતું કે, ભારત ટૂંક સમયમાં વિવિધ દેશોની સંસદો સાથે મિત્રતા જૂથોની રચના થશે અને એના દ્વારા સંસદીય રાજદ્વારી ગતિ વધારવાનો પ્રયાસ કરે છે.

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવાના ભારતના સંકલ્પને વ્યક્ત કરવા માટે વિશ્વની રાજધાનીઓમાં બહુપક્ષી પ્રતિનિધિમંડળોની તાજેતરની મુલાકાતો દરમિયાન પણ આંતર-સંસદીય મિત્રતા જૂથો સ્થાપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. અમે સંસદીય મિત્રતા જૂથો સ્થાપવા પર કામ કરી રહ્યા છીએ કારણ કે આવી વિનંતીઓ ઘણા દેશો દ્વારા કરવામાં આવી છે, એમ બિરલાએ સંસદ અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓના અંદાજ સમિતિઓના રાષ્ટ્રીય પરિષદ દરમ્યાન પત્રકારોને જણાવ્યું હતું. લોકસભા સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આવા મિત્રતા જૂથો ગૃહના કાર્યકાળ સાથે જોડાયેલા છે અને ૧૭મી લોકસભામાં કોઈની સ્થાપના કરવામાં આવી નથી. કોંગ્રેસ નેતા શશી થરૂર, ડીએમકે નેતા કનિમોઝી અને એનસીપી-એસસીપી નેતા સુપ્રિયા સુળે જેવા વિપક્ષી નેતાઓના નેતૃત્વમાં સાત બહુપક્ષી પ્રતિનિધિમંડળો, ૩૩ વિશ્વ રાજધાનીઓમાં ગયા હતા. અગાઉ, અંદાજ સમિતિઓના પરિષદને સંબોધતા, બિરલાએ શાસનમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાના ઉદ્દેશ્યથી આવા તંત્રોના વધુ સારા કાર્ય માટે ટેકનોલોજીના ઉપયોગ માટે મજબૂત વક્તવ્ય આપ્યું હતું. આ પરિષદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર્હે સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં હાજર રહેવાના હતા, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. ■

મહાનુભાવોનું મિલન: લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં અંદાજ સમિતિની રાષ્ટ્રીય પરિષદમાં. (અમય ખરાડે)

અંદાજ સમિતિઓ સરકારને ઉત્તરદાયી બનાવે છે: ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સમિતિઓ આખું વર્ષ કામ કરે છે અને સરકારને ધારાસભા સમક્ષ ઉત્તરદાયી બનાવે છે.

''અંદાજ સમિતિ વધુ ગતિશીલ છે કારણ કે તે એક પેનલ છે જે અગાઉથી ખર્ચની તપાસ કરે છે. બજેટ અંદાજ સાચો છે કે નહીં, તેની જરૂર પણ છે કે નહીં. તે જવાબદારી સુનિશ્ચિત કરે છે,'' એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કહ્યું હતું. ■

નો કમેન્ટ્સ...

ન્યાયાધીશ યશવંત વર્મા મામલે ઓમ બિરલાનો જવાબ

મુંબઈ: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે કહ્યું કે ન્યાયાધીશ યશવંત વર્માના મહાભિયોગ સંબંધિત મામલો હજુ સંસદ સમક્ષ નથી અને આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો કોઈ અર્થ નથી.

''જ્યારે તે સંસદ સમક્ષ લાવવામાં આવે ત્યારે આપણે આ મુદ્દા પર ચર્ચા કરી શકીએ છીએ. જે મામલો ગૃહ સમક્ષ નથી તેના પર વાત કરવાનો કોઈ અર્થ નથી,'' બિરલાએ અહીં એક પરિષદ દરમિયાન પત્રકારોને જણાવ્યું.

ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને પત્ર લખીને જસ્ટિસ વર્માને પદ પરથી દૂર માટે કહ્યું હતું. વર્માના ઘરેથી રોકડનો ઢગલો મળી આવ્યો હતો. ■

રાષ્ટ્રીય અંદાજ સમિતિ પરિષદમાં બેનરો મરાઠીમાં કેમ નથી?: મનસે લાલઘૂમ

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા સંદીપ દેશપાંડેએ સોમવારે મહાનગરના વિધાનભવન ખાતે યોજાઈ રહેલી સંસદ અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓની રાષ્ટ્રીય અંદાજ સમિતિઓના પરિષદમાં મરાઠીમાં બેનરો ન હોવા બદલ રાજ્ય સરકારની ટીકા કરી હતી.

શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવવા સામે દાદર વિસ્તારમાં સહી ઝુંબેશમાં ભાગ લેનારા દેશપાંડેએ કહ્યું કે, બેનરો ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં છે.

''સંમેલનમાં મુખ્ય મંચ પર મરાઠીમાં બેનરો કેમ નથી? જો આપણે મરાઠીનું સન્માન નહીં કરીએ, તો કોણ કરશે? ભલે આ રાષ્ટ્રીય પરિષદ હોય, સ્થળ મુંબઈ અને મહારાષ્ટ્ર છે, તેથી મરાઠીમાં બેનરો મૂકવા જોઈતા હતા,'' તેમણે કહ્યું. સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ દરમિયાન ચિંતામણરાવ દેશમુખે નહેરુ કેબિનેટમાંથી નાણામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું તે તરફ ધ્યાન દોરતા, તેમણે કહ્યું કે આ ''નપુંસક'' સરકારે તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે આ પરિષદ લોકસભા સચિવાલય દ્વારા આયોજિત કરવામાં આવી છે અને તેથી, બેનરો હિન્દી અને અંગ્રેજીમાં હતા.

''જો મહારાષ્ટ્ર સરકારે આ કાર્યક્રમનું આયોજન કર્યું હોત, તો બેનરો મરાઠીમાં હોત,'' તેમણે ભારપૂર્વક જણાવ્યું. શિંદે અને ગોર્હે ઉપરાંત, પરિષદમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નરવેકર અને વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે હાજર રહ્યા હતા. (પીટીઆઈ)■

યશસ્વી, જાડેજાએ કેચ છોડ્યા એટલે સચિને કરી ટકોરઃ 'બુમરાહને નવ વિકેટ ન મળી શકી'

ખુદ બુમરાહે પણ નારાજગી બતાવી

લીડ્સઃ જસપ્રીત બુમરાહના પાંચ વિકેટના તરખાટ (૨૪.૪-૫-૮૩-૫)ને કારણે રવિવારે ભારત સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમ સરસાઈ નહોતી મેળવી શકી જેને પગલે સોશિયલ મીડિયામાં સચિન તેંડુલકરે બુમરાહના ખૂબ વખાણ કર્યા હતા, પરંતુ તેણે યશસ્વી જયસ્વાલ અને રવીન્દ્ર જાડેજા વિશે આડકતરી ટકોર પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ સિરીઝ એન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના નામે રમાઈ રહી છે એટલે સચિનની પ્રતિક્રિયા આવે એ સ્વાભાવિક છે.

યશસ્વી અને જાડેજાએ કેચ છોડ્યા એને લીધે બુમરાહને પાંચ કરતાં વધુ વિકેટ નહોતી મળી શકી. બુમરાહની બોલિંગમાં કુલ મળીને ચાર કેચ છૂટ્યા હતા.

મીડિયાની પોસ્ટમાં સચિનનું કહેવું એમ હતું કે કેચ છૂટ્યા એને લીધે બુમરાહને કુલ નવ વિકેટ નહોતી લેવા મળી.

સચિને બુમરાહને સોશિયલ મીડિયામાં આપેલા અભિનંદનવાળી પોસ્ટમાં છૂટેલા કેચનો ઉલ્લેખ કર્યો છે. સચિને પોસ્ટમાં લખ્યું કે 'બુમરાહ, તને અભિનંદન. તને એક નો-બોલને કારણે વિકેટ ન મળી શકી અને તારી બોલિંગમાં કેચ પણ છૂટ્યા. આને કારણે તારી અને તારી નવ વિકેટ વચ્ચે અંતર રહી ગયું.'

હેરી બ્રુક આઉટ પછી નોટ આઉટ

શનિવારે બુમરાહના એક બોલમાં હેરી બ્રુક ઇનિંગ્સની શરૂઆતમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ બુમરાહનો એ નો-બોલ હતો જેને લીધે હેરી બ્રુકને જીવતદાન મળ્યું હતું. ત્યાર પછી તેને કેચ છૂટવાને કારણે વધુ જીવતદાનો મળ્યા હતા. જોકે તે ૯૯ રનના પોતાના સ્કોર પર પ્રસિધ્ધ ક્રિષ્નાના બોલમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

સિરાજ-ક્રિષ્ના ભારતીય ટેસ્ટ ક્રિકેટની બેડ બૂકમાં

ઇંગ્લેન્ડના પહેલા દાવમાં રવિવારે પ્રસિદ્ધ ક્રિષ્ના (૨૦-૦-૧૨૮-૩) અને મોહમ્મદ સિરાજ (૨૭-૦-૧૨૨-૨)ની બોલિંગમાં કુલ ૨૫૦ જેટલા રન બન્યા હતા. કોઈ એક જ ટેસ્ટ ઇનિંગ્સમાં ભારતના કોઈ બે પેસ બોલરની બોલિંગમાં ૧૨૦ કરતાં વધુ રન બન્યા હોય એવું છેલ્લા દસ વર્ષમાં (૨૦૧૫ પછી) પહેલી વાર બન્યું છે. રવિવારે જાડેજા અને શાર્દુલને વિકેટ નહોતી મળી.

બુમરાહે શું નિવેદન આપ્યું

ખુદ બુમરાહ પોતાની બોલિંગમાં કેચ છૂટવાના બનાવોને કારણે નારાજ હતો. તેણે રવિવારની રમત પછી જણાવ્યું હતું કે 'અમારા ઘણા બોલર પહેલી વાર અહીં ઇંગ્લેન્ડમાં રમી રહ્યા છે. અમને ભારતમાં સપાટ પિચ પર રમવાની આદત છે, જયારે અહીંની પિચ ઘણી અલગ અને વિચિત્ર ઉછાળ અપાવનારી છે. જોકે મને ક્રિકેટ રમવી ખૂબ ગમે છે અને હું હંમેશાં ખુશ મિજાજમાં રમતો હોઉં છું એટલે ક્યારેક હસતો પણ દેખાઉં છું. કેચ છૂટ્યા એ વિશે કહું તો ક્યારેય કોઈ ફીલ્ડર જાણી જોઈને કેચ ન છોડે. અહીં ઠંડીમાં વાતાવરણ ઘણું અલગ છે એટલે ક્યારેક તત્કાળ બોલ જોવામાં મુશ્કેલી પડતી હોય છે. જોકે કેટલીક બાબતો રમતનો હિસ્સો હોય છે એવું હું માનું છું. હું મારા પર કે મારી ભાવિ બોલિંગ પર ખરાબ અસર નથી પડવા દેવા માગતો એટલે હું બધું ભૂલી જઈને આગળ વધવામાં માનું છું.' ■

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૮ વર્ષ પૂર્ણ કર્યાંઃ હેલ્મેટ શેર કરીને લખ્યો ઈમોશનલ મેસેજ

મુંબઈ : રોહિત શર્માએ ૧૮ વર્ષ પહેલા ૨૩ જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ વાત યાદ કરીને હિટમેન ભાવુક થઈ ગયો હતો. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના પહેલા હેલ્મેટનો ફોટો શેર કર્યો અને ઈમોશનલ મેસેજ લખ્યો હતો. રોહિતે લખ્યું હતું કે હું હંમેશાં આભારી રહીશ, ૨૩.૦૬.૦૭. રોહિત ત્યારે ૨૦ વર્ષનો હતો અને તેણે આયરલેન્ડ સામેની ટી૨૦ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ભારત માટે બે આઈસીસી ટ્રોફી જીતનાર રોહિતને સર્વકાલીન શ્રેષ્ઠ ઓપનરોમાંનો એક માનવામાં આવે છે. આ ૧૮ વર્ષોમાં હિટમેનની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ તેણે આ બધાનો બહાદુરીથી સામનો કર્યો અને હવે તે સફળતાના શિખર પર છે.

રોહિતની કેપ્ટનશિપ હેઠળ ભારત ૨૦૨૩ માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને તે વર્ષના અંતમાં વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. જોકે, ટીમ બંને વખત ટ્રોફી ચૂકી ગઈ હતી. તેમણે ૨૦૨૪માં ભારતને ટી૨૦ વર્લ્ડ કપ અપાવ્યો હતો. પછી ટીમે ૨૦૨૫માં રોહિતની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.

૨૦૨૪માં રોહિત ૧૫૦થી વધુ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. જોકે, ભારતની ટી૨૦ વર્લ્ડ કપ જીત પછી તેણે ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિતે બધા ફોર્મેટને જોડીને ૪૯૯ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને ૧૯,૭૦૦ રન કર્યા છે. તેનો વન ડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ છે. તેણે શ્રીલંકા સામે અણનમ ૨૬૪ રન કરીને આ રેકોર્ડ બનાવ્યો છે.

રોહિત અત્યાર સુધી ટી૨૦ માં સૌથી વધુ રન કરનાર ખેલાડી છે. ૧૫૯ મેચોમાં તેણે ૩૨.૦૫ ની સરેરાશથી ૪,૨૨૧ રન કર્યા છે. તેમાં પાંચ સદી અને ૩૨ અડધી સદી છે. ૨૦૨૪ પહેલા રોહિત ૨૦૦૭ માં ટી૨૦ વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. ટી૨૦ કેપ્ટન તરીકે તેણે ભારત માટે ૬૨ માંથી ૪૯ મેચ જીતી છે. ટીમ ઇન્ડિયા ૧૨ હારી ગઈ છે અને એક ટાઇ રહી હતી.

૨૭૩ વનડે મેચની ૨૬૫ ઇનિંગ્સમાં તેણે ૩૨ સદી અને ૫૮ અડધી સદી સાથે ૪૮.૭૬ની સરેરાશથી ૧૧૧૬૮ રન કર્યા છે. વનડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર ૨૬૪ છે. તે વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. રોહિતે તાજેતરમાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે તે ફક્ત વનડેમાં જ રમતા જોવા મળશે.

ટેસ્ટમાં રોહિતે ૬૭ ટેસ્ટ અને ૧૧૬ ઇનિંગ્સમાં ૪૦.૫૭ની સરેરાશથી ૪૩૦૧ રન કર્યા છે, જેમાં ૧૨ સદી અને ૧૮ અડધી સદીનો સમાવેશ થાય છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર ૨૧૨ રન છે.

રોહિતના નામે વર્લ્ડ કપ દરમિયાન સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. તેણે ૨૦૧૯ વર્લ્ડ કપ દરમિયાન પાંચ સદી ફટકારી હતી. આ ટુર્નામેન્ટમાં તેણે નવ મેચોમાં ૮૧.૦૦ ની સરેરાશથી ૬૪૮ રન કર્યા હતા. ■

સેશેલ્સ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતનું શાનદાર પ્રદર્શન

સાત મેડલ સાથે હાંસલ કર્યું ટોચનું સ્થાન

માહે (સેશેલ્સ) : સેશેલ્સ નેશનલ ડે બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતીય બોક્સરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રણ ગોલ્ડ સહિત કુલ સાત મેડલ સાથે ટોચ પર રહ્યા હતા. ગોલ્ડ મેડલ ઉપરાંત ભારતીય બોક્સરોએ ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો જે પેરેડાઇઝ એરેનામાં મોરેશિયસ કરતા એક મેડલ વધુ રહ્યો હતો.

હિમાંશુ શર્મા (૫૦ કિગ્રા) એ વોકઓવર દ્વારા ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે આશિષ મુદશાનિયા (૫૫ કિગ્રા) એ ૪-૧ના વિભાજીત નિર્ણયથી ફાઇનલ જીતી હતી. ગૌરવ ચૌહાણે ૯૦ કિગ્રાથી વધુ વર્ગની તણાવપૂર્ણ ફાઇનલમાં પોતાનો સંયમ જાળવી રાખ્યો હતો. તેણે ૩-૨ થી જીત મેળવી અને દેશ માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અનમોલ (૬૦ કિગ્રા), આદિત્ય યાદવ (૬૫ કિગ્રા) અને નીરજ (૭૫ કિગ્રા) બધાને નજીકની લડાઈની ફાઇનલમાં સારું પ્રદર્શન કરવા છતાં ૨-૨ના સમાન વિભાજીત નિર્ણયોથી હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. કાર્તિક દલાલે ૭૦ કિગ્રા વર્ગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ■

મુંબઈની ટીમ છોડશે પૃથ્વી શો, મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસે માગ્યું એનઓસી

મુંબઈ: ભારતીય ટીમના બેટ્સમેન પૃથ્વી શો સ્થાનિક ટીમ મુંબઈ છોડવા માગે છે અને આ માટે તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યું છે. પૃથ્વીએ મંજૂરી માંગી છે જેથી તે ક્રિકેટર તરીકે પ્રગતિ અને વિકાસ માટે નવી સ્થાનિક ટીમ સાથે કરાર કરી શકે. પૃથ્વી છેલ્લા કેટલાક સમયથી રેડ બોલ ટીમમાંથી બહાર છે, પરંતુ તે વન ડે અને ટી૨૦ ક્રિકેટ રમી રહ્યો છે. જોકે, મેદાન પર તેના પ્રદર્શન કરતાં મેદાનની બહારના તેના શિસ્તના મુદ્દાઓ વધુ ચર્ચામાં રહ્યા છે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક વરિષ્ઠ અધિકારીએ સમાચાર એજન્સી પી.ટી.આઈ. ને આ વાતની પુષ્ટી કરી અને કહ્યું કે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પૃથ્વીનો પત્ર મળ્યો છે જેમાં તેણે એનઓસી માગ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૂત્રએ કહ્યું હતું કે,'હા, અમને પૃથ્વીનો પત્ર મળ્યો છે જે મંજૂરી માટે સર્વોચ્ચ પરિષદને મોકલવામાં આવ્યો છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.'

મુંબઈ ક્રિકેટ એસોસિએશનને મોકલેલા પત્રમાં પચીસ વર્ષીય ખેલાડીએ કહ્યું હતું કે તે મુંબઈ ટીમમાં વિતાવેલા સમય માટે આભારી છે પરંતુ હવે તે આગળ વધવા માંગે છે. તેણે ૨૦૧૭ માં મુંબઈ માટે ડેબ્યૂ કર્યું હતું.

પૃથ્વીએ કહ્યું હતું હું આ તકનો લાભ લઈને મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો આભાર માનું છું કે તેણે મને એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતી વખતે મૂલ્યવાન તકો અને અવિશ્વસનીય સમર્થન આપ્યું. મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો ભાગ બનવું એ એક મહાન સન્માન છે અને હું અહીં મેળવેલા અનુભવ માટે ખૂબ જ આભારી છું. મારી કારકિર્દીના આ તબક્કે મને બીજા રાજ્ય સંગઠન હેઠળ વ્યાવસાયિક ક્રિકેટ રમવાની એક સારી તક મળી છે જે મને લાગે છે કે ક્રિકેટર તરીકે મારા વિકાસ અને પ્રગતિમાં વધુ ફાળો આપશે. આને ધ્યાનમાં રાખીને હું તમને નમ્ર વિનંતી કરું છું કે મને એનઓસી જાહેર કરો જે મને આગામી સ્થાનિક સીઝનમાં નવા રાજ્ય સંગઠનનું સત્તાવાર રીતે પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બનાવશે.

પૃથ્વીએ કહ્યું હતું કે તેણે આ નિર્ણય કાળજીપૂર્વક વિચારણા અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન પ્રત્યે અત્યંત આદર સાથે લીધો છે. ભારત માટે પાંચ ટેસ્ટ અને છ વનડે રમનાર પૃથ્વીને ગયા વર્ષે નબળી ફિટનેસ અને શિસ્તના અભાવને કારણે મુંબઈ રણજી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. રણજી ટ્રોફીની બાકીની સીઝન ગુમાવ્યા બાદ પૃથ્વીએ છેલ્લે મુંબઈ માટે મધ્ય પ્રદેશ સામે પ્રીમિયર ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટ્રોફીની ફાઇનલમાં રમ્યો હતો, જેમાં તેની ટીમે પાંચ વિકેટથી જીત મેળવી હતી. ■

'લોકો કહેતા હતા કે આઠ મહિનામાં ખતમ થઇ જશે..', જસપ્રીત બુમરાહે ટીકાકારોને આપ્યો જવાબ

લીડ્સઃ ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહના ટીકાકારો માનતા હતા કે તેની વિચિત્ર બોલિંગ એક્શનને કારણે તે આઠથી દસ મહિનામાં ટોપ પરથી ક્યાંય ખોવાઇ જશે પરંતુ તેના આત્મવિશ્વાસને કારણે આ ભારતીય બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દાયકા જેટલો સમય પૂર્ણ કર્યો હતો. બુમરાહે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ૮૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ટેસ્ટ મેચમાં ૧૪મી વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધા પછી તેણે તેની સફળતાનું રહસ્ય જાહેર કર્યું હતું.

બુમરાહને પૂછવામાં આવ્યું કે શું તેને ઈજાગ્રસ્ત થયા પછી દર વખતે ખતમ માનવામાં આવે તો તેને ખોટું લાગે છે ત્યારે તેણે કહ્યું હતું કે ''લોકો વિચારતા હતા કે આટલાં વર્ષોમાં (હું ફક્ત) આઠ મહિના રમીશ, કેટલાક કહેતા હતા ૧૦ મહિના, પરંતુ હવે મેં ૧૦ વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ૧૨-૧૩ વર્ષ આઇપીએલ રમી છે.'' તેણે કહ્યું હતું કે, ''એટલે સુધી કે લોકો હજુ પણ (દરેક ઈજા પછી) કહે છે કે તે આગળ રમી શકશે નહીં. તેમને કહેવા દો, હું મારું કામ કરતો રહીશ. આ બાબતો દર ચાર મહિને આવતી રહેશે, પરંતુ જ્યાં સુધી ભગવાન મને આશીર્વાદ આપશે ત્યાં સુધી હું રમતો રહીશ.''

બુમરાહે કહ્યું હતું કે, ''હું શક્ય તેટલી શ્રેષ્ઠ

તૈયારી કરું છું અને પછી તે મારા પર કેટલા આશીર્વાદ વરસાવે છે તે ભગવાન પર છોડી દઉં છું.'' ઈંગ્લેન્ડને પહેલી ઇનિંગમાં લીડ લેતા અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર બુમરાહે કહ્યું હતું કે તે લોકોની ધારણા બદલવા માટે અહીં નથી. લોકો શું લખે છે તે મારા નિયંત્રણની બહાર છે અને હું લોકોને મારા વિશે શું લખવું તે સલાહ આપી શકતો નથી. જો તેઓ મારા વિશે લખીને વાચકો મેળવે છે, તો મને તેમાં કોઈ સમસ્યા નથી.''

મેચ અંગે બુમરાહે કહ્યું હતું કે પિચ બેટિંગ માટે સારી છે, પરંતુ મેચ આગળ વધશે તેમ તેમાં તિરાડ પડી શકે છે. હાલમાં આ વિકેટ બેટિંગ માટે ખૂબ સારી છે. હવામાનને કારણે નવો બોલ સ્વિંગ થશે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તમે આની અપેક્ષા રાખો છો. અમે મોટો સ્કોર કરવા અને તેમના માટે મુશ્કેલ લક્ષ્ય નક્કી કરવા માગીએ છીએ. ■

ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું છલકાયું દર્દઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ સદી ન ફટકારવાનું છે દુઃખ

કોલકાતાઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૮ સદી ફટકારી છે પરંતુ તેમને આ સંખ્યા પસંદ નથી અને તેમને તેમના ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણી સદી ચૂકી જવાનો અફસોસ છે. મહાન ડાબોડી બેટ્સમેન ગાંગુલીએ ટેસ્ટ અને વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૧૮૫૭૫ રન કર્યા હતા પરંતુ તેને તેની કારકિર્દીમાં ઘણી સદી ચૂકી જવાનો અફસોસ છે. તેમણે ૩૧૧ વન-ડે અને ૧૧૧ ટેસ્ટ મેચ રમી હતી. ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે જૂના ગાંગુલીને શું સલાહ આપવા માગે છે ત્યારે તેમણે આ અફસોસ વ્યક્ત કર્યો હતો.

ગાંગુલીએ પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ''હું ઘણી વખત સદી ફટકારવાનું ચૂકી ગયો હતો. મારે વધુ રન કરવા જોઈતા હતા. મેં ઘણી વખત ૯૦ અને ૮૦ રન કર્યા હતા.''

જો આપણે ગાંગુલીના આંકડા જોઈએ તો ખબર પડે છે કે તે ૩૦ વખત ૮૦ કે ૯૦ રનનો સ્કોર પાર કર્યા પછી આઉટ થયો હતો. જો તે આ ઇનિંગ્સને સદીમાં રૂપાંતરિત કરવામાં સફળ રહ્યો હોત તો તેના નામે ૫૦થી વધુ સદી હોત. જ્યારે ગાંગુલી એકલો હોય છે ત્યારે તેને તેની જૂની ઇનિંગ્સ જોવાનું ગમે છે. આ તેને યાદ અપાવે છે કે તે વધુ સદી ફટકારવાની કેટલી નજીક હતો.

તેમણે કહ્યું હતું કે, જ્યારે હું એકલો હોઉં છું ત્યારે હું મારા (બેટિંગ) વીડિયો જોઉં છું. જ્યારે મારી પત્ની ઘરે ન હોય કારણ કે સના લંડનમાં રહે છે. હું યુટ્યુબ પર જાઉં છું, અને જોઉં છું અને મારી જાતને કહું છું, ઓહ, હું ફરીથી ૭૦ રન પર આઉટ થયો. મારે સદી ફટકારવી જોઈતી હતી. પરંતુ હવે તમે તેને બદલી શકતા નથી.

ગાંગુલીએ વનડેમાં ૭૨ અડધી સદી અને ટેસ્ટ ક્રિકેટમાં ૩૫ અડધી સદી ફટકારી છે. કેપ્ટન તરીકે ક્યારેક મુશ્કેલ નિર્ણયો લેવા જરૂરી બની જાય છે. તમારે કોઈ ખેલાડીને પડતો મૂકવો પડે છે અને તે ખેલાડીને સામેલ કરવો પડે છે જેને તમે પરિસ્થિતિ અથવા ટીમની જરૂરિયાત અનુસાર વધુ સારો માનો છો. ગાંગુલીએ વિશ્વના મહાન લેગ સ્પિનરોમાંના એક અનિલ કુંબલેને ટીમમાંથી પડતો મૂકવા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે, ''અનિલ કુંબલેને ઘણી વખત તક મળી ન હતી કારણ કે તે ખૂબ જ સારો ખેલાડી હતો.'' ઓસ્ટ્રેલિયા ગાંગુલીની પ્રિય વિરોધી ટીમ છે અને તેના મતે ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર ગ્લેન મેકગ્રા સૌથી ખતરનાક બોલર છે. ■

મે ટીમમાં મારા સ્થાનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર નથી આપ્યું ધ્યાનઃ ઓલી પોપ

લીડ્સઃ ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારનાર ટોચના ક્રમના બેટ્સમેન ઓલી પોપે કહ્યું હતું કે ગયા વર્ષે ભારત સામે તેની ધરતી પર રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં નિષ્ફળતા બાદ ટીમમાં તેના સ્થાન અંગેની ચર્ચાઓને અવગણવાથી તેને વાપસી કરવામાં મદદ મળી હતી.

ઇંગ્લેન્ડના વાઇસ કેપ્ટન પોપે ગયા વર્ષે હૈદરાબાદમાં ભારત સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ૧૯૬ રન કરીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે પછી જસપ્રીત બુમરાહ અને ભારતીય સ્પિનરોએ તેની નબળાઈ છતી કરવામાં લાંબો સમય લીધો ન હતો. તે પછીની ચાર મેચમાં ફક્ત ૪૦ રન જ કરી શક્યો, જેના કારણે ટીમમાં તેના સ્થાન અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી.

ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ૧૦૬ રન કરનારા ઓલી પોપે ત્રીજા દિવસની રમતના અંત પછી પત્રકારોને જણાવ્યું હતું કે, ''મેં આ ચર્ચાઓનો મારા પર વધુ પ્રભાવ ન પડવા દેવાનો પ્રયાસ કર્યો છે.

હું ફક્ત એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું કે મારી રમત

શક્ય તેટલી સારી સ્થિતિમાં હોય અને જ્યારે હું બેટિંગ કરવા માટે બહાર આવું છું ત્યારે હું તકનો પૂરો લાભ લેવાનો પ્રયાસ કરું છું.

મેં બહાર ચાલી રહેલી ચર્ચાઓ પર ધ્યાન આપ્યું નથી અને માનસિક રીતે મારી જાતને મજબૂત કરવા અને મારી રમત સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.''

તેણે કહ્યું હતું કે, ''આ મારી રમતને થોડી સુધારવાનો પ્રયાસ છે. તે તે પ્રક્રિયા સાથે સંબંધિત છે જેનો હું આનંદ માણવા અને આગળ વધવા માગુ છું. હું રન કરવા માટે કોઈપણ પ્રકારની ઉતાવળ કરવા માગતો નથી. હું મારા ડિફેન્સને શક્ય તેટલું સારું રાખવાનો પ્રયાસ કરું છું.'' ■

આ સીઝનમાં મારું લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાનું છેઃ નીરજ ચોપરા

ઓસ્ટ્રાવા (ચેક રિપબ્લિક) : ભારતના ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા નિયમિતપણે ૯૦ મીટર ફેંકવા માટે પોતાના પર કોઈ દબાણ લાવવા માંગતો નથી અને આ સીઝન માટે તેનું લક્ષ્ય ટોક્યોમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટોચનું સ્થાન મેળવવાનું છે.

નિરજ ચોપરા મંગળવારે અહીં ગોલ્ડન સ્પાઇક એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેશે.

ચોપરાએ ગયા અઠવાડિયે ૮૮.૧૬ મીટરના થ્રો સાથે પેરિસ ડાયમંડ લીગ જીતી હતી, જેમાં તેણે જુલિયન વેબરને હરાવ્યો હતો. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતાએ કહ્યું હતુ કે કોચ તરીકે ચેક રિપબ્લિકના મહાન જાન ઝેલેઝનીના સમર્થન અને તેમની સખત મહેનતથી, તે સારા પરિણામો પ્રાપ્ત કરવાનો વિશ્વાસ ધરાવે છે.

૨૭ વર્ષીય ખેલાડીએ દોહામાં સીઝન-ઓપનિંગ ડાયમંડ લીગ સ્પર્ધામાં તેની કારકિર્દીમાં પ્રથમ વખત ૯૦ મીટરનું અંતર પાર કર્યું અને તે તેની પ્રગતિથી ખૂબ ખુશ છે.

તેણે કહ્યું હતુ કે,''આટલા મહાન ખેલાડી અને કોચ સાથે કામ કરીને હું ખરેખર ખુશ છું. ટેકનિકમાં થોડો વધુ સુધારો કર્યા પછી, મેં આ વર્ષે ભાલો ૯૦ મીટર ફેંકી દીધો છે. હવે જોવાનું એ છે કે, હું આ અંતર હવે પછી ક્યારે હાંસલ કરીશ, પણ હું તૈયાર છું. તાજેતરમાં અમે નિમ્બર્ક (ચેક રિપબ્લિક) માં સારી પ્રેક્ટિસ કરી હતી, તેથી મને વિશ્વાસ છે કે હું અહીં ઓસ્ટ્રાવામાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.''

હરિયાણાના આ ખેલાડીએ કહ્યું હતુ કે, ''આ સીઝનનો મુખ્ય ધ્યેય ચોક્કસપણે ટોક્યોમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ છે. '' આ વર્ષે ૧૩ થી ૨૧ સપ્ટેમ્બર

દરમિયાન જાપાનની રાજધાનીમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાશે. ચોપરા મંગળવારે અહીં યોજાનારી સ્પર્ધાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું હતુ કે, ''જ્યારે હું નાનો હતો ત્યારે મેં ઉસૈન બોલ્ટ જેવા ખેલાડીઓના અહીં ભાગ લેતા ઘણા વીડિયો અને ચિત્રો જોયા. હું ગયા વર્ષે અહીં આવ્યો હતો પરંતુ ઈજાને કારણે સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હતો.'' હું હવે સારું અનુભવી રહ્યો છું, પરંતુ હું ૯૦ મીટર માટે મારી જાત પર કોઈ દબાણ લાવવા માગતો નથી, પરંતુ હું તેના માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. ■

તન-મન-ધનથી રહો તરોતાજા

આપણું મન છે સૌથી મોટું જોખમ...

'આપણા નિર્ણયો પર નાણાકીય થિયરી કરતાં માનસિકતાની ઘણી અસર થતી હોય છે.'

- જોન આર. નોફસિંગર

ગૌરવ મશરૂવાળા
feedback@bombaysamachar.com

આ કોલમમાં આપણે રોકાણની સાથે સંકળાયેલાં વિભિન્ન પ્રકારનાં જોખમોની વાત કરી છે. તેમાંથી અમુક જોખમ વાસ્તવિક અને અમુક અગોચર હોય છે.

જેમાં નુકસાનની ગણતરી કરી શકાય એ વાસ્તવિક જોખમ અને જેમાં નુકસાનની ગણતરી કરવાનું મુશ્કેલ હોય એ અગોચર જોખમ. જેમાં આપણે નુકસાનની ગણતરી કરી શકતા નથી એમાંથી મોટાભાગના કિસ્સામાં આપણો દૃષ્ટિકોણ ઘણો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણે પોતાની લાગણીઓના આધારે જ્યારે કોઈ બાબતને જોખમ ગણી લઈએ અને તે પ્રમાણે વર્તીએ ત્યારે જ એ જોખમો વાસ્તવિકતા બની જાય છે.

વાસ્તવિક જોખમનું એક ઉદાહરણ લઈએ. માર્કેટ રિસ્કને આ પ્રકારનું જોખમ કહી શકાય છે. ધારો કે આપણે ૨૯,૦૦૦ રૂપિયાના ભાવે ગોલ્ડ બોન્ડ ખરીદ્યા છે. આપણે જ્યારે બોન્ડ વેચવા જઈએ ત્યારે ભાવ ઘટીને ૨૫,૦૦૦ થઈ ગયો હોય એ શક્ય છે. બોન્ડ વેચી નાખીએ તો નુકસાન થાય.

સોનાના ભાવ કેટલા ચાલી રહ્યા છે એ જાણવાનું ઘણું સહેલું છે. અનેક જગ્યાએ તે ઉપલબ્ધ હોય છે. આમ નુકસાનની ગણતરી કરવાનું શક્ય હોય છે.

આપણે પહેરેલાં ઘરેણાં વેચવાનાં ન હોય, પરંતુ તેને વેચવાનો અને નફો/નુકસાન થવાનો વિચાર કરીએ ત્યારે જે નફો/નુકસાન દેખાય એ અગોચર જોખમ કહેવાય. એ જોખમ ત્યારે જ વાસ્તવિક બને જ્યારે આપણે એ ઘરેણાં વેચવા માટે ખરેખર બજારમાં જઈએ.

હવે રિયલ એસ્ટેટનું ઉદાહરણ લઈએ. જે માણસ નિયમિતપણે રિયલ એસ્ટેટની ખરીદી અને વેચાણ કરતો હોય ત્યારે રિયલ એસ્ટેટમાં થતો ફેરફાર તેના માટે વાસ્તવિક જોખમ ઊભું કરે છે, પણ જો રહેવા માટેનું ઘર હોય અને તેને વેચવા કાઢ્યું ન હોવા છતાં આપણે તેના નુકસાન વિશે વિચાર કરીએ તો તે અગોચર જોખમ છે.

સામાન્ય રીતે આપણે ઘર, ઑફિસ, વેરહાઉસ જેવી મિલકતો ભાવની વધઘટને ધ્યાનમાં રાખીને ખરીદતા કે વેચતા નથી. આ બધી મિલકત આપણી જરૂરિયાત પ્રમાણે ખરીદવામાં કે વેચવામાં આવતી હોય છે. આ જ મિલકતો વેચવાની ન હોય, છતાં આપણે બજારમાં ચાલી રહેલા દરને ધ્યાનમાં રાખીને વેચાણનો વિચાર કરીએ ત્યારે તેમાં નફો કે નુકસાન દેખાઈ આવે છે. જો એ મિલકતો ખરેખર વેચી દેવામાં આવે તો ત્યારે થતો નફો કે નુકસાન વાસ્તવિક બની જાય છે.

પહેરવાનાં ઘરેણાં અને રહેવાના ઘરની વાત આવે ત્યારે આપણે માર્કેટમાં ચાલતા ભાવના આધારે નફા/નુકસાનનો વિચાર ભલે કરતાં હોઈએ, પણ તેના વિશે તરત જ પ્રતિક્રિયા કરતા નથી અને તેનું વેચાણ કરી દેતા નથી. આમ આ બન્ને ઍસેટ્સની બાબતે જોખમ જ્યાં સુધી આપણા મગજની અંદર હોય ત્યાં સુધી ઓછું નુકસાનકારક હોય છે. જો કે, નાણાકીય ઍસેટ, ખાસ કરીને ઈક્વિટીની વાત હોય ત્યારે આવું અગોચર જોખમ પણ ક્યારેક હાનિકારક બને છે.

ઈક્વિટીના રોકાણકાર (ખરું પૂછો તો સટ્ટો ખેલનારા) રમેશ મહેતા સવારે ઊઠીને સૌથી પહેલું કામ ટીવી ચાલુ કરીને બિઝનેસ ન્યૂઝ સાંભળવાનું કરે છે. પાછલા દિવસે (એટલે કે આગલી રાત્રે) યુરોપિયન અને અમેરિકન ઈક્વિટી માર્કેટ્સમાં શું થયું એ જાણવાની એમને ઇંતેજારી હોય છે. આ સમાચાર જાણી લીધા બાદ એમનું મગજ સક્રિય થઈ જાય છે. એ ક્યારેક ખુશખુશાલ થઈ જાય છે અને ક્યારેક ચિંતિત થઈ ઉઠે છે. એમના એક મિત્ર વેંકટ ઐયર પણ એવા જ છે. વિવિધ રાજકીય, આર્થિક તથા અન્ય ઘટનાઓના આધારે એ પોતે પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે અને પછી તેના આધારે રોકાણની (એટલે કે સટ્ટાની) સ્ટ્રેટેજી નક્કી કરે છે.

આ બન્ને મિત્રો સવારનો નાસ્તો કરતાં કરતાં પોતાપોતાના વિચારોનું અને માહિતીનું આદાનપ્રદાન કરતા હોય છે. આ સંપૂર્ણ પ્રવૃત્તિ એમના વિચારોના આધારે મનમાં ને મનમાં જ ચાલતી હોય છે. જોખમ એમના મગજમાં છે, અગોચર છે. આમ છતાં એ બન્ને તેના આધારે જ બજારમાં કામકાજ વિશેનો નિર્ણય લેતા હોય છે.

મીડિયામાં ચર્ચાતી વાતો કે આપણા પોતાના અર્થઘટનના આધારે જ્યારે આપણે પ્રતિક્રિયા કરીએ ત્યારે નફો કે નુકસાન આપણા મગજમાં જ હોય છે. તેના આધારે જ્યારે આપણે રોકાણ કરીએ ત્યારે તેમાં ભૂલ થવાની શક્યતા હોય છે. 'મનમાં પરણે અને મનમાં વિધવા થાય' એવી કહેવત અહીં લાગુ કરી શકાય છે. આપણું મન સૌથી મોટાં જોખમો પાછળનું મુખ્ય કારણ છે.

'વધુ જોખમ-વધુ વળતર' એવું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ખરી રીતે આપણે આપણા મનને એમ કહેતા હોઈએ છીએ કે જો વધારે જોખમ લઈશું તો વધારે વળતર મળશે. આવા વખતે આપણું મગજ 'વધારે વળતર મળશે' એ શબ્દો પર વધુ ભાર મૂકવા લાગે છે. વાસ્તવમાં, 'વધુ વળતર-વધુ જોખમ' એવું હોય છે. જે રોકાણોમાં વધુ વળતર મળતું હોય તેમને વધુ જોખમ પણ લાગુ થતું હોય છે.

ઉપસંહાર ....

રોકાણસંબંધી જોખમો – એક સિક્કાની બે બાજુ...

આર્થિક જગતના જાણીતા ફાયનાન્સર પ્લાનર ગૌરવ મશરૂવાળાની આ કોલમ લેખમાળામાં રોકાણને લગતાં અનેક પ્રકારનાં જોખમોની ચર્ચા કરી છે. આ વિશ્વમાં કોઈ રોકાણ સંપૂર્ણપણે જોખમમુક્ત નથી એવું અહીં સમજાવવામાં આવ્યું છે. જો કે, 'આપણે રોકાણ કરવું જ ન જોઈએ' એવો તેનો અર્થ કરાય નહીં એ પણ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ખરી રીતે તો લેખમાળામાં કહેવાયું છે કે રોકાણ ન કરવું એ પણ એક જાતનું જોખમ હોય છે.!

ટૂંકમાં, ગૌરવભાઈ આ લેખમાળા દ્વારા વાંચકોને વિવિધ પ્રકારનાં જોખમોનો પરિચય કરાવે છે, જેથી એ રોકાણને લગતા નિર્ણયો સાચી સમજ સાથે લઈ શકે. ■

ફાઈનાન્સના ફંડા
મિતાલી મહેતા
feedback@bombaysamachar.com

સંક કોસ્ટ ફેલસી એટલે શું?

આપણે આ કોલમમાં બિહેવિયરલ ફાઇનાન્સનો અભ્યાસ કરતાં અનેક પૂર્વગ્રહોની વાત કરી ચૂક્યા છીએ. આજે હવે સંક કોસ્ટ ફેલસીનો વારો છે.

આપણે જે ખર્ચ કે રોકાણ કરી ચૂક્યા હોઈએ અને એ પાછું મળવાની શક્યતા હોય નહીં એને 'સંક કોસ્ટ' કહે છે. 'ફેલસી 'એટલે ભ્રામક માન્યતા. ભવિષ્યમાં એ વસ્તુ ક્યારેય પાછી નહીં મળે એ હકીકત હોવા છતાં લોકો એવા ભ્રમમાં રહે કે એ પાછી મળશે ત્યારે એ 'સંક કોસ્ટ ફેલસી' કહેવાય છે. પોતે ખર્ચી કાઢેલાં નાણાં પાછાં નહીં મળે એ હકીકત જાણતાં હોવા છતાં નાણાં ડૂબી ગયાં હોવાનો સ્વીકાર કરવો નહીં એને સંક કોસ્ટ ફેલસી કહે છે. લોકો એને ભૂલે નહીં એ તો સમજ્યા, પણ પછી એ રકમ પાછી આવે એ માટે હાથ ધોઈને પાછળ પડી જાય છે. હકીકતમાં એ રકમ કે રોકાણ પાછું મેળવવાનો પ્રયત્ન-પ્રયાસ છોડી દેવાનું પોતાના હિતમાં હોવા છતાં લોકો એની પાછળ પડે છે પરિણામે વધુ ને વધુ નુકસાન થતું જાય છે.

પોતે ખર્ચી કાઢેલાં નાણાં અને સમય કોઈ પણ હિસાબે નિરર્થક જવાં જોઈએ નહીં એવી માન્યતા સંક કોસ્ટ ફેલસી પાછળનું કારણ હોય છે. ઉદાહરણ તરીકે, તમે ઘણી વાર સુધી લાઇનમાં ઊભા રહીને મોંઘા ભાવે કોઈ ફિલ્મની ટિકિટ લઈને આવ્યા અને એ ફિલ્મ જોવા ગયા. ફિલ્મ સાવ ફાલતુ હોવા છતાં પોતાનાં સમય, શક્તિ અને નાણાં ફાજલ જવાં જોઈએ નહીં એટલે આખેઆખી ફિલ્મ જોઈને વધુ સમય અને શક્તિ બગાડી નાખો છે.. સંક કોસ્ટ ફેલસીનું આ એક જ્વલંત ઉદાહરણ છે. શક્ય છે કે તમે ફિલ્મ અડધી મૂકીને ઘરે આવી જાઓ અને બચેલા સમયમાં સરસ મજાની ઊંઘ ખેંચી કાઢો અથવા તો અધૂરાં રહી ગયેલાં કામ પૂરાં કરી નાખો અથવા વધારાની કમાણી થાય એવી કોઈ પ્રવૃત્તિ કરી દો તો સમયનો સદુપયોગ થયો કહેવાય. પોતે પૈસા અને સમય ખર્ચી કાઢ્યાં છે તેથી કંટાળો આવવા છતાં ફિલ્મ જોઈ જ કાઢવી એવી વૃત્તિ એટલે સંક કોસ્ટ ફેલસી.

રોકાણની બાબતે પણ આવું જ થાય છે. તમે લિસ્ટિંગના દિવસે થનારી કમાણી માટે કોઈ આઇપીઓમાં નાણાં રોક્યાં. ધારો કે એ કંપનીના ઇસ્યૂને નબળો પ્રતિસાદ મળ્યો અને લિસ્ટિંગના દિવસે તેનો ભાવ વીસેક ટકા ઘટી ગયો. હવે સમગ્ર બજારમાં એવી ચર્ચા છે કે આ શેરનો ભાવ હજી ઘટશે અને અડધો થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. આમ છતાં, તમે આઇપીઓમાં રોકાણ કરી લીધું હોવાથી લિસ્ટિંગના દિવસે ગયેલી ખોટને ભૂલીને શેર વેચવાને બદલે એને રહેવા દો છો ને જતે દિવસે એ શેરના ભાવ અડધા થઈ જાય છે અને તમારી ખોટ વધી જાય છે. આમ બધા લોકો એ શેરના ભાવ ઘટવાની વાત કરી રહ્યા હતા ત્યારે તમે વાસ્તવિકતાને સ્વીકારવાને બદલે પોતાના ભ્રમમાં રહો છો કે ભાવ ચોક્કસ વધશે. અહીં તમે સંક કોસ્ટ ફેલસીનો શિકાર થઈ ગયા ગણાવ.

શક્ય છે કે તમે લિસ્ટિંગના દિવસે ગયેલી ખોટ સહન કરીને એ શેર વેચી નાખો અને એ જ નાણાંમાંથી બીજી કોઈ સારી કંપનીના શેર ખરીદી લો તો જતે દિવસે બીજી કંપનીના શેરમાં નફો થઈ શકે એવી પૂરતી શક્યતા હોઈ શકે. લોકો ઘણી વાર બહારથી મગાવેલું ખાવાનું ભાવ્યું ન હોય તો પણ ફક્ત પૈસા ખર્ચ્યા હોવાથી એ ખાવાનું પૂરું કરી દેતા હોય છે. સંક કોસ્ટ ફેલસીને લીધે આવું થાય છે. આ જ રીતે ક્યારેય પહેરવાનાં ન હોય એવાં કપડાં કબાટમાં ભરીને રાખવામાં આવે છે અને નબળાં રોકાણો પણ કાઢી મૂકવાને બદલે પોર્ટફોલિયોમાં રહેવા દેવાતાં હોય છે. પોતાની ઈચ્છા ન હોવા છતાં ફક્ત પૈસા અને સમયનો ખર્ચ થયો હોવાથી એને એળે જવા ન દેવાય એટલા ખાતર લોકો આવાં કામ કરતા રહે છે. બસ, આને જ કહેવાય સંક કોસ્ટ ફેલસી. ■

---

feedback@bombaysamachar.com
આરોગ્ય એક્સપ્રેસ
રાજેશ યાજ્ઞિક

મનને શાંત રાખવું છે?

આવાં યોગાસન બહુ ઉપયોગી છે...

હજુ ગત શનિવાર- ૨૧ જૂનના દિવસે વિશ્વભારમાં યોગ દિનની ઉજવણી થઈ...

આજે જગતભરના લોકો તબીબો -મનોચિકિત્સકો એક અવાજે સ્વીકારે છે કે યોગ માત્ર શારીરિક કસરત કે શારીરિક આરોગ્ય માટેનો વ્યાયામ નથી. યોગની મન-મસ્તિષ્ક પર પણ સકારાત્મક અસર થાય છે. આજના વ્યસ્ત જીવનમાં, આપણે બધા કોઈને કોઈ કારણસર તણાવમાં રહીએ છીએ. આખો દિવસ મનમાં ઉથલપાથલ રહે છે. મન અશાંત રહે છે અને વ્યક્તિ કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. આના કારણે, વ્યક્તિ અનિંદ્રા અને ચિંતાની ફરિયાદ કરવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે, તમારા શરીર અને મનને સંપૂર્ણપણે આરામ આપવો જરૂરી છે.

ચાલો, આજે જાણીએ એવા કેટલાક યોગાસન વિશે જે શરીરની સાથે મનને પણ આરામ આપે છે.

સેતુબંધાસન

આ આસનમાં શરીર પુલ જેવો આકાર બનાવે છે. તેથી એને સેતુબંધાસન કહે છે. આ આસન પીઠ અને પગને મજબૂત બનાવે છે, સાથે સાથે છાતી અને કરોડરજ્જુને પણ ખેંચે છે. તમારી કોર સ્ટ્રેન્થ પણ વધે છે. આ યોગાસન કરવા માટે, જમીન પર પીઠના બળે સૂઈ જાઓ. હવે તમારા ઘૂંટણ વાળો અને તળિયા જમીન પર રાખો.

પછી બંને હાથો વડે બંને પગની ઘૂંટી અથવા એડીને પકડો. શ્વાસ અંદર લેતા લેતા, ધીમે ધીમે તમારા શરીરને ઉપર ઉઠાવો. આ સ્થિતિમાં ૧ - ૨ મિનિટ સુધી રહો. (શ્વાસોચ્છવાસ ચાલુ રાખવો) આ પછી, શ્વાસ બહાર કાઢતા કાઢતા, શરૂઆતની સ્થિતિમાં પાછા આવો.

માર્જરી આસન

માર્જરી એટલે બિલાડી જેવી મુદ્રા. તમે કેટ વોક તો સાંભળ્યું હશે, પરંતુ એનું આસન પણ થાય છે! આ આસનમાં કરોડરજ્જુની હળવી ગતિ થાય છે. તેમાં બિલાડીની પીઠ ખેંચવાની નકલ કરવાની છે. તે કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધારવા અને એકંદર મુદ્રામાં સુધારો કરવા માટે જાણીતું છે. પહેલા વજ્રાસન મુદ્રામાં બેસવાથી શરૂઆત કરો.

ત્યારબાદ, બંને હાથોને ગોઠણથી દૂર એવી રીતે ટેકવો જેથી તમે હાથના ટેકે ગોઠણ ઉપર મધ્ય શરીરને ઊંચું કરી શકો. હવે જાંઘોને એવી રીતે ઊંચી કરો જેથી પગ સાથે ૯૦ ડિગ્રીનો કોણ બને. હાથ અને ગોઠણના ટેકા ઉપર માત્ર પીઠને બિલાડીની જેમ ઊંચી કરો. આમ કરતી વખતે શ્વાસ અંદર લો.

પછી શ્વાસ છોડતા છોડતા, ધીમે ધીમે, પીઠને નીચે વાળો અને જેટલું નીચે જઈ શકાય તેટલું જાઓ. આમ કરતી વખતે તમારું માથું આકાશ તરફ દૃષ્ટિ જાય તે રીતે ઉપર કરવું, જેવી રીતે બિલાડી કરે છે.

આ રીતે, ૪ થી ૫ વખત શ્વાસ અને ઉચ્છવાસ સાથે પીઠને આ મુદ્રામાં ઉપર-નીચે કરો. ધ્યાન રાખો કે તમે આ ધીમે ધીમે કરો. પછી ફરીથી શરીરને પહેલા પગ ઉપર ટેકવીને મૂળ સ્થિતિમાં આવો.



બાલાસન

નામ જણાવે છે તેમ, તેને બાળકોની મુદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસનનો ઉપયોગ તણાવ દૂર કરવા અને જાંઘ, કુલ્હા, પગની ઘૂંટીઓ અને પીઠને ધીમેથી ખેંચવા માટે થાય છે.

ઘૂંટણિયે પડવાની સ્થિતિમાં શરૂઆત કરો. ઘૂંટણ એકસાથે અથવા થોડા અલગ રાખીને તમારી એડી પર બેસો ઊંડો શ્વાસ લેતા બંને હાથ શરીરની રેખામાં સીધા ઉપર કરો.

પછી ઉચ્છવાસ કરતા કરતા શરીરને આગળની તરફ વાળો. તમારી છાતી તમારી જાંઘોને અને કપાળ જમીનને સ્પર્શ કરે. તમારા લંબાયેલા હાથ પણ જમીનને સ્પર્શ કરવા જોઈએ. હથેળીઓ જમીન તરફ અથવા આકાશ તરફ રાખી શકો છો. આ મુદ્રામાં ઊંડો શ્વાસ લો. શરીરમાં અનુભવતા ખેંચાણ તરફ ધ્યાન આપો. ૪ થી ૫ મિનિટ આ મુદ્રામાં રહીને ધીરે ધીરે શ્વાસ લેતા લેતા મૂળ સ્થિતમાં પાછા ફરો.

પશ્ચિમોત્તાનાસન

આ આસન શરીરના પાછળના ભાગ માટે એક શક્તિશાળી ખેંચાણ ઊભું કરે છે, જેમાં હેમસ્ટ્રિંગ્સ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. આ નામ 'પશ્ચિમ' (પશ્ચિમ અથવા પાછળનો ભાગ), 'ઉત્તાન' (તીવ્ર ખેંચાણ) અને આસન (મુદ્રા)ની સંધિ છે. આ આસન કરવા બંને પગ સીધા આગળ રાખીને બેસો. બંને એડી અને પગના અંગૂઠા એકસાથે હોવા જોઈએ. હવે શ્વાસ બહાર કાઢતા કાઢતા આગળ ઝૂકો અને બંને હાથ વડે બંને પગના અંગૂઠા પકડો. જો અંગુઠા ન પકડી શકાય તો જ્યાં સુધી હાથ પહોંચે ત્યાં પગને પકડો. તમારા કપાળને તમારા ઘૂંટણ પર સ્પર્શ કરો અને તમારી બંને કોણી જમીન પર સ્પર્શ કરાવો. ૧ થી ૨ મિનિટ સુધી આ મુદ્રામાં રહો. (શ્વાસોચ્છવાસ ચાલુ રાખો) પછી તમારી શરૂઆતની સ્થિતિમાં પાછા ફરો.

શવાસન

જેમ આ આસનનું નામ છે તેમ શબ (મડદાં)ની જેવી મુદ્રા અપનાવવાની છે. આ એક ખૂબ જ આરામદાયક આસન છે જેનો ઉપયોગ યોગ સત્રના અંતે શારીરિક અને માનસિક આરામ માટે કરવામાં આવે છે. માનસિક તણાવ કે થાક લાગ્યો હોય ત્યારે પણ તમે આ આસન કરી શકો છો. આ આસન કરવા ચત્તા સુઈ જાઓ. આંખો બંધ કરો. તમારા બંને પગ વચ્ચે થોડું અંતર રાખો અને તમારા બંને હાથ શરીરને સમાંતર રાખો. શ્વાસોચ્છવાસ ચાલુ રાખીને શરીરના પગથી શરૂ કરીને માથા સુધીના અંગો પર ધ્યાન લઇ જાઓ. દરેક અંગને શિથિલ કરો અને તેમાં થતી સંવેદનાઓ અનુભવો. આ આસન કરતી વખતે તમે ઓમકારના નાદ, અથવા કોઈ પણ હળવું ધ્યાનમાં ઉપયોગી થાય તેવું સંગીત ચાલુ રાખી શકો છો.

આ આસન થાક અને તણાવથી મુક્તિ આપે છે, હળવાશનો અનુભવ કરાવે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અપૂરતી ઊંઘ ધરાવતા લોકો માટે આ આસન ખૂબ ઉપયોગી છે.

તમારી શારીરિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કોઈપણ આસનો જેમાં પીઠ, કમર, પગ, હાથ કે ડોકની મુદ્રાઓ હોય, તેમાં તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. યોગાસનો કરતી વખતે ચહેરા પર હળવું સ્મિત રાખવાની સજાગતા કેળવશો તો આસનો મનને વધુ શાતા આપશે. ■

feedback@bombaysamachar.com
આહારથી આરોગ્ય સુધી
ડૉ. હર્ષા છાડવા

વ્યસન ન હોવા છતાં પણ વ્યસનને લગતી બીમારી થવાના કારણ...

વ્યસન સાથે માનવ જાણતાં કે અજાણતા રીતે જોડાયેલો છે. એટલે એવું કહી શકાય કે વ્યસન સાથેની માનવજાતની જુગલબંધી બહુ વર્ષો જૂની છે. વિવિધ વ્યસનોની માયાજાળમાં ફસાયેલો છે. વિવિધ વ્યસન જેવા કે દારૂ, તમાકુ, ગુટકા, બીડી, બજર, બહુ વ્યાપક રીતે પ્રસરાયેલા છે. અમૂલ્ય માનવ જીવન પોતે જ બરબાદ કરી રહ્યા છે. આ વ્યસનની અસરો કેવી થાય છે તે વ્યક્તિ ખબર છે છતાં પણ વ્યસન ચાલુ રાખે છે અને ગુમાન કરે છે કે મને કાંઈ નહીં થાય. વ્યસની વ્યક્તિ ને સમજાવા ઘણું મુશ્કેલીનું કામ છે. આ તો ખરાબ વસ્તુના સેવનથી બીમારીઓ થાય છે તે બધાને લગભગ ખબર છે.

મારે વાત કરવી છે કે વ્યસન વગર પણ વ્યક્તિઓ વ્યસન જેવી જ બીમારીઓથી પીડાય છે. રોજબરોજના ખાદ્યપદાર્થમાં તેમ જ બહારના ખાદ્યપદાર્થ ખાવાનું ચલણ ખૂબ જ મોટા પાયે વિકસી ગયું છે. તેમાં વપરાતા વ્યસની પદાર્થોને કારણે આજની યુવા પેઢી અને બાળકો વધુ બીમાર પડી રહ્યા છે. ઘરની ગૃહિણી કે કામકાજ કરતી સ્ત્રીને આજે રસોડું ગમતું નથી. તેથી બાહ્ય વસ્તુઓનું સેવન જે પ્રિઝર્વેટિવ અને રસાયણો કે ટકાવવાવાળા રસાયણો કેમિકલથી બનેલું છે. એને કારણે વ્યસનની વ્યક્તિને થતી બીમારીઓ અને તેનાથી પણ વધુ બીમારી થઈ રહી છે. સમયના અભાવના કારણે જે શારીરિક ધ્યાન રહેતું નથી. લોકો એક દબાણ હેઠળ રહે છે. તેથી બાહ્ય ખાદ્યપદાર્થનો વપરાશ ખૂબ જ વધી ગયો છે જે નુકસાનદાયક સાબિત થાય છે.

સવારની શરૂઆત કેમિકલ અને કેફેનીક વસ્તુઓથી થાય છે. જેમ કે ટૂથપેસ્ટ ઘણાં લોકો તંબાકુવાળી પેસ્ટનો વપરાશ કરે છે. અન્ય પેસ્ટો એ ફક્ત કેમિકલ જ છે. પેસ્ટમાં ફોર્માડીહાઇડ જે મચ્છર મારવાની અને લાશ સાચવવા માટે વપરાતું કેમિકલ છે. જેથી મોઢાની લાળ (સ્લાયવા) તે બગડી જાય કે એસિડિક થઈ જતાં ખાવાનું પણ એસિડિક બને છે.

કેફેન એટલે ચહા, કોફી લેવાથી એક પ્રકારનો નશો થાય છે. આ ચહા, કોફી પણ કેફેન જેવી જ અસર કરે છે. તેમાં વપરાતાં કેમિકલો ફરફયુરાલ, ટેનિન, ટેનિક એસિડ, ગ્રીસ ઑઈલ વગેરે જે નુકસાન આપે છે. બ્લડ પ્રેશર વધવા માંડે છે.

આઈસક્રીમ જેમાં આલ્કોહોલ અલગ અલગ પ્રિઝર્વેટિવ, કેમિકલવાળા રંગો તેમજ તેને ઘાટુ બનાવવા વપરાતા સોરબિટોલ જેવા રસાયણ ઘણી આઈસક્રીમોમાં ‘રમ’નો, ‘બિયર’નો વપરાશ થાય છે. જેથી શરીરમાં દુખાવા, શરદી, શરીરમાં ભારેપણું, એસિડિટી થાય છે. કોફીથી સાઈટિકા થાય છે. કેન્ડી, પીપર, ચોકલેટ જેમાં લગભગ દસથી પંદર જેવા કેમિકલોથી જ બને છે. જેવા કે સેકરીન, એસ્પારટેમ, સોડિયમ એલ્યુમિનિયમ ફોસ્ફટેન્ડ, પોટેશિયમ સોરબેટ, ટિટેનિયમ ડાયઓક્સાઈડ, બ્યુટીરેટ હાઈડ્રોસી સોલ, હાઈડ્રોજનેટ તેલ, ઈમ્લીસિફાયર, ટ્રારટેઝાઈન અને રોહડમાઈન-બી જેવા કલરથી બને છે. રોહડમાઈન-બી (Rhodamin-B) પીંક કલર છે જે બધે બેન્ડ છે. છતાં આપણે ત્યાં વપરાય છે. કર્ણાટક રાજ્યમાં આ પિન્ક કલર પર બેન્ડ છે. આ કેન્સર કારક તત્ત્વ છે જે કોટન કેન્ડી અને મંન્ચુરિયન બનાવવા વપરાય છે. આ કેન્ડી, પીપર ચોકલેટનું વ્યસન આપણી માટે ઘાતક છે. નાની કેન્ડી કે પીપર લોકો ખૂબ જ ખાતાં હોય છે. જેથી બાળકોના મગજ પર અસર થાય છે. આંખ ખરાબ થઈ જાય છે.

ટીન ડબ્બામાં આવતા ડ્રીંકમાં પણ આલ્કોહોલ ઉમેરવામાં આવે છે. જેના કારણે ફેટીલિવર અને રક્તકણની ખરાબી કે સફેદ કણ (ડબ્લ્યૂબીસી)માં ખરાબી થાય છે. પેટ ફૂલવા લાગે છે. બીજા અન્ય ડબ્બા પેક વસ્તુઓમાં પણ આલ્કોહોલ અને કેમિકલ માત્રા ઉમેરવામાં આવે છે.

એસેન્સ જેમાં વેનિલા ખૂબ જ પ્રચલિત છે તે ડામરથી બનાવવામાં આવે છે. લિક્વિડ એસેન્સમાં પણ આલ્કોહોલ સાચવવા માટે વપરાય છે. વેનીલા એસેન્સ એક પ્રાણીમાંથી (તેની રેકટમ)માંથી બનાવવામાં આવે છે. જેમાં ગેસટ્રિકની બીમારી થાય છે.

ગ્રેવીવાળા શાકમાં ઘાતક રંગો અને સાચવવા માટે કેમિકલો ઉમેરવામાં આવે છે. ગ્રેવીને સાત દિવસની સાથે જ બનાવી રાખે છે. તેમાં રસાયણો નાખી ટકાવવામાં આવે છે. જેનાથી ફૂડ પોઈઝન, એસિડીટી, ઝાડા ઊલટીની સમસ્યાઓ થાય છે.

પેકેટમાં મળતાં બધા જ ખાદ્યપદાર્થમાં લગભગ કેમિકલ અને આલ્કોહોલ હોય જ છે. લેબલ વાચીને તેનો ઉપયોગ કરવો જેથી બચાવ થઈ શકે.

આ બધા ખાદ્યપદાર્થ તેમ જ અન્ય ખાદ્યપદાર્થની એક આદત બંધાણ, આસક્તિ, ટેવ, લત, બંધન જે કર્યા વિના રહેવાય જ નહીં. જે સ્વભાવ સાથે જડાઈ ગયું છે. માનવીએ દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો. આ વ્યસનોની દુનિયામાં પણ જબરો વિકાસ અને વિવિધતા ફાલીફૂલી છે. થોડીવાર લહેજત આપે પણ લાંબે ગાળે શારીરિક, માનસિક વ્યાધિઓ પાછળ પડે છે. આની માટે દવાઓ પણ કેમિકલો અને આલ્કોહોલથી જ બને છે. એટલે માનવનો વિકાસ માનવને જ નડી રહ્યો છે.

વધુમાં વધુ પ્રાકૃતિક સંશાધન કેમ વધારવા તેના પર ધ્યાન આપવું જરૂરી છે. પૈસા કમાવાની દોડ, પ્રતિષ્ઠા કમાવવાની દોડ એ માનવ જ માનવને મારે છે. માનવ પ્રાકૃતિક સંશાધન માટે મહેનત કરી રહ્યો છે તે પણ બહુ સીમિત છે. લોકોને પ્રાકૃતિક સંશાધન જોઈએ પણ તેના માટે મહેનત નથી કરવી. બધું બહુ સરળતાથી મળી રહે તેવું જોઈએ પણ મહેનત વગર આ બધું શક્ય નથી.

લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકાર તો છે પણ આચરણમાં આવતું નથી. જોઈને કે સાંભળીને ફક્ત બૂમો પાડે છે. આ ખાદ્યપદાર્થનાં વ્યસનો બીજા વ્યસનોથી પણ બહુ ઘાતક છે. યુવાપેઢીને મજબૂત અને સ્વસ્થ રહેવું હશે તો પ્રાકૃતિક સંશાધનના વિકાસ તરફ ખૂબ જ મહેનત કરવી પડશે. સમજણ વધારવી પડશે, ઘરમાં બનતી વાનગીઓમાં સુધાર કરવો જ પડશે. ■

feedback@bombaysamachar.com
મોજની ખોજ
સુભાષ ઠાકર

સ્મશાનમાં મરેલાને બળતા જોયા, પણ અહીં તો બળીને મરતા જોયા...

હે ઈશ્વર...

તારા નામની આગળ પ્રિય, વ્હાલા, કે પૂજ્યનું સંબોધન નથી કર્યું એટલે તારા હૈયાને ઠેસ લાગશે, કારણ કે તું આવાં સંબોધનોથી જ ટેવાયેલો છે. તને પથ્થરમાંથી ઈશ્વર થવાનો ને મંદિરમાં બેસી પૂજાવાનો શોખ, પણ સોરી ટુ સે કે મારે તારી સાથે સંબંધનું બંધન તોડવું છે. કેમ? એ આ પત્રના અંતે ખબર પડશે.

પ્રભુ, હમણાં બન્યું એવું કે હું બેઠેલો ને અચાનક મારા શરીરમાં ઝણઝણાટી ઊપડી, શરીર થરથર ધ્રૂજયું દસ સેકંડમાં તો એક લિટર પરસેવો વળ્યો ને હું આખો વાઇબ્રેટર મોડ પર આવી ગયો, હું ગભરાયો ત્યાં તો ચંપાએ હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો ને ભડકી ‘તમને હજારો વાર સમજાવ્યા કે સાઇકલ ચલાવતા આવડતું નથી ને કઇ કમાણી પર મોબાઈલ વિમાન મોડ પર...’

‘અરે, ફ્લાઇટ મોડ પર રાખવાથી મારી જાતને અંબાણીથી વધુ ધનવાન જેવું લાગે. સમજી?’ મેં કીધું

‘અરે નથી સમજવું. જોયું નઇ, હમણાં હવાઇ-ભારત વિમાનમાં ૩૦૦થી વધુ પેસેન્જરો રાખમાં પલટાઈ ગયા’ચંપા બોલી.

‘હવાઇ-ભારત?’ હું ચમક્યો.

‘અરે ‘હવાઇ-ભારત’ એટલે ‘એર-ઈન્ડિયા’ હું ગુજરાતી છું ને ગુજરાતીમાં એને ‘હવાઇ-ભારત’ કહેવાયને!. હવે જો મોબાઈલ વિમાન મોડ પર રાખ્યો તો મોબાઈલ ને તમે બંને ફાટી જશો ને તમારું એકેય અંગ શોધ્યું નઇ જડે..’

‘બોલ, પ્રભુ, હવે બોલ્ડ થઈને કઉં તો કોઈ ગીતકારે એક ગીતમાં ‘ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ’ એવું લખ્યું. હવે એ ગીતકાર જો હાથમાં આવે તો ડોકી મરડી નાખું, આટલું ખોટું લખાય? એ ટોપાને ખબર જ નથી કે તારા ઘરમાં દેર નઇ, અંધેર પણ છે. કાળું ડીબાંગ અંધેર.

નઇતર આ ગંદા રાજકારણીઓ, સત્તાના નશામાં ડૂબેલા નેતાઓ, પ્રજાને છેતરનારા વેપારીઓ, ખંડણી ઉઘરાવનારાખલનાયકો. કેટલા ગણાવવા? બધા સાપનો ભારો બનીને ફરે છે ને પેલા ફ્લાઇટમાં ૩૦૦થી વધુ નિર્દોષનો તું પળવારમાં ધુમાડો કરી નાખે, એ પછી પણ મરવાની સિઝન આવી હોય એમ ટપોટપ ટપકે જ રાખે છે. રોજ પેપર ખોલો ખબર પડે કે આટલા ટપક્યા કોઈ પૂરમાં તો કોઈ યુદ્ધમાં. સાચું કહેજે તું હોલસેલમાં લાશનો ધંધો કરવા નીકળ્યો છે? લંડન જતાં બધા મુસાફરોની ટિકિટ પર લખેલું ‘હેપી જર્ની’.. તો શું તું આને ‘હેપી’ કહે છે? આઈ નો કે તારા શરણમાં કોઈ આવે એ તને ગમે પણ આવા અકસ્માતો કરી તારાથી અચાનક ખેંચી ન લેવાય. કબૂલ કે સર્જન તું કરે એટલે વિસર્જનનો અધિકાર તારો જ હોય પણ અમારા જન્મની ખબર નવ મહિના પહેલાં આપે છે ને મરણની તો નવ સેકન્ડ પહેલાં પણ નથી આપતો.

મારી વાત સમજાય છે? પ્લેન અકસ્માતથી ડઘાયેલા મારા લંડનવાળા કાકા તો એવા જિદે ચડ્યા ને બોલ્યા ‘ભાઈ

સુભાષ હું બસમાં, રિક્ષામાં, ટ્રેનમાં કે લંડન ચાલતો જઈશ, ભલે દસ વર્ષે પહોંચું પણ વિમાનમાં તો નઇ નઇ ને નઇજ’ આખી જિંદગી મજૂરી કરી કેવડી મોટી સંબંધોની મૂડી બનાવી ને ૩૦ સેકન્ડમાં તો તે રાખમાં રોળી નાખી.

બચવા માટે પ્લેનમાં મુસાફરોએ કેટલી રોકકળ અને ચિચિયારીઓ પાડી હશે, પણ તું તો માણસ જેટલો પણ

દયાળુ ન નીકળ્યો. લોકો ભલે તને મસ્કા મારી દયાનો સાગર કહેતા હોય પણ સાચું કહું તો તું દયાનું ખાબોચિયું

પણ નથી. ... તું નિર્દય છે. અરે, અમે કદાચ તારામાં વધતું ઓછું માનીએ તો તું અમારમાં થોડુંક માન. હું તો કહું છું થોડો વખત તો દરબાર વિખેરીને તારા ઘરબાર છોડીને અમારી જોડે આવીજા. છે તાકાત? બહુ અઘરું છે. ભલે ઈશ્વર હોય પણ એકવાર આવી રીતે મરી તો જો. આ અકસ્માતમાં એક મુસાફર વિશ્વાસકુમાર રમેશ બચી ગયો તો એના માટે કોઈ બોલ્યું ‘રામ રાખે એને કોણ ચાખે’ પણ ટોપા, રામ ‘જેને રામે રાખ્યા જ નથી એને કોણ ચાખશે? તને ગમ્યું એ ખરું પણ તને ગમે એ બધુ ખરું નથી હોતુ....જો આખી વાત સમજાવું. તમારા ભગવાનોમાં એકવાર રામને પાણીની તરસ લાગી ને લક્ષ્મણે કીધું ‘તમે તો જમીનમાં એક તીર મારો તો પાણી નીકળે. રામે સનનન કરતું છોડ્યુ તીર જમીનમાં ને ઊડ્યો ફુવારો, પણ લાલ રંગનો. જ્યારે તીર કાઢ્યું તો તીર કોઈ દેડકાને લાગેલુ.

રામે પૂછ્યું ‘અલ્યા દેડકા,આ આખુ તીર તારી આરપાર નીકળી ગયુ લોહી નીકળ્યું ને તું એકદમ ચૂપ, જરાય ચું કે ચા નઇ?’ દેડકો બોલ્યો ‘પ્રભુ હું શું ચીસ પાડું કોઈ મને મારે તો બચાવ માટે ‘હે રામ, અમને બચાવો’ એવો પોકાર પાડીએ પણ રામ જ જો તીર મારે તો અમારે કોને ફરિયાદ કરવી? જબ સાવન હી આગ લગાએ તો ઉસે કોન બુઝાએ....’

પ્રભુ, હવે સરકાર પેલા પેસેન્જરમાંથી લાશ બની ગયેલા પરિવારને એક બે કરોડના ટુકડા ફેંકી મનાવી લેશે? શું આ જ કિંમત છે તારા ઉછીના આપેલા આ દેહની? તારો આપેલો દેહ એટલે તું માલિક ખરો પણ અમે જો મંદિર કે દેરાસરમાં તને રાખીએ તો અમે તારા માલિક ખરા કે નઇ? જવા દે ....વધુ લખીશ તો આપણા સંબંધોની વાટ લાગી જશે. અમે સ્મશાનમાં મરેલાને બળતા જોયા છે પણ વિમાનમાં તો બળીને મરતા જોયા. આ તારો બનાવ નથી પણ અમારી સાથેની બનાવટ છે. ઈશ્વર આવો ન હોય ને હોય તો અમારો તો ન જ હોય. બીજું તો શું કઉં હવે જે મૃતકો ‘તારે શરણે આવ્યો છું સ્વીકારી લે એવું ગાય તો તું સ્વીકાર નઇ સત્કાર કરજે. સમજ્યો? એમાં જ તારી શોભા છે.

હવે ખબર પડી કે તને પ્રિય, વ્હાલા કે પૂજ્યનું સંબોધન કેમ નથી કર્યું? શું કહો છો? ■

feedback@bombaysamachar.com
તંદુરસ્તી-મનદુરસ્તી
ભાણદેવ

યોગાસનના અભ્યાસને અંતે સ્ફૂર્તિ ને આરામ અનુભવાય છે

(ગતાંકથી ચાલુ)

૬. યોગાસન અને પ્રચલિત વ્યાયામ પદ્ધતિની તુલનાઃ

ખરેખર તો યોગાસનના અભ્યાસને પ્રચલિત વ્યાયામપદ્ધતિ સાથે સરખાવવો જોઈએ નહિ, કારણ કે યોગાસન કોઈ વ્યાયામપદ્ધતિ નથી.

આમ છતાં બંનેમાં અધિષ્ઠાન શરીર છે અને યોગાસનનો અભ્યાસ શારીરિક કેળવણી માટે પણ વ્યાપક પ્રમાણમાં થાય છે. શરીરને કેળવવા માટે યોગાસનોનો અભ્યાસ ઉપયોગી થઈ શકે તેમ છે. વળી યોગાસન એક વ્યાયામપદ્ધતિ છે, તેવી ગેરસમજ પણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી છે.

પરિસ્થિતિ આવી છે, ત્યારે આ બંનેની તુલના આપણને યોગાસનના સ્વરૂપને સમજવામાં અને તદ્‌વિષયક ગેરસમજનું નિરાકરણ કરવામાં ઉપયોગી થઈ શકશે.

(૧) પ્રચલિત વ્યાયામપદ્ધતિમાં શરીરનાં અંગોનું ઝડપી હલનચલન (Movement) કરવામાં આવે છે. દંડ, બેઠક, દોડવું, તરવું, ચાલવું, રમતો આદિ વ્યાયામોનાં સ્વરૂપ પરથી આ બાબત સ્પષ્ટ સમજી શકાય છે. યોગાસન હલનચલન નથી, પરંતુ શરીરની વિશિષ્ટ અવસ્થા છે.

હા, શરીરને વિશિષ્ટ અવસ્થામાં મૂકવા માટે હલનચલન તો કરવું જ પડશે, પરંતુ તે યોગાસનનો ગૌણ ભાગ છે, જ્યારે પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં તો તે જ પ્રધાન છે.

યોગાસન ધારણ કરવા માટે શરીરનું જે હલનચલન થાય છે, તે ખૂબ ધીમી ગતિએ થાય છે, જ્યારે વ્યાયામપદ્ધતિમાં હલનચલન (Movement) ઝડપી હોય છે.

(૨) બંનેનાં સ્વરૂપમાં ઉપર્યુક્ત મૂળભૂત તફાવત હોવાથી પ્રચલિત વ્યાયામની તુલનામાં યોગાસનના અભ્યાસ વખતે થતો શક્તિવ્યય (Energy expenditure) નજીવો હોય છે. પ્રચલિત વ્યાયામપદ્ધતિમાં શક્તિવ્યય દર મિનિટે ૨ થી ૧૪ કેલરી હોય છે. યોગાસનમાં આ પ્રમાણ ૦.૮થી ૩ કેલરી હોય છે.

આમ હોવાથી પ્રચલિત વ્યાયામને અંતે થાક અનુભવાય છે, જ્યારે યોગાસનના અભ્યાસને અંતે સ્ફૂર્તિ અને આરામ અનુભવાય છે.

(૩) પ્રચલિત વ્યાયામપદ્ધતિનો હેતુ શારીરિક બળ, સ્વાસ્થ્ય, વિકાસ અને કૌશલ પૂરતો મર્યાદિત છે, જ્યારે યોગાસનનો હેતુ આધ્યાત્મિક વિકાસ છે. યોગાસનના અભ્યાસથી શરીર-મનના સ્વાસ્થ્યની પ્રાપ્તિ તો થાય જ છે, પરંતુ તે તો આડપેદાશ છે, તેમ સમજવું જોઈએ.

(૪) માત્ર શારીરિક રીતે વિચારીએ તોપણ પ્રચલિત વ્યાયામપદ્ધતિ સ્નાયુતંત્રને કેન્દ્રમાં રાખીને ગોઠવાયેલ છે. યોગાસનો જ્ઞાનતંત્ર, અંતસ્ત્રાવી તંત્ર અને પાચનતંત્ર પર કાર્ય કરે છે. યોગાસનો આ ત્રણે તંત્રો પર અસર પહોંચાડી તેમના દ્વારા સમગ્ર શરીર પર અસર પહોંચાડે છે. આમ યોગાસનો આરોગ્યના કેન્દ્ર દ્વારા પરિઘને પકડે છે, જ્યારે પ્રચલિત વ્યાયામ પદ્ધતિ પરિઘ દ્વારા કેન્દ્રને પકડે છે.

(૫) યોગાસનોનો અભ્યાસ મનોયોગપૂર્વક થવો જોઈએ. યોગાસન મનોશારીરિક અવસ્થા છે. પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં આવી કોઈ અપેક્ષા નથી. પ્રચલિત વ્યાયામપદ્ધતિમાં મનની ગતિ અંદરથી બહાર વળે છે. યોગાસનમાં મન અંદર વળે છે.

(૬) સમગ્ર યોગાભ્યાસ માટે આદેશ છે - कुर्यात् अध्यात्म चेतसा । આ આદેશ યોગાસનને પણ લાગુ પડે જ છે. પ્રચલિત વ્યાયામ પદ્ધતિ अध्यात्म चेतसा । નહિ, શારીરિક દૃષ્ટિકોણથી થાય છે.

(૭) યોગાસનોનો અભ્યાસ કરનાર સાધક યમ-નિયમપૂર્વક જીવન જીવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં એવી કોઈ અપેક્ષા કે શરત નથી.

(૮) યોગાસન સમગ્ર યોગસાધનાનો એક નાનકડો ભાગ છે, તે સાંકળનો એક મંકોડો છે. પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં એવું અનુસંધાન નથી.

(૯) પ્રચલિત વ્યાયામ પદ્ધતિમાં સંવેગોની કેળવણી, મનની સ્થિરતા અને મનની શુદ્ધિ તરફ દૃષ્ટિ નથી. યોગાસનના અભ્યાસ દ્વારા આ હેતુ પણ સિદ્ધ થાય તેવી અપેક્ષા અને શક્યતા છે.

૭. યોગાસનના અભ્યાસથી શું થાય છે?

પ્રથમ દૃષ્ટિએ સાવ સરળ અને સાવ બહિરંગ લાગતો આ અભ્યાસ માનવના વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન પાસાઓ પર ઊંડી અને દૂરગામી અસર પાડે છે. હવે આપણે જોઈએ કે યોગાસનના અભ્યાસ દ્વારા વ્યક્તિત્વનાં ભિન્ન ભિન્ન પાસાઓ પર કેવી અસર પડે છે અને આ અસર કઈ રીતે થાય છેઃ

(अ) શારીરિક દૃષ્ટિએઃ

શારીરિક દૃષ્ટિએ આપણે પ્રારંભમાં જ જોયું છે કે યોગાસનો વ્યાયામ પદ્ધતિ કે ચિકિત્સા પદ્ધતિ નથી. વળી એ સ્પષ્ટ છે કે યોગાસનો જેનો નાનકડો ભાગ છે, તે યોગ મૂલતઃ અધ્યાત્મવિદ્યા છે. હા, આ વાત સાચી જ છે, પરંતુ એનો અર્થ એમ નથી જ કે યોગમાં શરીરનો વિચાર જ નથી. સાચી વાત તો એ છે કે અન્ય કોઈ પણ સાધનપદ્ધતિ કરતાં યોગમાં શરીરનો વિશેષ વિચાર કરવામાં આવ્યો છે.

હવે આપણે જોઈએ કે શરીરનાં સ્વાસ્થ્ય, દૃઢતા, કાર્યક્ષમતા આદિ માટે યોગાસન કેટલે અંશે અને કઈ રીતે ઉપયોગી થાય છે.

શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ચાર બાબતો આવશ્યક છેઃ

(૧) જ્ઞાનતંત્ર તંદુરસ્ત અને કાર્યક્ષમ હોય.

(૨) અંતઃસ્ત્રાવી તંત્ર શરીરને આવશ્યક સ્ત્રાવો નિયમિત અને પ્રમાણસર પૂરા પાડે.

(૩) શરીરના બધા જ જીવકોશોને આવશ્યક પોષક તત્ત્વો નિયમિત અને પ્રમાણસર મળ્યાં કરે. એટલે કે પાચનતંત્ર અને રુધિરાભિસરણતંત્ર સ્વસ્થ હોય.

(૪) શરીરના મળોનો નિયમિત અને નિઃશેષ ઉત્સર્ગ થાય, તે માટે આવશ્યક છે કે ઉત્સર્ગતંત્ર સ્વસ્થ હોય.

હવે આપણે જોઈએ કે યોગાસનના અભ્યાસથી આ કાર્ય સિદ્ધ થઈ શકે છે કે કેમ?

(૧) શીર્ષાસન, વિપરીતકરણી, સર્વાંગાસન વગેરે યોગાસનો મગજને વધુ લોહી પૂરું પાડે છે. તેમ કરીને આ આસનો મગજ અને તેમાં નીકળતા જ્ઞાનતંતુઓને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે. ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, હલાસન, ચક્રાસન, સર્વાંગાસન, વિપરીતકરણી વગેરે અને બીજાં સંખ્યાબંધ યોગાસનો છે જે કરોડરજ્જુના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી પુરવાર થયાં છે. યોગમાં ભાગ્યે જ એવાં કોઈ યોગાસનો હશે, જે કોઈ ને કોઈ રીતે શરીરમાં વ્યાપ્ત જ્ઞાનતંતુઓના સ્વાસ્થ્ય માટે ઉપયોગી ન હોય.

મગજ, કરોડરજજુ અને જ્ઞાનતંતુઓનાં સ્વાસ્થ્ય માટે યોગાસનો અન્ય કોઈ પણ વ્યાયામ પદ્ધતિથી ઓછાં ઊતરે તેમ નથી, બલકે સૌથી ચડિયાતાં સિદ્ધ થઈ શકે તેમ છે.

(૨) અનુભવ, પ્રયોગો અને યોગાસન વખતે થતી શારીરિક ક્રિયાઓના અભ્યાસથી સિદ્ધ થયું છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે યોગાસનોનો નિયમિત અભ્યાસ અપ્રતિમ છે.

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની રાણી સમી પિચ્યુટરી અને પિનિયલ ગ્રંથિને સ્વસ્થ રાખવા માટે શીર્ષાસન સર્વોત્કૃષ્ટ છે. થાઈરોઈડ અને પેરાથાઈરોઈડના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા માટે સર્વાંગાસન, વિપરીતકરણી અને મત્સ્યાસન ખૂબ જ લાભપ્રદ છે. ■

feedback@bombaysamachar.com
સ્વાસ્થ્ય સુધા
શ્રીલેખા યાજ્ઞિક

કાચાં કેળાં આરોગ્ય માટે ગુણકારી

શું આપને કેળાં પસંદ છે? મોટાભાગે જવાબ 'હા'માં જ હશે. ગરીબોનું મનગમતું તેમજ પરવડતું ફળ એટલે કેળાં. શરીરને બળવાન બનાવવાની સાથે પાચનક્રિયાને સુધારવામાં કેળા સૌથી મોખરે ગણાય છે. બારે-માસ મળતું ફળ એટલે કેળા. પાકા કેળાં તો બધાને પસંદ હોય જ છે. વળી તેનો ઉપયોગ પ્રતિદિન કરવામાં આવતો જ હોય છે. પરંતુ શું આપને ખ્યાલ છે કે પાકા કેળાં જેટલાં જ આરોગ્યવર્ધક ગુણો કાચાં કેળામાં સમાયેલાં છે. સામાન્ય રીતે સફેદ કે પીળી કેળાંની વેફર મુંબઈની લોકલ ટ્રેન હોય કે શાળાનો લંચબોકસ ઝટપટ ખવાતી હોય છે. આજે આપણે વેફર જે કેળામાંથી તૈયાર થાય છે તે કાચાં કેળાના લાભ વિશે જાણકારી મેળવીશું. સફેદ મરીવાળી વેફર લીલા કાચાં કેળામાંથી તૈયાર થાય છે. જ્યારે પીળી વેફર માટે ખાસ અલગ લાંબા કાચાં કેળા બજારમાં મળે છે. પાકા કેળા માટે એવું કહેવાય છે કે તેનો અતિ ઉપયોગ વજન વધારે છે. જ્યારે કાચાં કેળાનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. ડાયાબિટીસ કે અતિસારની સમસ્યામાં કાચાં કેળા ગુણકારી ગણાય છે.

કાચાં કેળામાં અનેક ચમત્કારીક ગુણો સમાયેલાં છે. તેથી જ કાચાં કેળાને સ્વાસ્થ્યનો ખજાનો ધરાવતું ફળ કહેવામાં આવે છે. કાચાં કેળામાં ફાઈબર, વિટામિન સી, વિટામિન બી-૬, વિટામિન એ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક જેવાં પોષક તત્ત્વો સમાયેલાં છે.

ચાલો જાણકારી મેળવી લઈએ કાચાં કેળામાં સમાયેલાં ગુણોની

વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી : ચોમાસું શરૂ થાય તેની સાથે શાકભાજીમાં અનેક વખત નાની અમથી ઈયળો દેખાતી હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે. તેથી જ જૈન સંપ્રદાયમાં ચતુર્માસમાં લીલોતરી તેમજ વરસાદ બાદ કેરીનું સેવન કરવામાં આવતું નથી. જાણ્યે-અજાણ્યે જીવ હત્યાની ગ્લાનિ વ્યક્તિને સતાવે નહીં તે હેતુથી જ. કાચાં કેળામાં ડાયેટરી ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. જેથી કાચાં કેળાનું શાક કે તેની પેટીસ કે કટલેટ ઓછા તેલમાં બનાવીને ખાવ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વારંવાર ખાતા રહેવાની આદત ધીમે ધીમે છૂટી જાય છે. જે ધીમે ધીમે વજનને ઘટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીસમાં ગુણકારી : સામાન્ય રીતે ડાયાબિટીસની વ્યાધિમાં પાકા કેળા ખાવાની મનાઈ કરવામાં આવે છે. કાચાં કેળાનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ૩૦થી પણ ઓછો છે. એવું કહેવાય છે કે જે ચીજોનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ૫૦થી નીચે હોય તે સરળતાથી પચી જાય છે. જેથી તેના સેવન બાદ ઈન્સ્યુલિન હાર્મોન ધીમે ધીમે રિલીઝ થાય છે. કાચાં કેળામાં ઍન્ટિ-ડાયાબિટીક ગુણો સમાયેલાં હોય છે. જેથી કાચાં કેળાના સેવન બાદ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : કાચાં કેળામાં પોટેશિયમની માત્રા ભરપૂર હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. કાચા કેળામાં ફાઈબરની માત્રા ભરપૂર હોવાથી વધતાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. જેથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં ગુણકારી ગણાય છે.

ત્વચાને ચમકદાર બનાવે છે : કાચાં કેળાનું સેવન ત્વચા માટે લાભકારક ગણાય છે. કેમ કે કાચાં કેળામાં વિવિધ વિટામિન તથા ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જેથી કાચાં કેળાનું સેવન કરવાથી ત્વચા સૂકી-બરછટ કે કરચલી વાળી રહેતી નથી.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે : કાચાં કેળામાં વિટામિન સી, વિટામિન બી-૬ તથા ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વિટામિન સી મુક્ત કણોથી લડીને શરીરને સંક્રમણથી બચાવે છે. જ્યારે વિટામિન બી-૬ લાલ રક્ત કોશિકાના ઉત્પાદનમાં વધારો કરે છે. જેથી શરીરને પૂરતાં પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે છે. લાંબે ગાળે શરીરને નિરોગી બનાવવામાં મદદ કરે છે.

કાચાં કેળામાંથી અનેક વાનગી બનાવી શકાય છે. જેમ કે કાચાં કેળાનું શાક, કાચાં કેળાની ચીપ્સ, કાચાં કેળાની કટલેટ, કાચાં કેળાની પેટિસ તેમજ કાચાં કેળાના ભજિયા બનાવી શકાય છે. નાગરોને ત્યાં બનતાં મોટા શાકમાં અન્ય શાકની સાથે કાચાં કેળાનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. જે મોટા-શાકને સ્વાદિષ્ટ બનાવવામાં મદદ કરે છે. ■

કાચાં કેળાનું શાક

૪ નંગ કાચાં કેળા, ૧ ચમચી આખા ધાણા, ૧ ચમચી તલ, ૪-૫ નંગ મીઠો લીમડો ઝીણો કાપેલો, સ્વાદાનુસાર મીઠું, ૧ નાની ચમચી જીરું, સજાવટ માટે કોથમીર, ચપટી હિંગ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ નાની ચમચી ગરમ મસાલો

બનાવવાની રીત : સૌ પ્રથમ કાચાં કેળાની છાલ કાઢીને ટુકડાં કરી લેવાં. કેળા કપાઈ જાય ત્યારબાદ તેને પાણીમાં રાખવા. હવે એક તપેલીમાં ૨ ગ્લાસ ગરમ પાણી મૂકવું તેમાં કાપેલાં કેળાના ટુકડાં મૂકવાં. ચપટી મીઠું તથા ચપટી હળદર ભેળવવી. કેળા બફાઈ જાય ત્યારબાદ તેને ચારણીમાં કાઢીને નિતારી લેવાં. હવે કડાઈમાં ૧ નાની ચમચી તેલ તથા ૧ નાની ચમચી ઘી મૂકીને તેમાં જીરું મૂકવું. જીરું સેકાઈ જાય ત્યારબાદ આખા ધાણા, તલ, ઝીણા સમારેલાં આદું-મરચાં, મીઠો લીમડો વગેરે નાખીને હલાવતાં રહેવું. તલ તતડવા લાગે એટલે તેમાં કેળાને ગોઠવવાં. ધીમા તાપે શાકને પકાવવું. તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો ભેળવવો. સ્વાદાનુસાર ખાંડ તથા મીઠું ભેળવવું.

બાઉલમાં કાચાં કેળાનું ગરમા-ગરમ શાક ગોઠવીને કોથમીરથી સજાવવું. ગરમા ગરમ રોટલી, પરાઠા કે રાજગરાની પૂરી સાથે સ્વાદ માણવો. (ફરાળમાં ખાઈ શકાય તેવું બનાવવા માટે હળદરનો ઉપયોગ ન કરવો. તલની સાથે સિંગદાણાને અધકચરાં વાટીને ઉપયોગ કરી શકાય.)

feedback@bombaysamachar.com
આરોગ્ય પ્લસ
સંકલનઃ સ્મૃતિ શાહ-મહેતા

રોગ દર્દ ને દર્દીનું વલણ...



રોગ એ પીડા કે દુઃખ નથી, પરંતુ પોતાના રોગ પ્રત્યેનું દર્દીનું વલણ જ રોગને પીડાનું સ્વરૂપ આપે છે, જેમ કે, કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય, તો તે દુઃખ કે પીડા નથી, પરંતુ દર્દીનું તાવ પ્રત્યેનું નકારાત્મક વલણ તાવને દુઃખદાયક બનાવે છે. તેવી જ રીતે શરીરમાં આપણને જેટલું હેત, મમતા અને આકર્ષણ છે, તેટલો રોગ દુઃખદાયક લાગે છે. તેમ જ રોગની વારંવાર સ્મૃતિ, રોગની પીડાને ખૂબ જ વધારી દે છે.

ઘણા કિસ્સામાં એવું જોવામાં આવે છે કે, બે વ્યક્તિને થયેલા એક જ પ્રકારના રોગમાં એક વ્યક્તિ ખૂબ જ ઝડપથી નિરોગી થઈ જાય છે, જ્યારે બીજી વ્યક્તિને તે રોગ ઘણો લાંબો સમય ચાલે છે. તેનું કારણ દર્દીનું બીમારી પ્રત્યેનું વલણ હોય છે. મોટા ભાગના દર્દીને પોતાની બીમારી પ્રત્યે કેવું વલણ રાખવું તેનો ખ્યાલ જ હોતો નથી. એથી દર્દીએ પોતાની બીમારી સાથે કેવું વલણ રાખવું, અને કેવું વલણ ન રાખવું, તે અંગે અહીં ઝીણવટભરી ચર્ચા કરી છે.

દર્દીએ બીમારી સાથે કેવું વલણ ન રાખવું?

*** બીમારી પ્રત્યે આક્રમક ન થઈ જવુંઃ**

ઘણા દર્દી એવા હોય છે કે, જે પોતાની બીમારીનો ખૂબ જ વિરોધ કરતા હોય છે. એ બીમારી પ્રત્યે વધુ પડતા આક્રમક થઈ જાય છે. તેથી નાના એવા રોગમાં પણ તેઓ ખૂબ જ ચિંતિત થઈ, તેને દૂર કરવા માટે શક્ય તેટલી દવાઓ અને ડોક્ટરોની પાછળ પોતાનો કિંમતી સમય અને ધન બગાડતા હોય છે. પોતાને થયેલ રોગનો એ સંપૂર્ણ અસ્વીકાર કરે છે. તેથી એને આવા જ વિચારો આવ્યા કરે છે કે, મને આ બીમારી શા માટે થઈ? અને આવા સમયે જો સ્નેહીજનો તેનું ઓછું ધ્યાન રાખે, તો એમના પ્રત્યે પણ ખૂબ જ આક્રમક થઈ જતા હોય છે, પરંતુ જેમ જેમ વ્યક્તિ પોતાની બીમારી પ્રત્યે આક્રમક થાય છે, તેમ તેમ તે બીમારીનો વધુ શિકાર બનતો જાય છે. માટે પોતાની બીમારી પ્રત્યે ક્યારેય આક્રમક ન થવું.

*** બીમારીને આધીન ન થઈ જવુંઃ**

તેવી જ રીતે અમુક દર્દી બીમારીને એટલા બધા આધીન થઈ જતા હોય છે કે, એ બીમારીને પોતાનામાં કાયમી નિવાસ આપી દે છે. આવા દર્દી બીમારીથી ખૂબ જ ડરતા હોય છે, પરંતુ સાથોસાથ બીમારીના પ્રભાવમાં પણ જીવતા હોય છે. ખરેખર બીમારીમાં થોડી સાવધાની રાખવાથી તેમાંથી બહાર નીકળી શકાય તેવું હોય છે, છતાં પણ આવા પ્રકારના દર્દીઓ બીમારીને ખૂબ જ પંપાળતા હોય છે. એનું મન સતત બીમારીનું જ ચિંતવન કરતું હોય છે. તેથી એ બીમારી પ્રત્યેના વિચારો જ એને વધુ દુઃખ દે છે. આમ એ નાની એવી બીમારીને પણ ખૂબ મોટું સ્વરૂપ આપે છે. અને જ્યાં સુધી પોતે સાજા ન થાય ત્યાં સુધી મૂંઝવણમાં જ રહ્યા કરે છે. માટે બીમારી પ્રત્યે આક્રમક કે તેને આધીન ન થતાં તેમાંથી બહાર નીકળવાના યોગ્ય ઉપાયો કરવા.

ઉપરોક્ત બંને કારણ કરતાં પણ એક એવું અગત્યનું કારણ છે કે, જેને લઈને દર્દી બીમારીનો કાયમી શિકાર બની જતો હોય છે. સામાન્ય બીમારી પણ તેનામાં આજીવન નિવાસ કરીને રહે છે. લાંબા સમયના ઈલાજો બાદ પણ ડોક્ટરો, વૈદ્યો અને સ્નેહીજનો દર્દીની બીમારીનું આ કારણ જાણી શકતા નથી. આ કારણ ખૂબ જ આશ્ચર્યજનક અને બધાને કદાચ ન પણ સમજાય એવું છે, પરંતુ તે ખૂબ જ વૈજ્ઞાનિક અને વાસ્તવિક છે. કારણ એ છે કે, દર્દીને સાજાં થવા કરતાં બીમાર રહેવું વધુ પસંદ હોય છે.

શું દર્દીને બીમાર રહેવું પસંદ હોઈ શકે?

હા, કેટલાક બીમારીને જ ગુણ માનવા લાગે છે. તેમાં એણે અનેક ફાયદાઓ માની લીધા હોય છે, પરંતુ બીમારીમાં દર્દીને શા માટે ગુણ કે ફાયદાઓ મનાય છે, તેના અહીંયા ત્રણ આશ્ચર્યકારી કારણ છે...

માંદગી દરમ્યાન મળતી વિશેષ સુવિધાઓઃ

માંદગી દરમ્યાન દર્દી માટે અમુક વિશેષ સંભાળ રાખવી જરૂરી હોય છે. આ સુવિધાઓ દર્દીને અમુક અંશે સ્વસ્થ થવામાં ખૂબ જ ઉપયોગી હોય છે, જેમ કે, માંદગી દરમિયાન ગમે ત્યારે મનપસંદ જમવું, ગમે ત્યારે સૂવું-જાગવું વગેરે અમુક પ્રકારની છૂટછાટ દર્દીને આપવામાં આવતી હોય છે એટલે ધીરે-ધીરે દર્દી આ સુવિધાઓથી ટેવાતો જાય છે અને સુવિધાઓને પોતાની જરૂરિયાત માની લે છે. જેમ સત્તાના લાલચું વ્યક્તિને એકવાર સત્તા ભોગવવા મળે પછી તેનો ત્યાગ કરી શકતો નથી એવું જ અહીં થાય છે. અમુક દર્દીને બીમારી દરમિયાન મળતી વિશેષ સુવિધાઓનો ઉપભોગ કર્યા પછી એનાથી તે સુવિધાઓ છોડી શકાતી નથી.

આવા સમયે જો દર્દી સાવધાન થઈને તે સુવિધાઓનો વિવેકપૂર્વક ત્યાગ ન કરે, તો આ સુવિધાઓ જ તેની બીમારીને લંબાવાનું કારણ બને છે. માંદગી દરમિયાન દર્દીને મળતી જરૂરિયાત ઉપરાંતની સુવિધાઓ જ એના માટે કુટેવો બની જાય છે. હવે જો સ્નેહીજનો દર્દીની આ કુટેવોને છોડાવી બીમારીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે તો દર્દી એમના પ્રત્યે ખૂબ જ અણગમો વ્યક્ત કરે છે. એટલું જ નહિ, દર્દી બીમારીમાંથી બહાર નીકળવાની મદદ લેવાને બદલે પોતાની બીમારીનો સહુ સ્વીકાર કરે અને મળતી સુવિધાઓ યથાવત્ રહે તેવી અપેક્ષા રાખે છે.

સહુ તરફથી મળતી વિશેષ સહાનુભૂતિઓઃ

દરેક વ્યક્તિ પોતાના આત્મસન્માનમાં જીવતી હોય છે. આપણને સહુના આકર્ષણનું કેન્દ્ર થવું ખૂબ જ ગમતું હોય છે. જ્યારે જ્યારે વ્યક્તિને પોતાનું આત્મસન્માન એની અપેક્ષા કરતાં ઓછું અનુભવાય છે ત્યારે એને પ્રેમની ઊણપ વર્તાય છે. મનમાં સતત એવાં વિચારો રહે છે કે, 'મને કોઈ પ્રેમ આપતું નથી, મને કોઈ સમજી શકતું નથી.' તેથી એ પ્રેમના નામે પોતાના આત્મસન્માનને સંતોષવા ઇચ્છતો હોય છે. મનને તે સારી રીતે ખ્યાલ હોય છે કે, જો શરીર બીમાર પડે તો સહુ તરફથી મળતી લાગણીઓના કારણે તેનું આત્મસન્માન સંતોષાશે. તેથી મનનું કાર્યક્ષેત્ર એવું મગજ, શરીરમાં એવાં ન્યુરોટ્રાન્સમીટર્સ (મગજમાં રહેલાં રસાયણો, કે જે મગજના કોષો વચ્ચે સંદેશાવાહક તરીકે કામ કરે છે.) છોડે છે, કે જે કોઈ પણ પ્રકારની શારીરિક (પાચનતંત્ર, શ્વસનતંત્ર વગેરેને લગતી) કે માનસિક બીમારી ઉત્પન્ન કરે છે. આ રીતે બીમારીના નિમિત્તે દર્દીને સ્નેહીજનો તરફથી લાગણી અને સહાનુભૂતિરૂપે પ્રેમ પ્રાપ્ત થાય છે. તેથી દર્દી ધીરે-ધીરે તે લાગણીઓથી ટેવાતો જાય છે પછી એને એવો ભય લાગે છે કે, જો હવે હું સાજો થઈ જઈશ તો સ્નેહીજનો તરફથી મળતી લાગણીઓ ઓછી થઈ જશે. તેથી દર્દી બીમાર રહેવાનું જ પસંદ કરે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, દર્દીને તે ખ્યાલ પણ નથી હોતો કે, તેનું શરીર આત્મસન્માનની ઝંખનાને કારણે બીમાર પડ્યું છે. એટલું જ નહિ, સ્નેહીજનો અને ડોક્ટરો પણ દર્દીની બીમારીનું આ સાચું કારણ શોધી શકતા નથી અને બીમારીના અન્ય ઉપચારો જ કર્યા કરે છે, પરંતુ કોઈકવાર સ્વજનો બીમારીનું સાચું કારણ જાણવા છતાં પણ દર્દીને સ્પષ્ટ કહી શકતા નથી.

કેમ જે, જો દર્દીને બીમારીનું સાચું કારણ જણાવે તો તરત જ દર્દી તેને નકારી કાઢે છે અને વધુ મૂંઝવણમાં જીવવા લાગે છે. આવા સમયે સ્નેહીજનોએ જ સાવધાન થઈને દર્દીને યોગ્ય અને જરૂર પૂરતો જ પ્રેમ આપીને, સાચી વાત સમજાવીને બીમારીમાંથી બચાવવો જોઈએ. અને જો દર્દીને પ્રેમ આપવાની માત્રા વધી જશે તો એની બીમારી અવશ્ય લાંબા સમય સુધી ચાલશે. અને ભવિષ્યમાં પણ તે દર્દી બીમાર રહેવાનું જ પસંદ કરશે. માટે આવી પરિસ્થિતિમાં સ્નેહીજનોએ દર્દી સાથે ખૂબ જ સમજીને વ્યવહાર કરવો જોઈએ.

આમેય,આવા દર્દીઓના બીમાર પડવાનું કારણ ડોક્ટરો, વૈદ્યો કે સ્નેહીજનો પણ પકડી શકતા નથી. કેમ કે, આવા દર્દીઓ ખૂબ જ નાટકીય હોય છે; તેમને ઢોંગ કરતા ખૂબ જ સારી રીતે આવડતું હોય છે. તેમને જેમ છે તેમ ઓળખવા, એ તો નેવાના પાણી મોભે ચઢાવવા જેવું મુશ્કેલ છે. બિચારા સ્નેહીજનો આવા દર્દીને સાજા કરવા સમયનું ખૂબ જ યોગદાન આપે છે, તેમ છતાં દર્દીને એમની લેશમાત્ર કિંમત હોતી નથી.

બીજી તરફ, દર્દીને સતત એવી અપેક્ષા રહ્યા કરે છે કે, પરિવારજનો અને સહચરો પોતાના જીવનમાં હસ્તક્ષેપ ન કરતાં તેને મનફાવે તેમ સ્વચ્છંદી રીતે જીવવા દે, પરંતુ દર્દી પોતાની આ માંગ સ્પષ્ટ શબ્દોમાં કહી શકતો નથી. દર્દી પોતાની આ નબળાઈ જાણતો હોવા છતાં પણ પોતાની માનસિકતામાંથી બહાર નીકળવા સક્ષમ હોતો નથી. તેથી સ્નેહીજનોએ જ તેની આ નબળાઈને સમજીને, ખૂબ જ ધીરજતાપૂર્વક અને વિવેકબુદ્ધિ રાખીને દર્દીને હિંમત આપીને બીમારીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. ■

feedback@bombaysamachar.com
હેલ્થ
દિક્ષિતા મકવાણા

સેલિબ્રિટીઝ 'કાળું પાણી' પીવે છે, તેની ખાસિયત શું છે?

- એનટી-ટોક્સિન સુપર પાવર ડ્રિંક
- રેડિકલ સામે લડત આપે છે
- ડાયજેસ્ટિવ સપોર્ટ
- ત્વચા, વાળ અને નખના દેખાવમાં સુધારો કરે છે
- સહનશક્તિ અને ઝડપી રિકવરી સુધારે છે

સેલિબ્રિટીઝના જીવન વિશે જાણવા માટે ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ઘણા સેલિબ્રિટીઝ એવા છે જેમને કાળું પાણી પીતા જોઈ શકાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ કાળાં પાણી અને સાદા પાણી વચ્ચે શું તફાવત છે. તે સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે.

ક્રિકેટર હોય કે બોલિવૂડ સ્ટાર્સ. સેલિબ્રિટીઝ તેમની સ્ટાઇલ, ફિટનેસ અને ખાવાની આદતો વિશે ચર્ચામાં રહે છે, કારણ કે ચાહકો સેલિબ્રિટીઝ વિશે બધું જાણવા માગે છે. વિરાટ કોહલીથી લઈને શ્રુતિ હાસન અને મલાઈકા અરોરા સુધી પણ કાળું પાણી પીતાં જોવાં મળ્યાં છે. આ પાણીને આઇકલાઇન વોટર કહેવામાં આવે છે.

પાણી આપણા બધાની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ફિલ્ટર કરેલું પાણી પીવામાં આવે છે, જેથી તેમાં કોઈ અશુદ્ધિઓ ન રહે અને કુદરતી રીતે બનતા પાણીમાં કેટલાક પ્રમાણમાં ખનિજો પણ હોય છે. હાલમાં કાળું એટલે કે આઇકલાઇન વોટર સેલિબ્રિટીઝમાં ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જાણીએ કે કાળું પાણી સામાન્ય પાણીથી અલગ શું છે.

સેલિબ્રિટીઝ કાળું પાણી પીવે છે. તેનો સ્વાદ લગભગ સામાન્ય પાણી જેવો જ છે, પરંતુ તેની કિંમત થોડી વધારે છે. પોષણ મૂલ્ય જેવા ઘણા કારણો છે જે આ કાળા પાણીને ખાસ બનાવે છે. આ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. ચાલો જાણીએ કાળા પાણીની ખાસિયત.

pH સ્તરમાં તફાવત છે

સેલિબ્રિટીઓ જે કાળું પાણી પીવે છે તે આલ્કલાઇન પાણી છે. સામાન્ય પાણીનું pH ૬થી ૭ ની વચ્ચે હોય છે, પરંતુ આ કાળા પાણીનું pH ૭, ૮ કે ૯ થી વધુ હોય છે. તે એસિડિટીનું કારણ નથી, કારણ કે તે શરીરની એસિડિટી ઘટાડવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે, તે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે અને ફિટ રહેવામાં મદદ કરે છે.

ખનિજોનું પ્રમાણ વધારે છે

પાણીમાં કેટલાક ખનિજો કુદરતી રીતે પણ જોવા મળે છે, પરંતુ જ્યારે પાણી ફિલ્ટર કરવામાં આવે છે, ત્યારે ઘણી વખત આ ખનિજો પણ નાશ પામે છે. કાળા પાણીમાં ઘણા ખનિજો અલગથી ઉમેરવામાં આવે છે, જે શરીરને સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે.

કાળા પાણીના સ્વાસ્થ્ય લાભો

આલ્કલાઇન કાળું પાણી પીવાથી શરીરને ડિટોક્સિફાઇ થાય છે. તેનું pH સ્તર શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે. કાળું પાણી સામાન્ય પાણી કરતાં શરીરને હાઇડ્રેટ કરવામાં વધુ મદદરૂપ છે. આ ઉપરાંત કાળા પાણીના કેટલાક અન્ય ફાયદાઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે, જેમ કે બ્લડ સુગર કંટ્રોલ, ઊંઘમાં સુધારો, હૃદય રોગનું જોખમ ઓછું, મજબૂત હાડકાં માટે મદદરૂપ થાય છે.

આ જાણવું મહત્ત્વપૂર્ણ છે

આ કાળાં પાણી કેટલું ફાયદાકારક છે તે અંગે ખૂબ જ મર્યાદિત વૈજ્ઞાનિક પુરાવા છે, જ્યારે તે કોઈપણ રોગને મટાડવામાં મદદરૂપ નથી. ક્ષારયુક્ત અને ખનિજોની માત્રાને કારણે, તે ફક્ત સ્વસ્થ રહેવાના વિકલ્પ તરીકે જ પી શકાય છે અને આમાં પણ, તમારા માટે યોગ્ય બ્રાન્ડ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. જો તમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય ચિંતા હોય, તો તમારા રૂટીનમાં કાળા પાણીનો સમાવેશ કરતા પહેલા ચોક્કસપણે તમારા ડૉક્ટર અથવા પ્રમાણિત ડાયેટિશિયનની સલાહ લો. ■

થાણે પાલિકા હવે એક્શન મોડમાં: ૩૦ ગેરકાયદે બિલ્ડિંગ તોડી પડાયાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણેઃ થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા હોવાની ફરિયાદ બાદ પાલિકા પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. થાણે પાલિકાની હદમાં આવેલા ગેરકાયદે બાંધકામના સર્વેક્ષણ, તેની તોડી પાડવાની કાર્યવાહી માટે ડેપ્યુટી કમિશનર સ્તરના અધિકારીના નેતૃત્વમાં સ્પેશિયલ એક્શન ટીમની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમે અત્યાર સુધી કુલ ૩૦ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરી છે, જેમાં એક જગ્યાએ મહારાષ્ટ્ર રિજનલ એન્ડ ટાઉન પ્લાનિંગ (એમઆરટીપી) એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

હાઈ કોર્ટે આપેલા નિર્દેશ અનુસાર થાણે પાલિકાના નવ પ્રભાગ સમિતિ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. એ સાથે જ આ વોર્ડમાં બીટ ઈન્સ્પેક્ટરે કરેલી નોંધ અનુસાર ગેરકાયદે બાંધકામ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. પાલિકા કમિશનર સૌરભ રાવના આદેશ બાદ સ્થાપવામાં આવેલી સ્પેશિયલ એક્શન ટીમના ચીફ તરીકે ડેપ્યુટી કમિશનર સહિત એક્ઝિક્યુટિવ એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી છે.

આ ટીમને ગેરકાયદે બાંધકામને શોધીને તેમને તોડી પાડવાની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે ગેરકાયદે બિલ્ડિંગના બાંધકામ ચાલી રહ્યા છે તેવી આખી બિલ્ડિંગને તોડી પાડવામાં આવી રહી છે. અમુક ઠેકાણે વધારાના બાંધકામ, કોલમ ઊભારણી, પ્લિંથના કરવામાં આવેલા કામને પણ તોડવામાં આવી રહ્યા છે.

થાણે પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ થાણેમાં મુખ્યત્વે યેઉર મુંબ્રા, દિવા, વાગળે એસ્ટેટ, નૌપાડા, ઉથળસર, માજીવાડા-માનપાડામાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવામાં ૧૭ બિલ્ડિંગમાંથી વધુ બે બિલ્ડિંગ તોડી પાડવામાં આવતા અત્યાર સુધી તોડી પાડવામાં આવેલી બિલ્ડિંગની સંખ્યા ૧૩ થઈ ગઈ છે.

બાંધકામને તોડવાની કાર્યવાહી દરમ્યાન સ્થાનિક સ્તરે થતા વિરોધને રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ આ ઝુંબેશમાં ૩૩ બાંધકામ સામે પગલાં લેવામાં આવ્યા હતા, તેમાં હવે વધુ ૩૦ બાંધકામનો સમાવેશ થાય છે. ■

પરીક્ષામાં ઓછા માર્ક્સઃ પુત્રીની હત્યા કરી પિતાએ

સાંગલીઃ સાંગલી જિલ્લામાં પરીક્ષામાં ઓછા ગુણ લાવનારી ૧૬ વર્ષની પુત્રીની હત્યા કરવા બદલ ૪૫ વર્ષના પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

સાંગલીમાં આતપાડી તહેસીલના નેલકરંજી ગામમાં શનિવારે રાતે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલી સગીરાની ઓળખ સાધના ભોસલે તરીકે થઇ હતી.

સાધના ૧૨મા ધોરણમાં ભણતી હતી અને તેને પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા હતા, જેને કારણે તેના પિતા ધોંડીરામ ભોસલે નારાજ થયા હતા અને આ બાબતને લઇ બંને વચ્ચે ઝઘડો થયો હતો, એમ પોલીસે કહ્યું હતું.

દરમિયાન ઉશ્કેરાયેલા ધોંડીરામે પત્ની અને પુત્રની હાજરીમાં પથ્થરના ગ્રાઇન્ડરનું લાકડાનું હેન્ડલ પકડીને સાધના પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલી સાધનાને સારવાર માટે સાંગલીની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમના અહેવાલમાં અનેક ઇજાને કારણે સાધનાનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

આતપાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય બાહિરે જણાવ્યું હતું કે સાધનાની માતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે હત્યાનો ગુનો દાખલ કરીને ધોંડીરામની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)■

થાણેના શાહપુરમાં વિકાસની વાતોના લીરેલીરાઃ

રસ્તો ન હોવાથી સગર્ભાને એમ્બ્યુલન્સ સુધી ડોલીમાં લઈ જવાની ફરજ પડી

થાણેઃ થાણે જિલ્લાના શાહપુરમાં સોમવારે એક ગર્ભવતી મહિલાને તેના ગામડા સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી સ્થાનિક ભાષામાં 'ડોલી' તરીકે ઓળખાતી કામચલાઉ પાલખીમાં લઈ જવી પડી હતી, આ મુદ્દો દેશની આર્થિક રાજધાની મુંબઈથી માત્ર ૧૦૦ કિલોમીટર દૂર ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય માળખામાં ગંભીર સમસ્યાઓને છતી કરે છે.

બપોરે ૧:૩૦ વાગ્યે ૨૧ વર્ષીય સંગીતા રવિન્દ્ર મુકાને તેના વતન ચાફેવાડી ગામથી ગૈદંડ રોડ પર પાર્ક કરેલી એમ્બ્યુલન્સ સુધી એક કિલોમીટરથી વધુ અંતરે ડોલીમાં લઈ જવામાં આવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

''તેણીને પ્રસૂતિ પીડા થઈ હતી અને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી. ચાફેવાડી સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હોવાથી તેણીને ડોલીમાં બેસાડીને લઈ જવી પડી હતી, જેનો અર્થ એ છે કે એમ્બ્યુલન્સને ગેયદંડ રોડ પર રાહ જોવી પડે છે. આપણે ૨૦૨૫ માં છીએ પરંતુ મોટાં શહેરી કેન્દ્રોની નજીકના વિસ્તારોની આ સ્થિતિ છે,'' સ્થાનિક કાર્યકર્તા પ્રકાશ ખોડકાએ જણાવ્યું.

''વારંવાર અપીલ કરવા છતાં, નાદગાંવ ગ્રામ પંચાયત, જેનો ચાફેવાડી એક ભાગ છે, તેણે રસ્તો બનાવવા માટે કંઈ કર્યું નથી. વિલંબને કારણે, એમ્બ્યુલન્સ પહોંચતા પહેલા તેણીને આંચકી આવી, ત્યારબાદ તેણીને થાણે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોકટરોએ કહ્યું કે તેણીની સ્થિતિ સ્થિર છે,'' ખોડકાએ ઉમેર્યું.

રસ્તાના અભાવે તેણીનો જીવ જોખમમાં મુકાયો હતો, નહીં તો તેણીને અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ સારવાર મળી શકી હોત, એમ તેમણે ધ્યાન દોર્યું.

નાદગાંવ ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ટિપ્પણી માટે સંપર્ક થઈ શક્યો નહીં. (પીટીઆઈ)■

માણસાઈ મરી પરવારીઃ કેન્સરગ્રસ્ત દાદીને પૌત્ર ઉકરડામાં છોડી ગયો

મુંબઈઃ દરેક વ્યક્તિના જીવનમાં દાદા-દાદી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળપણ તેમની વાર્તાઓ વિના અધૂરું હોય છે. દરેક બાળક પોતાના દાદા-દાદીના ખોળામાં માથું રાખીને રમુજી અને રસપ્રદ બાળવાર્તાઓ સાંભળીને મોટું થાય છે. પૌત્ર ઘડપણમાં દાદાનો મિત્ર હોય છે. દરેક બાળક તેની દાદીના ખોળામાં સુરક્ષિત મહેસુસ કરે છે, પણ વિચારો કે કોઈ વ્યક્તિ મોટો થયા પછી તેની દાદીને ફક્ત એટલા માટે કચરામાં છોડી દે છે કારણ કે તેમને કેન્સર થયું છે!! આ માત્ર કલ્પના નથી પણ વાસ્તવમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યારે દાદીને તેના પૌત્રની સૌથી વધુ જરૂર હતી, ત્યારે પૌત્રે માનવતાને નેવે મૂકી દીધી.

શનિવારે સવારે, પોલીસને મુંબઈના આરે કોલોની વિસ્તારમાં રસ્તા પર કચરાના ઢગલા પાસે ૬૦ વર્ષીય યશોદા ગાયકવાડ નામની એક મહિલા મળી, જેની હાલત ખૂબ જ ખરાબ હતી.

આ મહિલા ત્વચાના કેન્સરથી પીડિત છે. એવું જાણવા મળ્યું છે કે તેના પૌત્રએ તેને આ હાલતમાં કચરાપેટી પાસે છોડી દીધી હતી. પોલીસે શનિવારે સાંજે ૫:૩૦ વાગ્યે વૃદ્ધ મહિલાને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેમની સ્થિતિને જોતા ઘણી હોસ્પિટલોએ તેમને દાખલ કરવાનો નનૈયો ભણ્યો હોવાથી તેમને દાખલ કરવામાં વિલંબ થયો હતો. મહિલાએ પોતે પોલીસને જાણ કરી કે તેનો પૌત્ર તેને કચરાપેટી પાસે છોડી ગયો છે.

તેમણે મુંબઈમાં મલાડ અને કાંદિવલીમાં બે સરનામાં આપ્યા છે, જ્યાં મહિલાના સંબંધીઓની ઓળખ માટે મુંબઈ પોલીસની ટીમો મોકલવામાં આવી છે. મહિલાના સંબંધીઓને શોધવા માટે તેના ફોટોગ્રાફ બધા પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવ્યા છે.

વૃદ્ધ મહિલાની હાલત જોઈને ભલભલાનું હૃદય પીગળી જશે અને એક જ પ્રશ્ન થશે કે લોકો આટલા પથ્થર દિલના કેવી રીતે હોઈ શકે, કે જેની આંગળી પકડીને પૌત્ર મોટો થયો હતો, તેને એકલા મરવા માટે છોડી ગયો? ■

ભાયંદરમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મઃ ટ્યૂશન ટીચરની ધરપકડ

થાણેઃ ભાયંદરમાં ૧૭ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવા પ્રકરણે ટ્યૂશન ટીચરની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પચાસ વર્ષનો આરોપી ભાયંદરમાં પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસીસ ચલાવતો હતો અને આ જ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીના ઘરે અવારનવાર જતો હતો.

બેચલર ઓફ આર્ટ્સ (બીએ)ની પહેલા વર્ષમાં ભણતી વિદ્યાર્થિનીને કારકિર્દીના વિકાસ માટે ચર્ચા કરવાને બહાને ટ્યૂશન ટીચરે બોલાવી હતી અને ક્લાસરૂમમાં તેનો કથિત વિનયભંગ કર્યો હતો. આરોપીએ આ અંગે કોઇને પણ જાણ કરતાં ગંભીર પરિણામ ભોગવવાની વિદ્યાર્થિનીને ધમકી આપી હતી, એમ નવઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. આરોપીએ ઑક્ટોબર, ૨૦૨૩થી નવેમ્બર, ૨૦૨૪ દરમિયાન તેના ક્લાસીસમાં તથા વિદ્યાર્થિનીના ઘરમાં અનેકવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

વિદ્યાર્થિનીએ તાજેતરમાં તેની માતાને આ અંગે જાણ કરી હતી અને બાદમાં બંને જણે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)■

ભાયંદર નજીક કન્ટેઈનર સાથે ટકરાયા પછી ટૅન્કર ખાડીમાં પડ્યું

મુંબઈઃ મુંબઈ-અમદાવાદ હાઈવેથી થાણે તરફ પૂરપાટ વેગે જઈ રહેલું ટૅન્કર કન્ટેઈનર સાથે ટકરાયા બાદ બ્રિજની સેફ્ટી રેલિંગ તોડી ખાડીમાં પડ્યું હોવાની ઘટના ભાયંદર નજીક બની હતી. આ ઘટનામાં ખાડીના પાણીમાં ડૂબી ગયેલા ટૅન્કરના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની બપોરે બની હતી. ટૅન્કર ઘોડબંદર રોડથી થાણેની દિશામાં જવાનું હતું. હાઈવે પર વર્સોવા બ્રિજ પરથી પસાર થતી વખતે ટૅન્કરને અકસ્માત નડ્યો હતો.

કહેવાય છે કે લાકડાં લઈને જતા કન્ટેઈનર સાથે ભટકાયા પછી ટૅન્કર બ્રિજની સેફ્ટી રેલિંગ તોડી ખાડીમાં પડ્યું હતું. ઘટનામાં કન્ટેઈનરને પણ નુકસાન થયું હતું. જોકે અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ પોલીસ કરી રહી છે.

દરમિયાન ટૅન્કર સાથે ડ્રાઈવર પર ખાડીના પાણીમાં પડ્યો હોવાની માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જૉઈન્ટ સર્ચ ઑપરેશન હાથ ધરી પોલીસે પાણીમાં ડૂબી ગયેલા ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ટ્રાફિક પોલીસે હેવી ક્રેનની મદદથી ટૅન્કરને પણ ખાડીમાંથી બહાર કાઢ્યું હતું. ઘટનાને પગલે જૂના વર્સોવા બ્રિજ પરના વાહનવ્યવહારને અસર થઈ હતી. કલાકો સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)■

કુંભમેળા પહેલા નાશિક સુધીના તમામ રસ્તાઓ ચકાચક કરાશેઃ ફડણવીસ

નાગપુરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આવતા વર્ષે ૩૧ ઓક્ટોબરથી શરૂ થનારા સિંહસ્થ કુંભ મેળા પહેલા નાશિક તરફ જતા તમામ રસ્તાઓનું કામકાજ કરીને તેમને ચકાચક બનાવાશે.

મુખ્ય પ્રધાનના કાર્યાલય તરફથી રવિવારે એક પ્રકાશનમાં જણાવાયું હતું કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં નાશિકને જોડતા રાજમાર્ગો અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

નાશિકમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ટ્રાફિક વ્યવસ્થાપનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ગડકરીએ તેમના મંત્રાલય દ્વારા જરૂરી માર્ગ માળખાના વિકાસ અને નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, એમ તેમાં જણાવાયું છે.

સિંહસ્થ કુંભ મેળો ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ નાશિકમાં ત્ર્યંબકેશ્વર અને રામકુંડ ખાતે 'ધ્વજરોહણ' (ધ્વજવંદન) સાથે શરૂ થશે. ૨૪ જુલાઈ, ૨૦૨૮ ના રોજ ધ્વજ ઉતારવામાં આવશે, જે દર ૧૨ વર્ષે એકવાર યોજાતા આ કાર્યક્રમના સમાપન તરીકે ઉજવવામાં આવશે. કુંભમેળા દરમિયાન શ્રદ્ધાળુઓની વધતી શ્રદ્ધા અને અપેક્ષિત સંખ્યામાં વધારો થવાને કારણે, ફડણવીસે માર્ગ માળખાને મજબૂત બનાવવા માટે કેન્દ્રીય સહાય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી, એમ પ્રકાશનમાં જણાવાયું છે.

નાગપુરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ગડકરી અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને આ નિર્ણયો લેવામાં આવ્યા હતા, એમ તેમાં જણાવાયું છે.

નાશિક આઠ મુખ્ય માર્ગો દ્વારા જોડાયેલું છે, જેમાં મુંબઈ, પાલઘર, પુણે, અહિલ્યાનગર, છત્રપતિ સંભાજીનગર, ધુળે અને પડોશી ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે.

કુંભમેળા દરમિયાન આ રસ્તાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, પરંતુ નાશિકમાં અને તેની આસપાસના આંતરિક રસ્તાઓ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને જોડે છે તેની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, ગડકરીએ લગભગ તમામ પ્રસ્તાવિત રસ્તાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કામ પૂર્ણ કરવા માટે જરૂરી ભંડોળ ટૂંક સમયમાં પૂરું પાડવામાં આવશે.

ફડણવીસે જણાવ્યું હતું કે કુંભમેળા દરમિયાન ટ્રાફિકમાં અપેક્ષિત વધારાને વિસ્તૃત રોડ નેટવર્ક દ્વારા અસરકારક રીતે સંચાલિત કરવામાં આવશે, જેનાથી ભક્તો માટે સલામત મુસાફરી સુનિશ્ચિત થશે. (પીટીઆઈ)■

ફન વર્લ્ડ

'મુંબઈ સમાચાર'ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે.
ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ...

ગુજરાતી - અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A	B
રતલ	HOLLOW
અટલ	POUND
પટલ	CHEEK
કપોલ	COVER
બખોલ	INEVITABLE

ઓળખાણ પડી?

ગુજરાત, મહારાષ્ટ્રમાં વગાડવામાં આવતા સુષિર વાદ્યની - વિન્ડ ઈન્સ્ટ્રુમેન્ટની ઓળખાણ પડી? ભારતીય અને યુરોપિયન મ્યુઝિકલ સ્વર એમાંથી ઉત્પન્ન થાય છે.

અ) તાનપુરા બ) એકતારા
ક) તુતારી ડ) પાવરી

ગયા વખતનો ઉકેલ

૧ આ	પો	૨ આ	પ		૩ પ્ર	૪ મા	ણ	૫ પ	૬ ત્ર
ત્મ		રા		૭ ધ	ખ	ડી		૮ ર	ણ
૯ નિ	૧૦ ય	મ	૧૧ ન		ર		૧૨ પ	ણે	
૧૩ મ	મ		ફ			૧૪ ઘ	ડ	ત	૧૫ ર
ગ્ન		૧૬ અ	ક	૧૭ બં	ધ		૧૮ ત	ર	સ
	૧૯ અ	પ	રા	ધ		૨૦ ભા	ર		મ
૨૧ સ	મ	ર			૨૨ સં	ગ		૨૩ બ	
૨૪ જા	ન	મા	૨૫ લ		વ		૨૬ ચ	ર	૨૬-અ ક
તિ			૨૭ વા	દ	ન		૨૮ કા	છ	લી
૨૯ ય	જુ	વેં	દ		૩૦ ન	ભ		૩૧ ટ	કા

શબ્દલાલિત્ય — સતીશ વ્યાસ

૧	૨		૩			૪		૫	૬
૭					૮			૯	
૧૦		૧૧		૧૨					
		૧૩					૧૪	૧૫	
૧૬	૧૭			૧૮					
૧૯						૨૦			૨૧
૨૨			૨૩		૨૪				
		૨૫					૨૬		
		૨૭				૨૮			
૨૯					૩૦				

આડી ચાવી
૧. આદર્શને વરેલો (૫)
૪. અદા, બનાવટ (૪)
૭. --- નું શરબત ઠંડક કરે (૨)
૮. બુદ્ધિની તેજસ્વિતા (૨)
૯. --- કર્યા પછી ગમે તેમ બોલાય (૨)
૧૦. શિયાળ (૩)
૧૨. જેનું પતન થયું છે તે (૩)
૧૩. આનંદ, જલસા (૨)
૧૪. ઇતિહાસ--- નો લખાય (૩)
૧૬. ગમાર, હઠી, જક્કી (૩)
૧૮. પાણી, તેજ, નૂર (૨)
૧૯. સંખ્યા, આંકડો (૩)
૨૦. અનુભવ, પ્રતીતિ (૪)
૨૨. ---જાવે તો જાવે પર આઝાદી ઘર આવે (૨)
૨૩. શૌચાલયમાં પાણી વાપરવું તે (૪)
૨૫. બરફ --- માંડે તો પાણી થાય (૪)
૨૬. સાચું બોલીને તમે --- થાવ (૩)
૨૭. --- સરવું એટલે ધાર્યું પાર પડવું (૨)
૨૮. ઘા (૨)
૨૯. શાશ્વત (૪)
૩૦. ઝઘડાળું સ્વભાવવાળું (૫)

ઊભી ચાવી
૧. સાંઢ (૩)
૨. દસમી તિથિ (૩)
૩. ગઇકાલનું વધ્યું ઘટ્યું (૨)
૪. અજાણ્યું (૩)
૫. ખ્રિસ્તી સાધ્વી (૨)
૬. યશ આપનારું (૪)
૮. પ્રતિચ્છાયા (૪)
૧૧. --- વગાડવું એટલે જાહેરાત કરવી (૪)
૧૫. મોજમસ્તી, આનંદ માણવો (૩)
૧૬. અંદરઅંદર (૬)
૧૭. એક મધ્યકાલીન કવિ (૩)
૧૮. આત્મશક્તિ (૪)
૨૦. આથમવું (૨)
૨૧. હંમેશાં તાજગીભર્યું (૫)
૨૩. આવવું તે (૪)
૨૪. ઇલાજ (૨)
૨૫. ક્ષમતા (૩)
૨૬. --- પરથી કાયદો બને (૩)
૨૮. એક જંગલી શિકારી પ્રાણી (૨)

ચતુર આપો જવાબ — અર્થ જણાવો

'સામે ડાલામથ્થો ભટકાઈ ગયો' વાક્યમાં ' ડાલામથ્થો' શબ્દનો અર્થ જણાવો.

અ) ગજરાજ બ) ડાકલા ક) સિંહ ડ) રીંછ

માતૃભાષાની મહેક

પથ્થર ઉપર પાણી રૂઢિપ્રયોગ વ્યર્થ પ્રયત્ન તરફ આંગળી ચીંધે છે. પાણીથી જેમ પથ્થર પલળતો નથી, બસ એવી જ રીતે નકામી વસ્તુ પાછળ બધી શક્તિ ગુમાવી દેવી એ એનો ભાવાર્થ છે. ટૂંકમાં કહીએ તો કોઈ અસર થાય નહીં તેવું કામ, નકામી મહેનત. પથ્થર એટલા દેવ કરવા એટલે જ્યાં પથ્થર દેખાય ત્યાં દેવ માની પૂજા કરવી.

ગુજરાત મોરી મોરી રે

કોઈ વ્યક્તિ HEMOPHOBIAથી પીડાય છે એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?

અ) પરસેવો બ) લોહી ક) શ્રમ ડ) પાચન

ઈર્શાદ

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
ફાગણમાં શ્રાવણનાં જલને ઝીલી લ્યો અણધાર્યાં!
-- સુરેશ દલાલ

સુડોકુ-૯૦૨૨

૬				૨				૭
		૮				૩		
૨	૭						૪	૯
૫		૪	૯		૧	૨		૬
૩								૧
૭		૬	૩		૨	૪		૮
૪	૬						૧	૩
		૫				૭		
૯				૬				૫

અહીં એક ચોરસ આપ્યું છે જેમાં નવ બોક્સ છે અને દરેકમાં નવ ખાનાં છે. ૧) દરેક બોક્સમાં એકથી નવ સુધીનો આંક આવવો જોઈએ. ૨) દરેક આડી અને ઊભી હરોળમાં આંક આવવો જોઈએ. અહીં પણ કોઈ આંક રહી ન જવો જોઈએ.

સુડોકુ-૯૦૨૧

૩	૧	૭	૬	૫	૮	૪	૨	૯
૨	૫	૯	૪	૩	૧	૭	૮	૬
૪	૬	૮	૨	૯	૭	૩	૫	૧
૫	૯	૩	૭	૧	૨	૮	૬	૪
૧	૮	૬	૯	૪	૩	૨	૭	૫
૭	૨	૪	૫	૮	૬	૧	૯	૩
૮	૭	૧	૩	૬	૯	૫	૪	૨
૯	૩	૫	૮	૨	૪	૬	૧	૭
૬	૪	૨	૧	૭	૫	૯	૩	૮

માઈન્ડ ગેમ

વિવિધતામાં એકતા ભાવના ધરાવતા આપણો દેશ વિવિધ રાજ્યોનો બનેલો છે. આજની તારીખમાં દેશમાં કુલ કેટલા રાજ્યો છે એ જણાવો.

અ) 24 બ) 26
ક) 28 ડ) 29

ગયા મંગળવારના જવાબ

ભાષા વૈભવ

A	B
સબબ	REASON
તલબ	ADDICTION
પ્રલંબ	EXTENDED
ગજબ	WONDER
વિલંબ	DELAY

માઈન્ડ ગેમ: 9

ઓળખાણ પડી?: Harp

ગુજરાત મોરી મોરી રે: ઊંચાઈ

ચતુર આપો જવાબ — અર્થ જણાવો: શિયાળ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) ભારતી બુચ (૪) શ્રીમતી ભારતી પ્રકાશ કટકિયા (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) નીતા દેસાઈ (૭) રશીક જુથાણી - ટોરંટો - કેનેડા (૮) નૂતન વિપીન શાહ (૯) શ્રદ્ધા આશર (૧૦) લજિતા ખોના (૧૧) મીનળ કાપડિયા (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીશી બંગાળી (૧૪) તાહેર ઔરંગાબાદવાલા (૧૫) શીરીન ઔરંગાબાદવાલા (૧૬) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) પુષ્પા પટેલ (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) ભાવના કર્વે (૨૨) અલકા વાણી (૨૩) વિણા સંપટ (૨૪) દેવેન્દ્ર સંપટ (૨૫) મહેશ દોશી (૨૬) ખુશરૂ કાપડિયા (૨૭) અંજુ ટોલિયા (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) જગદીશ ઠક્કર (૩૦) નિતિન જયંતિલાલ બજરિયા (૩૧) ડાયના સંતોકે (૩૨) પ્રવીણ વોરા (૩૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૪) પુષ્પા ખોના (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) ભારતી બુચ (૩૭) કિશોર બી. સંઘરાજકા (૩૮) અરવિંદ કામદાર (૩૯) નયના ગિરીશ મિસ્ત્રી (૪૦) ડૉ. પ્રકાશ કટકિયા (૪૧) ધીરેન્દ્ર ઉદેશી (૪૨) ગીતા ઉદેશી (૪૩) પ્રતિમા પમાણી (૪૪) દિપીકા દોશી (૪૫) અંબરીષ ઓઝા (૪૬) મહેશ સંઘવી

અમેરિકન હુમલાએ બજારને હચમચાવ્યું, સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટ સુધી નીચે પટકાઇ અંતે ૫૧૧ના ઘટાડે બંધ થયો, નિફ્ટી ૨૫,૦૦૦ની નીચે સરક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ઇરાન પર અમેરિકાએ કરેલા હુમલા પછી ધારણાં અનુસાર જ ઇક્વિટી બજારમાં ધ્રુજારી જોવા મળી હતી. સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટથી પણ નીચી સપાટી સુધી પડકાયો હતો અને લગભગ ૪૦૦ પોઇન્ટનો ઘટાડો પચાવી અંતે ૫૧૧ પોઇન્ટના ઘટાડે બંધ રહ્યો હતો. નિફ્ટી ૨૫,૦૦૦ની નીચે સરકી ગયો હતો. સ્મોલ અને મિડકેપ શેરોમાં પસંદગીની લેવાલી વચ્ચે સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૫૧૧.૩૮ પોઇન્ટ અથવા ૦.૬૨ ટકાના ઘટાડે ૮૧,૮૯૬.૭૯ની સપાટી પર અને નિફ્ટી ૧૪૦.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૫૬ ટકાના ઘટાડે ૨૪,૯૭૧.૯૦ની સપાટીએ સ્થિર થયો હતો.

સેન્સેક્સની કંપનીઓમાંથી એચસીએલ ટેક, ઇન્ફોસિસ, લાર્સન એન્ડ ટૂબ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિંદુસ્તાન યુનિલીવર, આઇટીસી, ટાટા કન્સ્લ્ટન્સી સર્વિસીસ અને મારુતિ સુઝુકી ટોપ લુઝર્સ હતા. જ્યારે ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેન્ક ટોપ ગેઇનર્સ હતા. માર્કેટ એનાલિસ્ટ અનુસાર નિફ્ટી જ્યાં સુધી ૨૪,૮૫૦ની ઉપર ટકી રહે છે ત્યાં સુધી લેવાલીની તકો મોજૂદ રહે છે અને જો તે ૨૫,૦૦૦ પાર કરવામાં સફળ રહે તો ટૂંકા ગાળામાં ૨૫,૩૫૦ સુધી આગળ વધી શકે.

નિફ્ટીમાં ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોટ્ર્સ નિફ્ટીમાં ટોપ ગેઇનરાં હતા, જ્યારે ઇન્ફોસિસ, એલએન્ડટી, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, એચસીએલ ટેક્નોલોજીસ ટોપ લુઝર્સ હતા. ક્ષેત્રીય મોરચે, આઇટી, એફએમસીજી, ઓટો, બેંક ૦.૫-૧.૫ ટકા સુધી ઘટ્યા હતા, જ્યારે મીડિયા, મેટલ, કેપિટલ ગુડ્સ ૦.૫-૪ સુધી ટકા વધ્યા હતા. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૦.૨ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૬ ટકા વધ્યો હતો.

ભારતના પ્રાઇમરી માર્કેટમાં ફરી હલચલ જામી છે. આ સપ્તાહમાં છ દિવસમાં એક ડઝન જાહેર ભરણાં આવી રહ્યા છે અને આઠ કંપનીઓના શેર લિસ્ટિંગ મેળવશે. એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિસ, સંભવ સ્ટીલ સહિતની કંપની મૂડીબજારમાંથી કુલ રૂ. ૧૫,૮૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. એનટીપીસીના બૉર્ડે એનસીડી અથવા બોન્ડ જારી કરીને પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ. ૧૮૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી માગી છે.

ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સિસ રૂ. ૨૦૦ કરોડના બુકબિલ્ડિંગ ઇશ્યૂ સાથે ૨૬ જૂનના રોજ મૂડીબજારમાં પ્રવેશ કરશે, ભરણું ૩૦ જૂને બંધ થશે. શેરની ફાળવણી પહેલી જુલાઈએ અને બીએસઇ, એનએસઇ પર લિસ્ટિંગ ત્રીજી જુલાઈએ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૫થી રૂ. ૧૧૧ પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. અરજી માટે લઘુતમ લોટ સાઈઝ ૧૩૫ છે.

એક્સપાન્શન સહિતના હેતુસર નાણાં ભંડોળ એકત્ર કરવા નીતુ યોશી લિમિટેડ બુકબિલ્ડિંગ ધોરણે ૧૦૨.૭૨ લાખ શેરના સંપૂર્ણપણે ફ્રેશ ઈક્વિટીના જાહેર ભરણા સાથે ૨૭ જૂન, ૨૦૨૫ના રોજ મૂડી બજારમાં પ્રવેશ કરશે અને પહેલી જુલાઈના રોજ ભરણું બંધ થશે. શેરની ફાળવણી બીજી જુલાઈએ અને બીએસઇ તથા એનએસઈ પર લિસ્ટીંગ ચોથી જુલાઈએ થવાની ધારણા છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૨થી રૂ. ૭૫ પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. અરજી માટે લઘુતમ લોટ સાઈઝ ૧૬૦૦ છે.

ધારણાં અનુસાર જ ઇન્ડેક્સ ગેપ-ડાઉન સાથે ખુલ્યો અને શરૂઆતમાં નીચો ગયો, પરંતુ ધીમે ધીમે તેઘટાડો પચાવીને પાછો ફર્યો. ક્ષેત્રીય પ્રદર્શન મિશ્ર રહ્યું, જેમાં મીડિયા અને મેટલ ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યા, જ્યારે આઇટી અને ઓટો પાછળ રહ્યા. બીજી તરફ, બ્રોડર બજારોમાં મજબૂત રિકવરી જોવા મળી, જેના પરિણામે મિડ અને સ્મોલકેપ સેગમેન્ટમાં ૦.૩૬ ટકા અને ૦.૭૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.

ગયા શુક્રવારે, ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં તેની સંડોવણીની ચર્ચા કરવા માટે યુ.એસ. દ્વારા બે અઠવાડિયાના સમયની જાહેરાત બાદ, મધ્યપૂર્વ તણાવ ઓછો થવાની અપેક્ષાએ બજારો ઊછળ્યા હતા. જોકે, સપ્તાહના અંતે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર યુએસના અણધાર્યા હવાઈ હુમલાએ તે અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધાં હોવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો અને સ્થાનિક ઇક્વિટી બજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. પ્રારંભિક ઘટાડા છતાં, બજારે કેપિટલ

ગૂડ્સ અને મેટલ શેરોના સુધારાને આધારે તેના મોટાભાગના નુકસાનને પચાવી લીધું હતું, કારણ કે તાત્કાલિક ધોરણે ક્રૂડ ઓઇલનો પુરવઠો વિક્ષેપિત થવાની આશંકા ઓછી છે. દરમિયાન, એકસેન્શરના નબળા નાણાકીય પરિણામને કારણે વેશ્વિક ટેકનોલોજી ખર્ચ અંગેની અનિશ્ચિતતાને કારણે આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

અમેરિકાએ ઇરાન પર કરેલા બોમ્બમારાથી ફરી એક વખત રિસ્કી એસેટ તરફથી સેફ હેવન એસેટ તરફની દોડ જોવા મળશે. જોકે, સાથે એવો આશાવાદ પણ વ્યક્ત થઇ રહ્યો છે કે જો ઇરાનનો પ્રત્યાઘાત સાંકેતિક અથવા તો હળવો રહેશે, તો બજાર નીચા મથાળાથી રિબાઉન્ડ કરી શકે છે. ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હવાઈ હુમલાના અહેવાલ પછી મધ્યપૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે બજારો પર દબાણ વધી ગયું છે. ખાસ કરીને એરલાઇન્સ, પેઇન્ટ્સ અને ઓફએમસીજી જેવા ઓઇલ સેન્સિટિવ ક્ષેત્રોમાં નબળા પ્રદર્શનની અપેક્ષા છે. ઈરાનનું આગામી પગલું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સપ્ષ્ટ ચિત્ર નહીં મળશે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા હોવાથી હવાઈ હુમલાઓથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની પણ અપેક્ષા છે, જે વૈશ્વિક ઓઇલ ફ્લોના ૨૦ ટકાનું સંચાલન કરે છે. ભારતની ઇંધણ આવશ્યકતાનો ૮૫ ટકાથી વધુ હિસ્સો આયાત પર નિર્ભર છે. આ ગંભીર મેક્રોઇકોનોમિક જોખમ સેન્ટિમેન્ટને નબળું બનાવે છે. ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરનો વધારો ભારતની ચાલુ ખાતાની ખાધ, જીડીપીના ૦.૩ ટકા જેટલી વધારી શકે છે અને ફુગાવાને વધુ ઊંચા સ્તરે પહોંચાડી શકે છે. અમેરિકાએ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે, ઈરાનની અંદર ત્રણ પરમાણુ સ્થળો પર હુમલા કર્યા છે. જો ઈરાન બદલો લેશે તો યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપી હતી અને તણાવ ઓછો કરવાની પણ વિનંતી કરી હતી. બજારની દિશા ઈરાનના પ્રતિભાવ પર ખૂબ આધાર રાખશે. ઇરાન જો અમેરિકન એસેટ અથવા કર્મચારીઓને ભૌતિક નુકસાન પહોંચાશે, તો મજબૂત વળતો હુમલો બજારમાં તીવ્ર ઘટાડો લાવી શકે છે અને ક્રૂડ ઓઇલને પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર ધકેલી શકે છે. પરંતુ જો ઇરાનનો પ્રતિભવ પ્રતિકાત્મક રહે તો બજારો આઁચકો પચાવી આગળ વધી શકે છે.

તણાવપૂર્ણ પૃષ્ઠભૂમિ હોવા છતાં, કેટલાક વિશ્લેષકો માને છે કે જો ઈરાન નોંધપાત્ર બદલો લેવાનું ટાળે તો બજારો ઝડપી રિકવરી કરી શકે છે. જ્યાં સુધી ઈરાન આક્રમક રીતે પ્રતિક્રિયા ન આપે, ત્યાં સુધી ઇક્વિટી માર્કેટને બહુ આંચ નહીં આવે. બજારો ભૂ-રાજકીય તણાવની સમસ્યાને પાર કરી જશે.

શેરબજારમાં ઘટાડો થવા છતાં બ્રોડર માર્કેટના સુધારા પાછળ માર્કેટ કેપિટલમાં સુધારો જોવા મળ્યો છે. સોમવારના સત્રમાં આઈટી અને ટેકો શેર્સ સર્વાધિક ઘટ્યા હતા, કેપિટલ ગુડ્સ, સર્વિસીસ અને મેટલ ઈન્ડેક્સ વધ્યા હતા અને માર્કેટકેપમાં રૂ.૧૮,૦૦૦ કરોડનો વધારો જોવા મળ્યો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૦.૨૦ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૫૭ ટકા વધ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૪૨ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૪૧ ટકા ઘટ્યો હતો. સેન્સેક્સની નવ સ્ક્રિપ્સ વધી હતી, જ્યારે ૨૧ સ્ક્રિપ્સ ઘટી હતી.

સોમવારે સેન્સેક્સ ગત શુક્રવારના ૮૨,૪૦૮.૧૭ના બંધથી ૫૧૧.૩૮ પોઈન્ટ્સ (૦.૬૨ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૮૧,૭૦૪.૦૭ ખૂલીને નીચામાં ૮૧,૪૭૬.૭૬ અને ઊંચામાં ૮૨,૧૬૯.૬૭ સુધી જઈને અંતે ૮૧,૮૯૬.૭૯ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૪૭.૬૪ લાખ કરોડથી રૂ. ૦.૧૮ લાખ કરોડ વધીને રૂ. ૪૪૭.૮૨ લાખ કરોડ રહ્યું હતું.

સેકટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ કેપિટલ ગુડ્સ ૦.૯૪ ટકા, સર્વિસીસ ૦.૭૩ ટકા, મેટલ ૦.૭૧ ટકા, કોમોડિટીઝ ૦.૪૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૩૮ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૩ ટકા, એનર્જી ૦.૨૪ ટકા, યુટિલિટિઝ ૦.૨૧ ટકા અને ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૧૩ ટકા વધ્યા હતા. જ્યારે ફોકસ્ડ આઈટી ૧.૪૮ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૧.૪૬ ટકા, ટેક ૧.૧ ટકા, ઓટો ૦.૮૮ ટકા, એફએમસીજી ૦.૬૨ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૫ ટકા, બેન્કેક્સ ૦.૩૮ ટકા, રિયલ્ટી ૦.૧૯ ટકા, પાવર ૦.૧૭ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૧૫ ટકા, હેલ્થકેર ૦.૧ ટકા અને કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૦૩ ટકા ઘટ્યા હતા.

એક્સચેન્જમાં ૪,૨૪૦ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૧,૮૫૪ સ્ટોક્સ વધ્યા હતા, ૨,૨૦૪ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૮૨ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૦૩ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૮૫ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ૫ સ્ટોક્સને ઉપલી જ્યારે ૧૨ સ્ટોકને નીચલી સર્કીટ લાગી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટ્રેન્ટ ૩.૬૧ ટકા, ભારત ઈલેક્ટ્રોનિક ૩.૧૫ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૨૦ ટકા, કોટક બેન્ક ૦.૭૧ ટકા, બજાજ ફિનસર્વ ૦.૫૮ ટકા, ઈટર્નલ ૦.૪૩ ટકા, ટાટા સ્ટીલ ૦.૩૬ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૩૧ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૦૩ ટકા વધ્યા હતા. જ્યારે મુખ્યત્વે ઈન્ફોસિસ ટેકનોલોજી ૨.૨૯ ટકા, લાર્સન ૨.૧૧ ટકા, એચસીએલ ટેકનોલોજી ૨.૧૦ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૫૯ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૨૯ ટકા, ટાટા કન્સલ્ટન્સી ૧.૧૯ ટકા, પાવર ગ્રીડ ૦.૯૬ ટકા, આઈટીસી ૦.૯૨ ટકા, એચડીએફસી બેન્ક ૦.૯૧ ટકા મારુતિ ૦.૯૧ ટકા, એશિયન પેઈન્ટ્સ ૦.૯૦ ટકા, ટેક મહિન્દ્ર ૦.૮૫ ટકા અને સ્ટેટ બેન્ક ૦.૭૩ ટકા ઘટ્યા હતા.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૩૯૧.૬૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૧,૮૦૬ સોદામાં ૨,૩૮૨ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૧૮,૪૮,૩૪૩ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૯૧,૨૨,૮૭૨.૫૦ કરોડનું રહ્યું હતું.

ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં રૂપિયો વધુ ૨૩ પૈસા ગબડીને પાંચ મહિનાના તળિયે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ અમેરિકાએ ઈરાનની ન્યૂક્લિયર સુવિધાઓ પર હુમલો કર્યાના નિર્દેશો સાથે આજે શ્ર્વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યાના અહેવાલ હતા. વધુમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે ૨૩ પૈસા ગબડીને પાંચ મહિનાના તળિયે પહોંચ્યો હતો. જોકે, ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૭૯૪૦.૭૦ કરોડની ચોખ્ખી લેવાલી અને દેશની વિદેશી હૂંડિયામણમાં વધારો થયાના અહેવાલોને ધ્યાનમાં લેતા રૂપિયામાં ધોવાણ સીમિત રહ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૬.૫૫ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૬.૮૫ અને ઉપરમાં ૮૬.૬૭ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે ૨૩ પૈસા ગબડીને ગત ૧૩મી જાન્યુઆરીની ૮૬.૭૦ પછીની નીચી ૮.૭૭ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે સવારે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવતાં ડૉલર સામે રૂપિયો ૮૬.૮૫ સુધી તૂટી ગયો હતો, પરંતુ ત્યાર બાદ ક્રૂડતેલના ભાવ ઘટતાં ડૉલરમાં પીછેહઠ થવાથી આયાતકારોને ડૉલરમાં લેવાલીની તક મળી હતી. જોકે, એકંદરે ક્રૂડતેલમાં માગ પ્રબળ રહેતાં વધુ ભાવઘટાડો અટક્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ જ રહ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સના ટ્રેઝરી વિભાગના હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનીલ કુમાર ભણસાળીએ જણાવતા ઉમેર્યું હતું કે આજે સંભવિત રિઝર્વ બૅન્કની ડૉલરમાં વેચવાલી રહેતાં રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હતું.

દરમિયાન આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૮ ટકા ઘટીને બેરલદીઠ ૭૭.૦૭ ડૉલર આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૬ ટકા વધીને ૯૯.૨૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.

જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૫૧૧.૩૮ પૉઈન્ટ અને ૧૪૦.૫૦ પૉઈન્ટ ઘટી આવ્યા હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વ બજારમાં ઈરાનના વળતા પ્રતિસાદ પર નજર

ડૉલર મજબૂત થતાં વૈશ્વિક સોનામાં નરમાઈ, સ્થાનિક સોનામાં ₹ ૬૫૭નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ અમેરિકાએ ગઈકાલે ઈરાનનાં પરમાણુ સ્થાનકો પર હુમલો કર્યાના અહેવાલો પશ્ચાત્ આજે વિશ્વ બજારમાં ડૉલરમાં રોકાણકારોની પ્રબળ માગ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આવ્યાના નિર્દેશો હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં વૈશ્વિક મિશ્ર અહેવાલો છતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૩ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધી આવતા સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૫૪થી ૬૫૭નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૮૮નો સાધારણ સુધારો જોવા મળ્યો હતો.

આજે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને સ્થાનિક ડીલરોની માગ શુષ્ક રહી હોવા છતાં રૂપિયાની નબળાઈને કારણે આયાત પડતરો વધી આવતા વેરારહિત ધોરણે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૫૪ વધીને રૂ. ૯૮,૯૫૦ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫૭ વધીને રૂ. ૯૯,૩૪૮ના મથાળે

રહ્યા હતા. વધુમાં આજે ૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની મર્યાદિત માગ વચ્ચે ઔદ્યોગિક વપરાશકારોની માગ ઉપરાંત વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોનો ટેકો મળતા વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. ૨૮૮ના સાધારણ સુધારા સાથે રૂ. ૧,૦૭,૦૬૩ના મથાળે રહ્યા હતા.

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકાના ઘટાડા સાથે અનુક્રમે ઔંસદીઠ ૩૩૬૫.૨૯ ડૉલર અને ૩૩૮૧.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૩૬.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકાએ ઈરાનની ન્યૂક્લિયર સુવિધાના મથકો પર હુમલો કર્યો હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે સલામતી માટે રોકાણકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૩ ટકા જેટલો ઉછાળો આવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે વાસ્તવમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધુ ઉગ્ર થવાની ભીતિ હોવા છતાં ડૉલરની મજબૂતીએ સોનામાં ઉછાળો અટક્યો છે. અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઈરાનમાં શાસન પરિવર્તનનો મુદ્દો ઉઠાવવાની સાથે અમેરિકાએ ઈરાનનાં પહાડી વિસ્તારમાં આવેલા પરમાણુ મથકો પર ૩૦,૦૦૦ પાઉન્ડરનાં બંકર બસ્ટ બોમ્બ મારફતે કરેલા હુમલા સામે તહેરાનના વરિષ્ઠ અધિકારીઓને પલટવાર કરવા બાબતે ચેતવણી પણ આપી હતી. આમ વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લેતા આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

હવે રોકાણકારોની નજર ઈરાનનાં વળતા પગલાં પર રહેવા ઉપરાંત આ સપ્તાહના અંતે ફેડરલ રિઝર્વની છેલ્લી નાણાનીતિ અંગે કૉંગ્રેસને આપવામાં આવનારા અહેવાલ પર સ્થિર થઈ છે. જોકે, ટૅક્નિકલ દૃષ્ટિએ હાલમાં વૈશ્વિક સોના માટે ઔંસદીઠ ૩૩૪૮ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થઈ શકે છે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને ૩૩૨૪ ડૉલર સુધી ઘટી શકે, એમ રૉઈટર્સના એક ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું.

પાંખાં કામકાજો વચ્ચે ધાતુમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે નિરસ માગે કોપરના ભાવમાં ધીમો ઘટાડો તેમ જ અન્ય ધાતુઓ સાંકડી વધઘટે અથડાઈ ગઈ હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો અને કોપરની અમુક વેરાઈટીઓ તથા એલ્યુમિનિયમમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો સુધારો આવ્યો હતો.

જ્યારે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪નો અને નિરસ માગે કોપર વાયરબારમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા ઘટીને ટનદીઠ ૯૬૪૩.૧૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા.

વધુમાં આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૨૮૩૪ના મથાળે તથા અન્ય ધાતુઓ જેમાં છૂટીછવાઈ વપરાશકાર ઉદ્યોગની અને સ્થાનિક ડીલરોની માગને ટેકે સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૨૦૬, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૨૫૪ અને રૂ. ૭૭૦ અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ.એક વધીને રૂ. ૮૫૬ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪ ઘટીને રૂ. ૧૩૧૩ અને નિરસ માગે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. એકના સાધારણ ઘટાડા સાથે રૂ. ૯૩૪ના મથાળે રહ્યા હતા.

ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૫૦થી ૩૮૦૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની તેમ જ રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ જળવાઈ રહેવાથી હાજરમાં તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૩૮૯૨થી ૩૯૫૨માં અને રૂ. ૩૯૪૨થી ૪૦૪૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૨૦થી ૩૮૪૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૮૦થી ૩૯૧૦માં ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મલયેશિયા પાછળ આયાતી તેલમાં સુધારાતરફી વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ તાજેતરમાં કંડલા બંદર પર આયાતી તેલના શિપમેન્ટો અટવાયાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં ફરતા માલની ખેંચ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાત રિંગિટનો સુધારો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક હાજર બજારમાં આયાતી તેલના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં ૧૦ કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. ૨૦નો અને સોયા રિફાઈન્ડમાં રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો. જોકે, દેશી તેલમાં મિશ્ર વલણ રહેતાં સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો અને કપાસિયા રિફાઈન્ડમાં રૂ. ૨૫ ઘટી આવ્યા હતા. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો છૂટાછવાયા રહ્યા હતા. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે ૧૦ કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. ૧૧૭૫, સોયા રિફાઈન્ડના રૂ. ૧૧૮૦ અને સન રિફાઈન્ડના રૂ. ૧૪૦૫ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે અન્ય રિફાઈનરોના આરબીડી પામોલિનના ભાવમાં ગોકુલ એગ્રોના રૂ. ૧૧૫૫, જી-વનના રૂ. ૧૧૫૨, ઓલામના રૂ. ૧૧૯૦, પતંજલિ ફૂડના પાતાળગંગાથી ડિલિવરી શરતે રૂ. ૧૨૦૫ અને કારગિલના રૂ. ૧૧૭૫ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ છૂટાછવાયા વેપારો થયાના અહેવાલ હતા.

વધુમાં આજે ગુજરાતમાં ગોંડલ મથકે ૩૦૦૦ ગૂણી જૂની અને ૩૦૦૦ ગૂણી નવી મગફળીની આવક હતી, જેમાં જૂના માલના વેપાર મણદીઠ રૂ. ૧૦૦૦થી ૧૧૮૦માં અને નવા માલના વેપાર મણદીઠ રૂ. ૧૦૫૦થી ૧૩૦૦માં થયા હતા, જ્યારે રાજકોટના મથકો પર ૨૨૦૦ ગૂણી મગફળીના વેપાર મણદીઠ રૂ. ૧૦૦૦થી ૧૧૬૫માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે લલ્લુડી વોકળા વિસ્તારના રહેવાસીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. ચોમાસાના પ્રારંભે ૨૪ કલાકમાં ઘર ખાલી કરવાની નોટિસ મળતા 300થી વધુ લોકોનું ટોળું મનપા કચેરીએ દોડી આવ્યું હતું. કોંગ્રેસની આગેવાનીમાં 'ન્યાય આપો, ન્યાય આપો' અને 'ભાજપ સરકાર હાય હાય'ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. (તસવીર– પ્રવિણ સેદાણી, રાજકોટ)

ગાંધીધામમાં ગાજવીજ સાથે પાંચ ઇંચ વરસાદ: મુંદરાનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: પૂર્વ કચ્છના અંજાર-ગાંધીધામ સંકુલને ચાર ઇંચ જેટલા ભારે વરસાદમાં મેઘરાજાએ ધમરોળાતાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ગાજવીજ અને વેગીલા પવનો સાથે પાંચ ઇંચ જેટલું પાણી વરસાવી દેતાં શહેરના મુખ્ય માર્ગો ભરતનગર, સુંદરપુરી,ચાવલા ચોક, લીલાશા, સપના નગર, કાર્ગો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને અસર થઈ હતી.

બીજી તરફ, બંદરીય મુંદરા પંથકમાં વરસાદનું જોર વધતાં મધ્યમ સિંચાઈનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો થતાં આસપાસના સમાઘોઘા,બરાયા, બોરાણા, ધ્રબ ગામને પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ કરાયા હતા.

ભુજ ઉપરાંત પ્રાંથળના બેલા, મૌવાણા, ધબડા, શીવગઢ,લોદ્રાણી, શીરાનીવાંઢ, બાલાસર, ખડીરના રતનપર, જનાણ, અમરાપર, કલ્યાણપર, ધોળાવીરા, ખારોડા સહિતના ગામોમાં તેમજ લખપત અને અબડાસા, નખત્રાણા તથા રાપર, ભચાઉ, માંડવી પંથકમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે ઝાપટાંથી લઇ અંદાજે બેથી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે અતિભારે વરસાદ વરસવાની એલર્ટ આપવામાં આવ્યું હોઈ સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું હતું. ■

(તસવીર- ઉત્સવ વૈદ્ય, ભુજ)

જામનગરની પીવાના પાણીની સમસ્યા ટળી: પ્રથમ વરસાદમાં જ રણજીતસાગર ડેમ છલકાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: જામનગર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી. અનેક ડેમ છલકાઈ ગયા હતા અથવા ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને પગલે સિંચાઈ વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગામોને સાવચેત રહેવા અને ડેમ સાઇટ પર અવરજવર ન કરવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી.

સિંચાઈ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રણજીતસાગર ડેમ ૧૦૦ ટકા ભરાયો હતો. જામનગર તાલુકાનો રણજીતસાગર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. આથી, ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને ખાસ સાવચેતી રાખવા અને ડેમ સાઇટ પર જવાનું ટાળવા જણાવાયું હતું. ચોમાસાની શરૂઆતમાં જ પ્રથમ વરસાદમાં શહેરનો મુખ્ય જળસ્રોત છલકાઈ જવાથી જામનગરવાસીઓની પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો હતો. આ સિવાય જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનો ફુલઝર-૧ ડેમ ૭૦ ટકા સપાટીએ ભરાયો હતો. ખંઢેરા, નાગપુર, ગોરાણીયા અને વોડીસંગ ગામના લોકોને સાવચેત રહેવા અને ડેમ સાઇટ પર ન જવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં સરેરાશ બે થી સાડા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ હતી. ■

ભાવનગર જિલ્લામાં ઉમરાળામાં બે ઇંચ, ગારીયાધારમાં એક ઇંચ વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાવનગર: જિલ્લામાં ભારે ઝાપટાં સાથે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉમરાળામાં બે ઇંચ, ગારીયાધારમાં એક ઇંચ, મહુવા અને વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

ગોહિલવાડ પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. બપોરે જિલ્લાના ઉમરાળા અને ગારીયાધારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે મહુવા અને વલભીપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સોમવારે સાંજના ૬ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ૧૫મી.મિ. , ઉમરાળામાં ૪૫ મી.મિ.,સિહોર માં ૯ મીમી.,ગારીયાધારમાં ૨૬ મી.મિ.,પાલીતાણા માં ૨ મી.મિ., તળાજા માં ૮ મી.મિ.,મહુવા માં ૧૬ મી.મિ. અને જેસરમાં ૧૦ મી .મિ.વરસાદ નોંધાયો હતો. ■

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થતા ભાવનગર આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો એ ઘોઘાગેટ ચોક ખાતે ગરબા રમી વિજય ઉત્સવ મનાવ્યો હતો. (તસવીર– વિપુલ હિરાણી, ભાવનગર)

વરસાદી માહોલ વચ્ચે તળાજાની બજારમાં સારી ઘરાકી રહી: ખેડૂતો-ખેત મજૂરોમાં ખુશીનો માહોલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાવનગર: તળાજા શહેર અને તાલુકામાં વરસાદી વાતાવરણ રહ્યું હતું. સવારે પાંચ વાગ્યે ઝરમર વરસાદથી મેઘરાજાનું આગમન થયું હતું. દિવસ દરમિયાન ધાબડીયુ વાતાવરણ રહ્યું હતું.

સામાન્ય રીતે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ હોય ગામડે થી લોકો અહીં હટાણુ કરવા આવવાનું ટાળતા હોય છે પણ તેના કરતા ઉલટું જોવા મળ્યું હતું. ગામડાના લોકોની ઘરાકી સારી જોવા મળી હતી. અહીં ખરીદી કરવા આવતા લોકોનાં વાહનો ખાસ કરીને બાઈક બજારમાં જ્યાં જગ્યા મળી ત્યાં પાર્ક થતા જોવા મળ્યા હતા.

વેપારી વર્ગના જણાવ્યા મુજબ સૌથી વધુ ઘરાકી ખેતી ને લગતી સામગ્રી વેંચતા વેપારીઓ ને દિવસ ભર માથું ઊંચું કરવાનો સમય મળ્યો ન હતો. છત્રી રેઇનકોટ બુક્સ અને વિદ્યાર્થીઓ ને જોઈતી ચીજ વસ્તુઓમા ઘરાકી રહી હતી. શાક માર્કેટ,ધનબાઇમાં ચોક, મુખ્ય બજાર ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી હતી. આજની ઘરાકી જોતા ખેડૂત અને ખેત મજુર વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ■

(તસવીર- વિપુલ હિરાણી, ભાવનગર)

કચ્છમાં રહેણાંક વિસ્તારોમાં દુર્લભ બ્લેક સ્પોટ હેડ સાપ જોવા મળતાં અચરજ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: વરસાદની મોસમમાં સરીસૃપો મોટી સંખ્યામાં બહાર નીકળે છે. ભુજની ભાગોળે આવેલા રુદ્રાણી ડેમ પાછળ આવેલા રુદ્ર હોમસ્ટેમાં અત્યંત દુર્લભ રજવાડી સાપ કે જેને કચ્છમાં કુંભારીયા એવું હુલામણું નામ અપાયું છે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

સ્નેક રેસ્ક્યૂઅર જગદીશ પરમારે જણાવ્યું હતું કે, રિસોર્ટના સાપ ઘુસ્યો હોવાની માહિતી મળ્યા બાદ તેઓ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં ગટરના કાણામાં છુપાઈ ગયેલા આ દુર્લભ પ્રકારના સાપને 'સ્નેક કેચર' સ્ટિકની મદદથી પકડીને તેને બોટલમાં પૂરી દીધો હતો. જગદીશ પરમાર અને સાવન ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, તેમણે ચાલુ ચોમાસાની ઋતુ દરમ્યાન ભુજના જુદા-જુદા વિસ્તારોનાથી વિવિધ પ્રકારના સર્પો પકડ્યા છે અને નવ સભ્યોનું બનેલું તેમનું ગ્રુપ સાપોને લોકો મારી ન નાખે તે માટે આ સેવાનું કાર્ય નિઃશુલ્ક કરી રહ્યા છે. તેઓના જણાવ્યા પ્રમાણે ખાસ પ્રકારની સ્નેક કેચર સ્ટિક,હુક અને અમેરિકન બનાવટના હાથ મોજાની મદદથી સાપને પકડી લેવાય છે. આજે પકડાયેલો આ બિનઝેરી 'બ્લેક સ્પોટ હેડ' નામનો સાપ ગુજરાતમાં માત્ર કચ્છ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જ જોવા મળે છે. બિહામણા રૂપને કારણે લોકો તેને ઝેરી સાપ સમજી લે છે. આ રોયલ સ્નેકને ગત ૪ નવેમ્બર ૨૦૧૮ના નરા ગામમાં ડરી ગયેલા ગ્રામજનોએ માથું છુંદીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, તેમજ ભુજના નાગોર ગામમાં પણ આ બિનઝેરી સર્પ ઈજાગ્રસ્ત અવસ્થામાં મૃત મળી આવ્યો હતો. આ સાપથી ડરવાને બદલે તેનું સરંક્ષણ કરવું જોઈએ તેમ તેઓએ ઉમેર્યું હતું. ■

(તસવીર- ઉત્સવ વૈદ્ય, ભુજ)

રાજકોટમાં સ્વ. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: શહેરમાં ૧૨ જૂને તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમના હોમ ટાઉન રાજકોટમાં ભાજપ દ્વારા કમલમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિક્કિમના રાજ્યપાલ અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી ઓમ માથુર પણ સામેલ થયા હતા.

તેમણે સ્વ. વિજય રૂપાણીના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં વિજયભાઈ રૂપાણીના રાજકોટ તેમજ રાજકોટ શહેર ભાજપ સાથેના સંસ્મરણોની તસવીરોમાં દર્શાવવામાં આવી હતી.

રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, વિજયભાઈના નામની આગળ સ્વ. લગાડવા મન માનતું નથી. અમે બંને એક કેડીના કાર્યકર્તા કહેવાઈએ.

હું એમનાથી થોડો મોટો છું અને આપણાથી નાના વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવી એ સૌથી મોટો ભાર અને પીડાદાયક સમય છે. તેમણે વિજયભાઈ અને અંજલીબેનની જોડીને ભાજપમાં કાર્યકર્તાઓની આદર્શ જોડી ગણાવી હતી અને આ જોડી તૂટવાનો રંજ વ્યક્ત કર્યો હતો. ■

વર્ષ ૨૦૨૦માં કંડલા બંદરેથી કરાંચી જઈ રહેલા જહાજમાંથી ઝડપાયેલું 'ઓટોક્લેવ' પાકિસ્તાની મિસાઈલ કાર્યક્રમનો ભાગ હતું!

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: કોરોના કાળની શરૂઆતના વર્ષ ૨૦૨૦માં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલાથી પાકિસ્તાનના કરાચી બંદર તરફ જવા નીકળેલા માલવાહક જહાજમાંથી જપ્ત કરાયેલા 'ઓટોક્લેવ'ડ્યુઅલ-યુઝ સાધનોનો સંબંધ આ નાપાક દેશના નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ કે જે મિસાઈલ કાર્યક્રમને ડેવલોપ કરવાના કાર્યક્રમમાં સામેલ હોવાનું વૈશ્વિક આતંકવાદ નાણાં પુરવઠા નિયંત્રણ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ખુલાસો થયો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ૩જી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ કચ્છના મહાબંદર કંડલા ખાતેથી કરાંચી જઈ રહેલા 'ડા કુઇ યુન' જહાજમાંથી પૂર્વ બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓએ મિસ ડિક્લેરેશન વડે ઘુસાડવામાં આવેલાં ડ્યુઅલ- યુઝ સાધનો કે જેનો ઉપયોગ મિસાઈલ મોટર્સના ઉચ્ચ-ઊર્જા સામગ્રી, ઇન્સ્યુલેશન અને રાસાયણિક કોટિંગ માટે થાય છે તેને ઝડપી લેવામાં આવ્યાં હતાં.

મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રેજિમની ડ્યુઅલ-યુઝ નિકાસ નિયંત્રણ સૂચિમાં સામેલ એવા આ જપ્ત કરાયેલા કાર્ગોના બિલ ઓફ લેડિંગથી સાબિત થયું હતું કે આયાતકર્તા અને પાકિસ્તાનના એનડીસી વચ્ચે સીધો સંબંધ હતો, જે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલોના વિકાસમાં સામેલ છે.

એફએટીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓટોક્લેવ્સ જેવા સાધનોની નિકાસ વિવિધ સત્તાધિકારીઓની પૂર્વ મંજૂરી વિના કરવી કાયદાનું ઉલ્લંઘન છે. રિપોર્ટમાં વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાં સામૂહિક વિનાશના શસ્ત્રોના નાણાં પુરવઠાને રોકવામાં નોંધપાત્ર ખામીઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. ■

કેરા ગામે એસએમસીએ પાડેલા દરોડામાં ૧.૨૮ કરોડનો અંગ્રેજી શરાબ ઝડપાયો: બાવીસ લોકો સામે કાર્યવાહી

(તસવીર- ઉત્સવ વૈદ્ય, ભુજ)

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: નશાખોરીની બાબતમાં 'મેક્સિકો' બની રહેલાં ભાતીગળ પ્રદેશ કચ્છમાં બેરોકટોપ પણે ચાલી રહેલા શરાબના કાળા કારોબાર પર ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલે જાણે ઝુંબેશ છેડી હોય તેમ વહેલી સવારે ભુજ તાલુકાના કેરા ગામે જડેશ્વર મંદિર નજીક ખુલ્લાં ચોગાનમાં શરાબના થઇ રહેલાં કટિંગ ટાંકણે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો પાડી, ૧ કરોડ ૨૮ લાખ ૩૮૦૮ની કિંમતનો શરાબનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે ૨૨ જેટલા શખ્સોની ધરપકડ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચ્યો હતો.

એસ.એમ.સીના પી.એસ.આઈ એસ.આર. શર્માએ જણાવ્યું હતું કે, પૂર્વ બાતમીના આધારે કેરા ગામના પ્રખ્યાત જડેશ્વર મહાદેવના મંદિર પાસેના ખુલ્લા ચોગાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ વેળાએ રાજસ્થાન પાસિંગના સિમેન્ટ બલ્કરમાં છુપાવીને લાવવામાં આવેલી દારૂની બાટલીઓ સ્થળ પર પાર્ક થયેલી બોલેરો પીકઅપ અને ટાટા મીની ટ્રકમાં શ્રમિકો ગોઠવી રહ્યા હતા. ચોગાન પરથી પોલીસે બોલેરોના ડ્રાઈવર ગોપાલસિંહ બનેસિંહ વાઘેલા (રહે. કેરા), મીની ટ્રકના ડ્રાઈવર શિવરાજ વીરમ ગઢવી (રહે. અલીપુર, અંજાર), ડ્રાઈવર કમ હેલ્પર ગોપાલ કેશાજી રાજગોર (રહે નવાનગર, પાનધ્રો, લખપત) ઉપરાંત ૧૩ પરપ્રાંતીય શ્રમિકોની ધરપકડ કરી, ૧.૨૮ કરોડના શરાબ ઉપરાંત ૪૨ લાખના ૩ વાહનો, ૨૫ હજારના ૫ સ્માર્ટફોન વગેરે મળી કુલ ૧ કરોડ ૭૦ લાખ ૨૮ હજાર ૮૦૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલાં ૧૬ આરોપીઓ ઉપરાંત ૬ શખ્સોને વોન્ટેડ દર્શાવ્યાની સાથે બાવીસ જણ સામે પ્રોહિબિશનની વિવિધ કલમો તળે સરકાર તરફે માનકૂવા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. દારૂનો જથ્થો કેરા ગામે રહેતા બૂટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડે મગાવ્યો હતો, પરંતુ તે પકડથી દૂર હોવાનું એસ.આર. શર્માએ ઉમેર્યું હતું. ■